2010 Before -Satpanth Manuscript 26 (176)




realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com

Note:
1) In the actual book, pages are not sequentially numbers
2) In the actual book, there are page numbering errors in some places.
3) This scanned file has exactly all the pages and in the same order as in the actual book.
4) In spite of some missing page numbers (in the actual book), you may notice, there are no missing pages in scanned file.
5) Initially some pages are up-side down. But they are so in the actual book. Hence page orientation is also maintained.

realpatidar.com

[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]

[illegible]


realpatidar.com



realpatidar.com

[illegible]

[illegible]



[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]


[illegible]

[illegible]



[illegible]

[illegible]



[illegible]

१ [illegible]

२ [illegible]

३ [illegible]

४ [illegible]

५ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

१ [illegible]

२ [illegible]

३ [illegible]

४ [illegible]

५ [illegible]


६ [illegible]

[illegible]	८	२	७
७	३	७	५
८	३	८	२
४	५	४	७

८	१५	२	७
७	३	२२	११
१८	१८	८	१
४	५	१०	२३

जंत्र २० सरव णपर चाउंछे

गावसगातीनु छे २ २ रवणपर खवाते



ॐ

वि ८	ऐं २	ऊ ७
क्लीं ३	सुं ५	ऐं ९
वाँ ४	चें ६	ह्रीं २

उनतेयु जोयु नीक वोरा रवणपरसाडे

भाइ नयुरा [illegible] रव णदेखाय

[illegible]

[illegible] ६२२२ [illegible]

[illegible]
[illegible] ॥૨૩॥
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]	[illegible]	11	17	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	तेथा घर मा[illegible]
12	12	[illegible]	[illegible]	तेथा ट ६ ३
11	[illegible]	0	[illegible]	[illegible]
1	8	६	[illegible]	[illegible]

[illegible]

[illegible]

[illegible]

૨૮ ગોરખનાથના [illegible] પાના
લખ્યા છે

૧	અગોઅરી લખી છે	૧
૫	અગોઅરી	૨
૧૨	અગોઅરી	૩
૧૪	અગોઅરી.	૪
૧૫	અગોઅરી.	૬
૨૦	ગોરખનાથનો [illegible]	
૬૧	ગુરૂ મતગોરખનાગો કેરી-	
૮૨	અકેવરી ૬૬૬	
૮૩	ગાયંત્રી સાર	
૮૮	ગંજુલ અર [illegible] લખી છે	
૯૨	ખાકી ચલન લખી છે	
૯૭	[illegible] લખુ છે	
૨૦૧	ખાકી ચલન લખી છે	
૨૦૩	ગુરનાજું લખુ છે	
૨૩૧	ખાકી ચલન લખી છે	
૨૩૭	[illegible] લખેલ છે	

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

अतीकभाएथी आरण सात:त्रप
नेहे:त्रपाभाएथा सारण हत:म
थीभाए था सारणमां भा:नेतन
भाएथा सारण गना: नेकी भा
एथा सारण नील: सरीरभाए
था सारण नीरंगनाग: द्वारभा
एथा सारण नीद्धोरी: रंपाभाएथा
सारण राई: एकपंप रंपाचं भल
भराई: तारे सत द्योएते नेकई
ए सत: सत तेने सील नवती:
सत था सत ए राम्ह सील:त्रपने
सतस्न रानाने ले भील: सतेस्न
रारणु भालेंड: सतवांडी सनाहेर
भात रं: सतस्न रांहे पेदानः

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

पा मततपना पमनापमनाः तेपणा
एक दीपासे पमनाः पम पामततप
काहुरे भिलाः के सोपदापकरी ऐस
लाः का कोडा कालाम्प सपाहेः गोपा
पनाइ लते ए जोनाएः ए पागोलेना
पारेप राःपाः पे टता दुकरनेद
राः पाः श्री टेप टे शीटा पासोः ते नेणा
पागा जा म ती ना सोः ने पाते ना पेच
नपरीः सक ना पुंपलक पणापप
रीः ने णाछे रे नाटापाकः ने णा नापु
पे रला को कः ने णा हुंपाने मरा केरे
ताए कपम राम मनेपडः टे माटेक
रने णाः पादापादा शीरपामर
णाः न रक रा मनपामारीः ता ने हरप
ने हुपामारीः तने करापरहीसा रा॰

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

लताङुं: सठताघरे रे=पाताङुं:
तंनगतसामोटेनाङुं: घरनास्क
हरीनारी: नजेतारुंविधुनारा
री: नोलघरनकोतारी: करनोपा
पतघुपंर: पछेपरानघेर: नें
तंनपापडताजेरें: नवछसाक
रेकामोतंनपाराहीछेनामो: घर
मास्कहरीकाघा: केहीलतटेक
नाघा: पं ननपासपारंकरे
नपनोसंकार: =पावोहीङुं
नंताघा: नपा=पनतङुंमाव:
घरमाघघुछेहीवत: तारीकेपा
पारंगत: हरननधाकोहरता
तारकेवापासंगती: टेजेनक
पंछिछेकन: षपंकरस=पापु

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

थो।रुवा।धु: हा।हु।रे: सा।मकरो
करो।हा।सामरतध।धा: सेवक=पा
वो।तमासारगु:हासथो।लेवध
थे।हु:=पा।न पारे।गु=पावा।थ
लेना।म: श्री।पा।र्ड गो।रनरने
हु ले।ऽपा।ए: लछहा।ना।छु तेहान
करना।ए: रनवपा।रागु।न=पा।मे
=मा।न: मा।रुन रना।मा।ले ध=मा
न: नथा।पागा।लपा।ठका।एमगु:
मा।ग्रा=पथसरने।मेहना।गगु
=पलेप थो।ध केवा।ए मा।री: नहे
करता।गगुए लमा।री:गो।गुगा।
पा।ने।घगु।छेफे रेम:फेरपा।लम
फेना।केपा।ए केम: घा।मणि मोको।

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

२५

मे व्योलाए छे: [illegible] ऊपर
नजा रहीजाजना कहे: कार
पातनापाद्या ऊंगमा है: मानात
पप कहे ऊनचे ऊपान: सति तान
न सति रान्या घे ऊपान: गोर
ना ठाला ऊंपा सा ते छे रे सार्ह:
नातान्हे वह घा मही से नहीं: घ
रपारतारसा जाममाए: तारेस
मन सति लेपा पाए: गनानगा
पजा रनरना रे व्याले: रहपीक
पा सतिनामतव्योले: घरपार
घरे ने अवितापीए: सपतधरम
पा सतिपपा हाए: तेते सतेमा
पापन ने एवा: नापा पहीकार
नाघामननवा: केर लाघामना

कहेवचमाख: ठाली=वाचमर
जी=धारसधाख: धना राधधी
नारेवारानेः वारेजा राचधी
सदावाछाने: राकाजानदारे
कनतम रेपाधी: गारेए वाका
रधारे=धाधी: धरमातेमजन
सहुन=धावे: धछेगारनेसाच
जेरेनावे: सारीसावाहुनध
रसाखुः नदोधजननावा
रसाधा: [illegible] एवारसा
नाधाजना: वाजानाकहुछध
वा: सहितानननसहेसाधी:
कंपारादाईजाजानें: नवधवे
वासनवहदीपननागधहनता

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥१३॥

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

realpatidar.com

[illegible] ॥ ३७ ॥ [illegible]

[illegible] ॥ ३८ ॥ [illegible]

[illegible] ॥ ३९ ॥ [illegible]

[illegible] ॥ ४० ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

नवारमवाः=पसम्पहीपनापा
पं=पावाछे:वाहाधरमपापा
पंठाछे: ॥२५॥ वाहापानर
रतगाररमवारमवाः पपरना
नहावेहं वाहा=पावाछे: तेजा
एः सावितरत पपरपछनाछे:
॥२६॥ वाहापानर सतगोर
पपरनी नहीने=पाते दे=पाव
छे: ॥२७॥ वाहापानर सतगोर
गरदकांटमा=पावाछे: ॥२८॥ वा
हापानर सतगोर रमवारमवाः
काफरन गारमा=पावाछे: ॥२९॥
वाहापानर सतगोर रमवार
वाः मोतीपरमा=पावाछे: ॥
॥३०॥ वाहापानर सतगोर रसे

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

जी कुच्छोलाए:॥३०॥ कानीघाली
जीआहाके राजतयालोसाराः त
रानाए साथै लेहोतेपायारः॥३१
रानाए भरआगार रुपकहीः
ऋषाजहे वचनआ ऋषभरजनाए
आः॥३२॥ ए वा ऋषभरतयात
पुनारे कहीः रानाभनआस
भजोसाघे:॥३३॥ साकलेसला
सुरानागाए ऋषोः हे वाचनानाथे
भिलारहोः॥३४॥ हे वचनआ ऋा
वाधे होरसहे:दः ते ऋषा वानेपा
रकुलोजोपाए:॥३५॥ रानाए
भनभाकुरीपोभाराः एत्रताव
नकोसारनन होरः॥३६॥

[illegible]
[illegible] ॥३७॥
[illegible]
[illegible]
[illegible] ॥३८॥ [illegible]
[illegible]
[illegible] ॥३९॥ [illegible]
[illegible]
[illegible] ॥४०॥ [illegible]
[illegible]
[illegible] ॥४१॥
[illegible]
[illegible]
॥४२॥ [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

घेरघेर आनंद अंलीघणा ॥ घेरघेरे
गोसटी जाणो ॥१०२॥ घेरघेर सुकरीत
करे काम ॥ घेरघेर सउपाले धरम ॥१०३
फकीरी फकीरीअे ॥ घरन सकाळे ननि ॥ अ
नेकसरव नगर जांहे ठरी नाम ओमर
॥१०४ नगरनुं नाम पीरांण पटण ओमे
र ॥ अनेक हुओ अे पीरसा जाणजे ओमे
रे ॥१०५॥ नुरस तगोर राजने जा ॥१०५
पीरांणपटण ईस नगरी कोणा जतुवा ।
॥१०७॥ तारे नुरस लगो रेके आ राजनेमर
मा ॥ तने पाको नुरपल सतपंथनो धरम ॥
१०८॥ तारे नुरस लगो रहसलाहे सगमा ।
राजा मनजा हे संतोकला आ ॥१०८
अ सन दीपजाहे पहोगा जस्मे ॥ पारस ॥

પાટણ નગર માંહે આનંદ ભયો ॥ ભાઈએ ॥૧૧૦॥
તેણ ભરતખંડમાંહે ગોરજીએ કીરપા કરી ॥ વીર
નંય સરકતી· ભજુ દીપે અવતરી ॥૧૧૧॥ જાંબુદી
પ નગર નવસારી ગામ ॥ તે સમુદર તે કેઆ લેહ
હામ ॥૧૧૨॥ નગર નવસારીએ તેમ આએ·
તાહા રાજા રાજ કરે સુરમંદ રાએ ॥૧૧૩॥ સુર
મંદ માહા જુગ પવીત્ર માહા ધરમ ॥ સતગોરના
મેહુરા કરમ ॥૧૧૪॥ તે રાજાને ઘેરે કેના અવત
રી ॥ તેહ રખ માહા પરવાર માહા પરભે હરી ॥૧૧૫
કેના સુદર રૂપ અપાર ॥ અને આદ સરેત સાહે
પતરી નાર ॥૧૧૬॥ તે હોએ તે ગણ કેહું તે હામ ॥
બોલા વોલે સોજે પાકવું નામ ॥૧૧૭॥ આ પાલે
તરી પંડીત તાએ ॥ તે રાજા પાસે બેઠા આએ ॥
॥તે બોલા રાજાએ પંડીત સુંમરસ ॥ તમે જુવોને
એ કેના તણા કરમ ॥૧૧૮॥ કોણ રેપ એ કેના આવ

અને રાજાના મનમાંહે વીમા સરગ પાએ ॥૧૨૦॥
પંડીતની વાત રાજાએ સુણી ॥ એ રુનાપર રણસે
કેસરીનો ધણી ॥૧૨૧॥ સુણોરે રાજા પુસતકમાં
આએ ॥ એરુ નાલ મનવચકોહ માંહે લેઈ જાએ
॥૧૨૨॥ રાજાએ વાત પંડીતશું કરી ॥ કોણ વખ
તમાં એ રુના આઈ ॥૧૨૩॥ દીપ્યો પુસતક પંડીત બો
લે પાહાર ॥ એ રુના આઈ સરુત અવતાર ॥૧૨૪॥
કોણ રુપે એ રુના આઈ ॥ રાજાને મનવીમા સરગ
પાએ ॥૧૨૫॥ એ રુના પીવંઈ સતમાં રાઆ દેર
એ રુના એ સીજનનો ગીરુર ॥૧૨૬॥ એ રુના પી
હોસે તમારે નાન ॥ રાજા સરગ માંહો સેતમા
રો હામ ॥૧૨૭॥ એ બોલે દવીમાર પંડીત રુઅ
રાજાને મનમાંહે હરખ જાલ આ ॥૧૨૮॥ રાજાએ
રુના ઉપર ધરો પે આર ॥ ખરમો ખજનો ગાર
ગંડાર ॥૧૨૯॥ જન જન રુનામોટી પાએ ॥

રૂપ અરૂપ· પદમ ણી કેવાએ ॥૧૩૦॥ પરસધી
બીએ ણી પેરે થાએ॥ રાજાનો તન માંહે ન રખ
નામાઅ ॥૧૩૧॥ પરસપાસ જીકે નાંહેઈ· વાત
પમન એકે બોલણો આઈ ॥૧૩૨॥ બોલાવો પંડી
તપ્રાણી આપણો॥ ખોલાવો જો આ પર કેનાત
ણો ॥૧૩૩॥ રાજા ગોર પર ધાન બેઠા પરવાર·
કુણાનાવી વાનો કરવો વીચાર ॥૧૩૪॥ રાજાગો
રપરધાન બેઠા જો ડ॥ કુનાપાલણ હેતમારા
પીયાણી વાત કેરે તમારો પોતા કોડ ॥૧૩૫॥ આપ
મન કુહુ છું તે રૂદા માંહે ધરો॥ અમારો પરતાંત
એનાકરો ॥૧૩૬॥ અમારો પુરસર્જ આપસે એક
જનર॥ તેના ગુણતણો નાઆવે પાર ॥૧૩૭॥
અમારા પરણોકોઈ પાર ના લે ઠ॥ અમારો પર
તો એસ ત્રદીપમાં રેહ ॥૧૩૮॥ એવો વીચાર કેના એ
કીધો તારે રાજા પરવાર॥ અમરતત આ ॥૧૩૯॥

વરસ પાંમ નો પાલણદે કે ને। સરવે પરવાર
તારે અમરતલ કે ॥૧૨૦॥ સરણો પોતાજ વસ
ન કેહુ છું તા એ॥ સાત ખંડ માં ને ગોરવ વરછે મોએ
૧૨૧॥ સાત ખંડી મેડી બનાવી તા એ॥ તે ઉપર
કનાએ હીનઈ॥૧૨૨॥ વર પીરસરુ કરતા બનુંહી
વસન આ॥ સરણો પીતાજ વાત કેહુ છું ઈઆ॥૧
૨૩॥ એક પારધી આકર સોપો મોએ॥ તારે રાજ
એ પારધી સોપા છે તાએ॥૧૨૪॥ સરણ રે પારધી
પાલણદે કુને॥ નેરુ આકરી મારી માંરહે॥૧૨૫॥
નીત ઉઠી ને ફરવા વનમાં જાએ॥ મને એ કે
સેરંસ॥ હરણ કોલા એ॥૧૨૬॥ તેને સલાવી પાર
ધીઆ ઈપાસે ધરે॥ તે પરમાણે ને પારધી કરે॥
૨૭॥ તારે નીત પારધી વનમાં જાએ॥ નીત એક
હરણ વધેલ ને ઠાએ॥૧૨૮॥ તે સર સંસ આલ કે
નાને જઈ॥ તારે પછે પારધી પોતાને ઘેરે જાઈ
૧૨૯॥ કના ઝંસના ને આગ ળી દે ઠે॥ તેની તાને

ણોઆવાદલેને ॥૧૪૦॥ તેમંસલેઈ મુરેજેરે· તેમેક
ખાઈખાણણણએર ॥૧૪૧॥ એનકેરતાવરસ
ગઆ અગીઆર ॥ લારજુરસતગોરપણતાંપો
તેપધાર ॥૧૪૨॥ કણાતેડીએબેઠીએકેળ સંત
લાડાળકેરબંદગીકરે એકે ઘેઆણેલ ॥૧૪૩॥ લા
રેજુરસતગોર દેઆ ધરી ॥ એણણજુદીપમાં
કીરપાકરી ॥૧૪૪॥ સેસ ન દીપપી સાલીઆવા
દેવ ॥ કે હિસ્સાણમાને કીધાપરવેસતતપખેવ
॥૧૪૫॥ સાથેજુસાફરલીધા દીએ ॥ નગારણવસારી
માંઆવાસોએ ॥૧૪૬॥ નગારણવસારોમાંઆવા
સહી· પછ ન દીસામાં બેઠાળઈ ॥૧૪૭॥ જંગલ માંને
પીરબેઠાળઈ· અનેસરવેજણાવરઆવાતાએ
સતા જંગલીજણાપરરહી આતપે આ· તેપીર
કેપા સેજઈ ઉભારઆ ॥૧૪૮॥ તેમાંડેઆવા ઠરરા
એઅઉલ· તેપીરપાસેજઈ કરેકે[illegible] સોસ ॥૧૫૦॥

તાડા આવા વાઘ ને સીતરા જણ॥ રીછ સીયા
ળ લીઆ ઘણા પરમાણ॥૧૫૧॥ તે જંગલી હસ્તી
અસ્વ ગ્યા॥ તે પીરપાસે જઈ ઊભા રીઆ॥૧૫૨॥ તે જ
ંગલમાં જનાવર પંખી સર્વ ઉપન્યા॥ તે આવા કર
ે પીર ને પાએ॥૧૫૩॥ તાડા આવા સાલ ઝાડ ના
રોપાં તે માંહે મોર કરે બહુ કલોલા॥૧૫૪॥ તે માંહે
વાલા વસાન તેલ સાઘણ॥ તાડા બગલા તણ
ા પરવાર અતી જાણ॥૧૫૫॥ તે માં ગાઅ ઘોડા ને
અપાર॥ અ ઉંટના સાલહેસ હુએ વદે વીમાર
૧૫૬॥ જાઈ એકેક નકેક અઉંટ મોહોર તારે વેહે
જેહી પાછલી પોડાર॥૧૫૭॥ આવે મોહોર જનાવ
ર બાંધી રીઆ ઠામ॥ તેણે આદ બાંએ અનેક॥૧૫૮
પારધીઆ વાગોરન આસી સદે વા॥ અને સરવ
જનાવર ઉપરે ગોરની સેવા॥૧૫૯॥ ઝરસત ગોરે પા
રધી ઉકરીઆ॥ અરે પારધી કેમ ઉદાસ જ રીઆ॥૧૬૦॥
કારણ વસારી જાંપાલણ દેના વાસ॥ તેન

ઉઠીને રણુ ક્રોર કે ર અને માગો માં સ ।।૧૨૧।। માસત્રા
પાળેપારધા ઘેરગ આ ।। તેમાં સરાણી પાલણ દેઉ
ઠાનરકીઆ ।।૧૨૨।। મારો માં આગ લો બાલો ને મુખ
માંમાખીજે વારે ।। મઉદેળ વળની સુજપડવાલા
ગીતારે ।।૧૨૩।। રાણી બાગ ન માં અમરતળ ભો·
તારેપારધી કુ બોલાવી ને પુછીને દેજો લીઆ ।।૧૨૪ તા
રેણુ રસતગોરલા ઠા રાજા એ પારખીઆ ।। તા ઠાજ ઇ
રાજપાએ પડીઆ ।।૧૨૫।। તારે નુર સતગોર
બોલાવાલ· તા ઠા રાજ ને નસતગોદી ધોઠાવે
૧૨૬ તારે રાજા નાન ના આવો વોસવાક
એ છે તેણા જવળ ના પુરણ ઠાર આ સ ।।૧૨૭।।
તારે પારધીઆ વી ઉભા ને રઆ ।। તા ઠાવઆ
ને દસરવેરાણી કુ કે આ ।।૧૨૮।। તારે રાજાતે ડાવા
એ વાકુ રમંદરાઅ ।। તારે ગાવી પાલખી મ
ળ્યઆ ઠરખીત તા એ ।।૧૨૯।। જવેરણો ઇછા

હોતીલેદેવઆવા છેહોરાઅે· તારેરાજાનાન
નાંહરખજેથાઅે ૧૮૦॥ તારેછુરીયાલેપીરથા
સેગઆ· જંગલીજનાવરજે છ હરખીત થઆ॥૧૮૧
તારેજુરઅલગા રેરાજાઅે પારખીઆ॥ તાહાજેછરા
જાપાઅેપડીઆ॥૧૮૨॥ તારેરાજાતાહા હરખાઅે
પાર· અેછેત્રણજાવનકો તારણહાર॥૧૮૩॥ તારેપી
રખોલાજાજોગીનાથ· તમેસુણોરાજાઅેકેધેઆં
ન॥૧૮૪॥ તાહાજાજોગીનાથનો પારેવીયારજો
આ· તાહાઅેપુંસુણીરાજાઅમરતજાઆ॥૧૮૫
તાહાલાવાઈમાંનરાજાલતવખેવ· અમારેનીમધ
રમહેજુતાલમે આવા હાદેવ॥૧૮૬ તાહાજંગલીજ
નાવર· સરવે હરખીતજાઆ· તેપીરસાથેસ
હુમાલીગઆ॥૧૮૭॥ તારેપીરપાલખામાં બેઠાસઈ
અનેરાજાસંઘારમાં ઉતારેજઈ॥૧૮૮॥ તારેરાણીપા
લણદે હરખાઅપાર॥ તારેજુરઅતગારે દીઠાદાપા
॥૧૮૯

રાજાએજે સીતેડા વાસતી। લગનજુરતનીવાત
જોઈતી।૧૭૦॥ ઘડીઆ લગનજુ પોતતવખેવ।
પરણવાછેવછઈ ગોરદેવ।૧૭૧ ઘડીઆલગનછે
(આતન)
આતાન સાર। સવરાંતડપરસાતેણીવાર।
૧૭૨॥ સીરસના પોરીનીજવરંગ। માંડવામાંતે
થવા લાગો નારારંગરંગ।૧૭૩॥ તાહાંજન
ગણીઅલીસેઘણી। તારેજુરસલગોરઆવા
પાલણદેનાઘણી।૧૭૪॥ જાનજવ …
ગનતાસાહાર। માંડીજનતાતાબહુઅપાર
૧૭૫ સુરસંદરાજાએદીધાકનાદાન। તાહાંસ
કુંકેએને આલાદાન।૧૭૬॥ ફોફ તપાન સેજ
તજાછજીઆ સાહાર। સોવરણજ ફૂલેવધાવાતે
વાર।૧૭૭॥ ગાંગાબાઈ આપી પાલણદેનીસાથે
આસાસાકરઆલો …।૧૭૮॥ મોહોલમંદીર
આલાકેવલાસ। તો … પારનપાલણદેકુંવાએ
કુંવરબાસ।૧૭૯

ઉતમને પુછું સતગોર જેવ॥ તમે ધરમ વધાર
વાળાઓ છો પંથ॥૧૯૯॥ પીરજી કોઇ રાખે સામી
આસ સધીર॥ તો તમ વીના કેમ રેવાએ લગાર॥
૨૦૦॥ દેવ પરકાસો તમે મન રૂપર॥ અને સેવેસ
મકોઇ સતગોર જુર॥૨૦૧॥ આ યામે પીખુ છે પાલ
ણ દેહ કુળ દી॥ તમે ના આવો તો સેજીની સામી
દેવ॥૨૦૨॥ તમે અંત ધાવણ પાઓ સતગોર
સાહેબ તમે હમારા ભાઆ॥૨૦૩॥ રાણીએ પુછુ
આજ તમો છો ઘેર॥ તમો ના આવો તો આકરી
એ પેર॥૨૦૪॥ અમે એકલા કેમ રહીએ ઘેર॥
તમે ના આવો તો અમારી આ પેર॥૨૦૫॥ તારે જુરે
સતગોર બોલા પરમાણ॥ તમ મોહે રદેહ આ વીસુ
સહીનાણ॥૨૦૬॥ અમો ના આવા ના ઇ છે મેર જ
ન માંય બેસેલ તેલા પાએ ધરમ॥૨૦૭ સાયાનુ
પીન રાણીએ હકીગત જે કહ॥ ગોરના આવા

નીનીપન્ન કછ ॥૨૦૮ માંખી બેસે કો આ ઉપરનાણ
તારે અમોનથી આવીએ જરવાણ ॥૨૦॥ તારે ત્યાંયા
એખાં ડના છાટણાં છાટા તારપુર ॥ તાં ખોટી એમાંથી
કુછનુ ર ॥૨૧૦॥ તેડાવી રાણી તમે જુવોન દ૰ ઠયે
જાણોના આવા દેવ ॥૨૧૧॥ તારે સામામુખી એ ગતનું
ક આ૰ અને જુર સતગોર પરદેશ આ ॥૨૧૨॥ એવો
સામામુખી એ કઠા છતા દેવ ॥ ઠયે નથી આવે એ દેવ૰
૨૧૩॥ તારે બોલો લાડારો કીધી ઘાત ॥ તા ઠા સરવેમળી
આ મોર છે સામો કીધી ઘાત ॥૨૧૪॥ તા ઠા એકેબા
લકુનો ઘાટ ડાર ॥ તને સામા મુખીબા લાવે એક
નેઘાર ॥૨૧૪॥ સતગોર ઉ ઘવા કરાકે જુલ૰ એ ગત
સરવેનમાં ડીછેજુલ ॥૨૧૫॥ તારે જુર સતગોર આ
પાપોપરનાયે સે૰ તા ઠા આવીન બેઠા ઘરનાનેવા
પાસે ॥૨૧૭॥ એ વાકુ કરા ૨ કરાછ સામો જુબી૰ તારે ગત
સરવેપદ ઈછે દખી ॥૨૧૮॥ કાઈ અમારા માને છે

તમારીગતસચ જીતરેશેહ ।।૨૧૯।। તારેપોપટ
જાણેસહુગત ।। સાતીઅજોતેતજોઆ લાખુગત-
૨૨૦।। તેઆઆમુખીજાકેઆમાંર હીગત આરી-
લારેતુરઅલગોરેલીધોજુદો અવતાર ।।૨૨૧।। જીજુ
તમોજીતખાં ધેલીધો સુતાર ।। લેઈમુલારજેઆ
યાછેજેપાર ।।૨૨૨।। ગતસગજીએહીછેજતાં. તાજ
મારોડાંગાતેઆછાલાકેછેતાતા ।।૨૨૩।। જોતધર
જાધઉછેફોડ. જોતધરતાતણી સુધગઆછેજુલ-
૨૨૪।। એતકેઆઆજતેકેલજુગમાડા. ગીતાન
મુલતાવીમારૌતેડા ।।૨૨૫।। તાડાપીનાડાગઆ
મધમઘેર. ઠવેઆપણેસુંકરીસરૂપર ।।૨૨૬।। જુરસ
લગોરબોલાગેતાત. ગત કઉઆંતજોએકેધેઆ
ત. ।। ।।૨૨૭।। ગીતાન. ગાયત્રી સંપુરણ છે. ❀ ।
।❀।।

2010 Before -Satpanth Manuscript 26 (176)

॥ ॥ ॥ ॥ ॥ ॥

॥ અકરબ રોઇરૂઇ લખ્યું છે ॥ ॥ ॥

॥ બારમાસી લખાડ ॥ ઈરરકેમાં નમ નોરરકી

મ·ી અસ સલાતો ॥ વસ સલામો ॥ અલે
કૂ ઇચ્છા ણબીઉલા ॥ ૧ ॥ અસ સલાતો
વસ સલામો ॥ અલેકૂ ઇચ્છા રસુલી
લાહા ॥ ૨ ॥ અસ સલાતો ॥ વસસ
લામો ॥ અલેકૂ ॥ ઇચ્છા અબીબુલાહ
॥ ૩ ॥ અસ સલાતો ॥ વસ સલામો
અલેકૂ ॥ ઇચ્છા ખલીલુલાહ ॥ ૪ ॥ અ
સ સલાતો ॥ વસ સલામો ॥ અલેકૂ ॥ ઇ
ચ્છા સફીઅલાહા ॥ ૫ ॥ અસ સલાતો
॥ વસ સલામો ॥ અલેકૂ ॥ ખેર ખલકુલા
॥ ૬ ॥ અસ સલાતો ॥ વસ સલામો ॥
અલેકૂ ॥ ઓજાકીઅલા ॥ ૭ ॥ અસસ

લવાતો॥ વસ સલામો॥ અલેકે॥ યા॥
કુરસી અલા॥ ૮॥ અસ સલવાતો॥
વસ સલામો॥ અલેકે આ જાદની અલ
હા॥ ૯॥ અસ સલવાતો॥ વસ સલા
મો॥ અલેકે અજની ખલાકુ લાહા॥ ૧૦
અસ સલવાતો॥ વસ સલામો॥ અલેકે॥
અજણ॥ અર્જલ દેહેરી લા॥ ૧૧॥ અસ સલ
વાતો॥ વસ સલામો॥ અલેકે યા॥ ખલી
ફતુંલાહા॥ ૧૨॥ અસ સલવાતો॥
વસ સલામો॥ અલેકે॥ યા હર્જતી લા॥
૧૩॥ અસ સલાતો॥ વસ સલામો॥ અ
લેકે યા॥ સફૂવતુલા॥ ૧૪॥ અસ સલવા
તો॥ વસ સલામો॥ અલેકે યા॥ હુજતુ
લા॥ ૧૫॥ અસ સલવાતો॥ વસ સલા
મો॥ અલેકે યા રેજાતુલા॥ ૧૬॥ અસ સ
લવાતો॥ વસ સલામો॥ અલેકે॥ કુર

લં લાડા॥૧૭॥ અસ સલવાતો॥ વસસ
લામો॥ અલેકે॥ યા॥ જાહેજહેન રસુલી
લાહા॥૧૮॥ અસ સલવાતો॥ વસસ
લામો॥ અલેકે॥ યા આહેબી તાજ॥૧૯॥
અસ સલવાતો॥ વસસલામો॥ અલે
કે યા આહેબીલ હાજ વાલકો સર-
॥૨૦॥ અસ સલવાતો॥ વસસલામો
અલેકે॥ આ આહેબસ સફાઅતા॥૨૧॥
અસસલવાતો॥ વસસલામો॥ અલેકે॥ આ આ
હેબીન જેઆમતે॥૨૨॥ અસસલવાતો
વસસલામો॥ અલેકે॥ યા ખાલકે નબુવતે॥
વરરહીઆલતે॥૨૩॥ અસસલવાતો॥ વ
સસલામો॥ અલેકે॥ નબીફીલ॥ મહદનીઆ॥
૨૪॥ અસસલવાતો॥ વસસલામો॥ અલેકે
નબીફીલહરમીઆ॥૨૫॥ અસસલવાતો

વસસલામો। અલેક। ઇઆળબીદિલ। અર
બીઆ॥૨૫॥ અસસલવાલો। વસસલામો
અલેક। ઇઆળબીદિલ। હળળઆ॥૨૬॥
અસસલવાલો। વસસલામો। અલેક યાળ
બીદિલ। તાહામાઆ॥૨૮॥ અસસલવાલો
વસસલામો। અલેક યાળબીદિલ હાસમી
આ॥૨૯॥ અસસલવાલો। વસસલામો
આલેકન। યાળબીદિલ કુરસીઆ॥૩૦॥ અ
સસલવાલો। વસસલામો। આલેક। યાળબ
આલ॥૩૧॥ અસસલવાલો। વસસલામો। જુકી
આ અલેકન। ઇઆળબા આલ આસમીઆ
૩૨॥ ઇઆલ। ળબા આલ તમામ॥૩૩॥ ભુલ
ચુક સાહેબ માફ કર। બંદા ખાખ છે। સાહેબ પા
ક છે। સલામ ગુરબરહક હોઈ॥ હક સલામ લાહ
ઈલેલાહો। મહંમદ રસુલીલાહ॥૩૪॥
॥ ॥ ॥ શ્રી ॥ શ્રી ॥ શ્રી ॥

॥ ૩ ॥ ॥ ૮૩ ॥

॥ મારજુગ નો ગાવંત્રી લખી છે ॥ પરધાન ર
ઘુવેદી ગાવંત્રી લખી છે ॥ ઓ ઠેન ॥ ઓ ઠેન ॥ અહુકા
રંગ ॥ ત્રિણા દયુર સંગ ॥ ના રૂપો ॥ ના રેખો ॥ ના કરંગ
નવા રૂ ના પાદંગ ॥ ન ઓગ ॥ નગલંગ ॥ વરલંતે
ન્નમા એગ ॥ ન્નમા નાદંગ ॥ પરીબ્રમહો ॥ મલુર
મુરલી ॥ ઇસવર ॥ કરતવંગ ॥ વેદો પરીબ્રમાતી-
રઘુવેદ ॥ રલુ વરણંગ ॥ વરણ વેદી વી [illegible]
બ્રમા ઠા ॥ વંસપાળ ॥ અલી ॥ પરીબ્રમહો ॥ પરમે
સરંગ ॥ પરસ ॥ પરમોઠા ॥ પરીબ્રમહો ॥ [illegible]
લંલેપાતરો ॥ હુતાસનંગ ॥ ન ઓ તેન્જુ [illegible]
આદીપાત્રંગ ॥ વેદો પરીબ્રમઠા ॥ અહુના [illegible]
હુકારંગ ॥ પ્રેમ ॥ પ્રેમ ॥ પ્રેમ વેદો પરતે સ રં [illegible]
ઇ આદીપાત્ર ॥ વેદ પરીબ્રમહો ॥ ॥ રઘુવેદ
ગાવંત્રી પરીપુરણંગ છે ॥ સંપુરણ સમાપતા
॥ ॥ શ્રી સતગોર બ્રંમાવાસા ॥ બોલ્
જુનર વેદી ગાવંત્રી લખી છે ॥ ॥ ॥

અહુંત॥ અઠોન॥ અહુ ઠારંગ॥ વેદ વા અેઠેગ॥
આખર જમાઠા॥ વજુતી॥ પંમજુ લાંગ॥ ખરલં
લા અંગ॥ પરીવરલંતો॥ પરજાલંતો॥ પાતઠો॥ પર
મેસરંગ॥ પરીજમઠા॥ રૂપ રેખો વેદ॥ ન આજુગ
તંગ॥ પરમેસરંગ॥ પ્રેમ॥ પ્રેમ॥ પરમો॥ પરીબ્રમહુ-
વઈ આદીપાત્ર॥ મ આજુગતંગ॥ વેદ પરમેસરંગ
પરીબ્રમઠા॥ સબદો પરમેસરંગ॥ પરીબ્રમહુ-
જુજર વેદ જર દવરગંગ॥ વરગ વેદી વીસનુ
॥ જુજર વેદી ગાવંત્રી સંપુરણં છે. સમાપત. લખે
તહુ॥ ✿ ॥ ✿ ॥ ઇતી સતગોરનમા વાચા સ
તવેદીગાવંત્રી લખી છે ॥ અઠોન॥ અઠોન॥ અહુ
ઠોરંગ॥ ઉરસજ વેદીવરગંગ॥ તદા વેદ પરમે
સરો॥ ક્રિપનંતે॥ ધરમો તદા અરધંગ॥ પાતઠો
રજાલંતે॥ સરવે॥ વસ્ત્રૌ દીપાત્ર॥ જુજ અેગ॥ પ
રીબ્રમાઠા॥ ખરલં લા અેગ॥ તરતવ મગલે મા-
નમા અેગ॥ વરતંતે॥ સબદો॥ સોવેદ॥ પરી॥

॥૮૭॥

બ્રહમ ડા॥ અણસ બ્રહ્મા॥ પરીબ્રહમ ડા॥ અહુંય
રૂરરૂંપરીબ્રહમ ડા॥ અહુ ઉગાદ માઠાવે દંગા॥ પ
રીવરતંત॥ વેદો પરંતે સરગા॥ પરીબ્રહમ ડા॥ ॥
॥ સામવેદીગાવંત્રી સંપુરણ છે ॥ ૩॥ સમાપતેલ
ખ સહુ ॥ ❀ ॥ શ્રી સતગોરજનમાવાસા ॥ સોધી
અથરવેદીગાવંત્રી લખા છે ॥ જુગ સારની લખા છે
અઠોત અઠોત॥ અહુ રૂારંગા॥ રૂલીડીગા॥ રૂરતાવી
સંજા॥ વીસવા પાપંગા॥ અરધ વીસવા ધરમંગા॥
અણસોગી પાતંગા॥ રૂરંગા॥ ધરમો॥ રેખા માહ
ધરમેતી॥ પરીબ્રહમ ડા॥ અથરવેદ સવેત વર
વરણ વેદી વીસણવ॥ લોજરેપ વીસણવ ના રાણ
બ્રહમા અંગા॥ બ્રહમ ડા વઈસાં દીપાત્ર॥ વરણ વે
રમંગા॥ નલે મોત અો॥ જુગ તંગા॥ ઈછા અંગા॥ વા સણ
વના શાય રણંગા॥ અતી પરવરખાં મોણ॥ મા ડાંતો ના
નલે દા॥ જાંબુ દીપે રૂધા અંગા॥ પવીત્રંગા॥ વરતમા
નંગા॥ મા ઠા રૂધ જુંગા॥ ઉપનંલો॥ નારાયણં ગો

તેજીનયતેંગા॥ કરતા પરજાલંતે પાત કોડીનો
દપુરસલંગા॥ નઅોજય નંગા॥ જાયતી આરજા
અંગા॥ પરીખ્યાન ઠા॥ ખરલંલા અંગા॥ પરીખ્યામાઠા
·ખરલંલા અંગા॥ જાંગલેયા॥ સતાણીસત॥ અતી
પાત્રંદી॥ પરમે સરંગા॥ પરીખ્યામેઠા॥ ઢીનાદંગા·
પુરસંગા॥ વેલા અંગા॥ જાયેલી॥ કરતેતી॥ પરીખ્ય
મઠા॥ અસતહસેવંગા॥ નતો સરવેતી॥ પરીખ્યાને
ઠા॥ પરતે સરંગા॥ પરીખ્યાન ઠા·॥ ॥ અથરવેદી
[illegible] વંત્રીસં પુરાણ છે·॥ સમાપતે·જાય સતું·॥ ✿ ॥
શ્રીસતગોરજાનાવાચા·॥ • ॥ ✿ ॥ પાસમીગા
[illegible] શ્રી· મુગતમારગની લખીછે· ॥ સમોકે ॥ ॥
ભરતખંડે· ઇઠાંવરતંતે· તસામી· તસેગતા· વરે
લંતે· પ્રેતસુખામી· દીપે· સદીપે· જાંબુદીપે· કોટ
ગ· કોટાંગ· જયનંગ· પ્રેમ જુગતી· આનોદ·
આતમા· અંગા· દસાંગા· કુવારડા· ખેત્રંગા·

realpatidar.com

2010 Before -Satpanth Manuscript 26 (176)

જુગત ગંગા॥ સત જુખંગા॥ વજુલ નગરે॥ વે
ઠિરાટ વાને॥ જાવેતંગા॥ માહા સરસવતી॥ સા
બરમતી ત્રકટે॥ રેવા ઓત્રે॥ પંચ નદી ફુ
વાને॥ દસા ઓત્રાત્રંગા॥ સોહ સોહ જોજનંગ
સલસલ રૂપી જમાહા॥ વાત્રે ફંગા॥ માહા નારાયણ
વચને॥ કળીજુગ અંતે॥ બોધ સાસ ત્રંગા॥ નુરા
વરગંગા॥ સમાહા વરતંગા॥ દસાંગા॥ ફુરનંગા॥
માહા નંગા લંગા॥ ફૂલ પદ દેહે॥ માહા સે॥ દીવ સે
તીપી વારો॥ જખેત્રે હુરાવરગંગા॥ અર પા [illegible]
પ્રમાંછે॥ એલે અસલહે॥ ઉપનંલે નકે [illegible]
સાગંગા॥ પરીબ્રમહા॥ આદિપનંતે॥ [illegible]
કેતંગા॥ ખેત્રમાહા ફલજુગા॥ કેરત વંગા [illegible]
ગંગા॥ નવા સસરી ધાયંતે॥ લઘાતા હોતંગા [illegible]
પતંગા॥ ઉપનંલો॥ છેલી સંધે॥ નકે હંકીનારા [illegible]
ગા॥ પરીબ્રમહા॥ સનાપતે નાવેતંગા॥ આરેવેદની
ગાવંત્રી સંપુરણ છે [illegible] ॥ ॥ ॥

॥ શ્રી સતગોરનુરમાવાઆ. ॥ પાએગાયંત્રીનુએ
આંનકઠીએ - તે કરીને સાંભળાવીએ - ચત વંગ ગાવં
ત્રી॥ અથરવેદી લખી છે॥ તે જુખરૂપાનવાની છે॥
શ્રી આદેનુરનાજી॥ અઈસતનુરમાજી॥ નરનુરમા
જી॥ તેને પકોસરનંતે॥ સુરીનંના॥ નરનંના॥ નરાકાર
નરનંના॥ નીતરૂપ॥ નુરમાવાઆ॥ ઉતપતરસ
ના॥ સરનંતે॥ શ્રી નુર સતગોર સરનંતે॥ શ્રી સતપં
થધરમ॥ સતમારગ॥ આદે આઆ॥ જુનાપરની
કોને॥ પરકાસતે॥ જે કોઈ મુનીવર॥ સાંભળંતે॥ તે આ
પાગવનનધો॥ નકીનાવંતે॥ લખઆરાસીએ॥ નર
[illegible]ના રી॥ છુટંતે॥ જે કોઈ અથરવેદી ગાવંત્રી॥ પો
તાની પાસે રાખીને નરગાતા॥ પોતાની પાસે રેહીઆ
માંહે રાખંતે॥ તેનુ વઅનરનાન॥ અનરાપરીનાગે
વંતે॥ જે કોઈ નરત્યાનારી॥ એનો સુધ નાનાંતે
તે સદા એનનાનઠારે તે॥ લખઆરાસીમાંના॥ આ
પાગવનનધો॥ નાગાવંતે॥ તે સઠાસત કરીનાંને

ठाकुरजी वरा॥ आद जोग तेज पड़ी॥ जुरा॥ जुर पड़ी
नरंजना॥ नराकार पड़ी॥ जोत सरूप॥ जोत सरूप
पड़ी॥ आद अनाजी॥ आद अनाजी पड़ी॥ सत
अनाजी॥ सत अनाजी पड़ी जुर नातेज॥ सतगुरु
जाणा॥ सतगोर॥ सतगोर अनाजी पड़े॥ सरवे
रमणारमं ते॥ सतधरम माडारा॥ आद अ
नाजी॥ जुर सतगोर॥ जुर सतगोर पी॥ सरवंते
सतगुरणा परणे रोजे परणे सत ॥ [illegible]
नजो - भीसमीलाहा - हुर रहे मांन - बीर [illegible]
जुर समावत वले अरज॥ तेज समावत [illegible]
रज॥ जुर समावत वले अरज॥ वेख्हद [illegible]
जलाल॥ जुर समावत॥ वले अरज॥ जुर [illegible]
जुर मठ नद जुसतफा॥ सलंलाहु आलेव सलम॥
जुर समावत॥ वले अरज॥ जुर अेरलाप मोवीसंदे
नर॥ पेगाबर सलं ला आलेवसलम॥ जुर समावत
वले अरज॥ राद रुद रत॥ छ लाला हे॥ आलेवसलम॥

पेठेजुरसमायत आलेवकैलेके अरज॥ जुरसफी
माठी इलीलसाठे॥ जुरसफाअेत॥ इलंसाठे॥ आले
वसलंज॥ जुरजनलेखुदरत॥ इलंसाठे॥ आलेवस
लज॥ जुरसमायलवले अरज॥ जुरसनायतव
ठीजोलसरूप॥ नीरा ३ारस॥ सलंला॥ आलेवसलंज
जुरसमायल॥ वले अरज॥ नरंजनतेज सरूप॥
सलंला आलेवसलंज॥ जुरसमायतवले अरज
नरंजनतेज सरूप॥ सलंला आलेवसलंज॥ जुर
समायत॥ वले अरज॥ तेजसरूप॥ आद सरूप॥ सलं
ला आलेवसलंज॥ जुरसमायत॥ अखंडमुरत आद
सरजंतो॥ जोतसरूप॥ जोतसरूपथी॥ आदेसउती
सरजंतो॥ तीसमधेथी अखंडमुरती परउासउरत
वंगा॥ तारे आदव्रमाजी॥ वीसनवजी माठे स्वरजी
सावंत्रीजी॥ पारवतीजी॥ लखमीजी तीसमधे थी अखं
डमुरती॥ परउासउरतवंगा॥ सरजंतो॥ तारे सउ
तमुरत परउासउरतवंगा॥ तारे अेउमुरत अगाचर

॥૮૭॥

રતી તીસપટી સા૩હ સે સર સરણં તે॥ ણં ળપ અ
ધરવેદીગાયંત્રીળરગતા॥ તેળવ આવાગવળ
ણ ઠીળતવા॥ જે ળવળગતાળસાળઠતા॥ તેળવધ
ણ આવાગવળણ ઠીળતવા॥ જે ળવળગતાળ
સાળઠતા॥ તેળવળખ મોરાસીફેરોળઠીખાવંતા
તેળવ અળરળાવળળાઠા અળરાપરીળાગાવંતા
તેળવ સદા એ અળર ઠાતવા॥ તદાગરે ળાળઠા
સતાગરે॥ ળાળાઠા॥ સતગારપાર સોદર દીળવા
મા॥ આદગારુપાર૩બાર દીળ॥ ઠસળ સાઠાવાયા
વેદ ચાર સરણંતો પેલો॥ રધુ વેદ॥ બીજો॥ જુજર
વેદ॥ ત્રીજો સામવેદ॥ ચોથો અથર વેદ॥ આજે
કળજુગ પરતાગે અથરવેદી સાઠારગાયંત્રી॥ સો
તે॥ પીરઠ સળ સાઠા૩ બારદીળ॥ સુરતો ઠાસુળી
ધરીળાઈ તેળા કારણ સરસ॥ તેળવ અળરધા સે
ળરસાળારી॥ ॥ અથરવેદીગાયંત્રી સંપુર
ણ છે॥ ॥ ગાયંત્રી જુગ્રોઆળ સંપુર ણ છે

[illegible]

ઈલીલ્લાહા ॥ સુભ હાન રે ॥ રફીકુલ હ ફીજો ॥૧૧
લાઈલાહા ઈલીલ્લાહો ॥ સુભ હાન દે ॥ દાઈમુલ
કાઈમો ॥૧૨॥ લાઈલાહા ॥ ઈલીલ્લાહો ॥ સુભહા
નલ ॥ ગોરીયલ ગોનીનો ॥૧૩॥ લાઈલાહા ॥ ઈ
લીલ્લાહો ॥ સુભ હાન લ ॥ હઈયુલ ॥ કઈયુમો ॥૧૪
લાઈલાહા ॥ ઈલીલ્લાહો સુભ હાન ॥ ખાલેકુલ
બારીઆ ॥૧૫॥ લાઈલાહા ॥ ઈલીલ્લાહો ॥ સુભ
હાનલ ॥ અલીયુલ ॥ અજીમો ॥૧૬॥ લાઈલાહા ॥ ઈ
લીલ્લાહો ॥ સુભહાનલ ॥ વાઈદુલ અહદો ॥૧૭॥
લાઈલાહા ॥ ઈલીલ્લાહો ॥ સુભ હાનલ ॥ મોમીન
લ મુહેમીનો ॥૧૮॥ લાઈલાહા ॥ ઈલીલ્લાહો ॥ સુ
ભહાનલ ॥ હબીબુલ ॥ અહદો ॥૧૯॥ લાઈલાહા ॥
ઈલીલ્લાહો ॥ સુભહાનલ ॥ હલીમુલ ॥ કરીમો
॥૨૦॥ લાઈલાહા ॥ ઈલીલ્લાહો ॥ સુભહાનલ ॥ અ
વલીલ કદીમો ॥૨૧॥ લાઈલાહા ॥ ઈલીલ્લાહો
સુભહાનલ ॥ અવલીલ આખીરે ॥ ૨૨॥

લાઇલાહા । ઇલીલ્લાહો । સુબહાનમ । ગ્રાહેરો
લ બાલીનો ॥ ૨૩ ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુ
બહાનલ । કબીરૂલમુતઆલો ॥ ૨૪ ॥ લાઇલાહા-
ઇલીલ્લાહો । સુબહાનલ । કાઝીયુલ । હાજાત
૨૫ ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુબહાનલ નૂર । રહેમાં
જુર રહીમ ॥ ૨૬ ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુબ
હાનર । રબીલ । અરસી । અઝીમ ॥ ૨૭ ॥ લાઇલા
હા । ઇલીલ્લાહો । સુબહાનર । રબીઉલ આલી-
મન ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુબહાનલ । જુર
હાજુસ । સુલતાંન ॥ ૨૯ ॥ લાઇલાહા । ઇલીલ્લા
હો । સુબહાનલ સમીઉલ બસીર ॥ ૩૦ ॥ લાઇલા
હા । ઇલીલ્લાહો । સુબહાનલ । વાહેદીલ । કહાર ·
૩૧ ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુબહાનલ । અલી
મુલ હકીમ ॥ ૩૨ ॥ લાઇલાહા । ઇલીલ્લાહો । સુબહાન
સ । સત્તારૂલગાફાર ॥ ૩૩ ॥ લાઇલાહા । ઇલીલ્લા
હો । સુબહાનર । રહેમાંજુદ । દઇયાંન ॥ ૩૪ ॥

લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલ હાનલા ॥ કબાઇલ
અકબર ॥૩૪॥ લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલ
હાનલા ॥ અલીમુલ ॥ અસલામ ॥૩૫॥ લાઇલાહા
ઇલીલાહો ॥ રસુલ હાનસ ॥ સાફી દ્રિલ ॥ કાફી ॥
૩૬॥ લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલ હાનલ ॥ અલી
મુલબાકી ॥૩૭॥ લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલ
હાનસ ॥ સમદીલ ॥ અંહદ ॥૩૮॥ લાઇલાહા ॥ ઇ
લીલાહો ॥ રસુલ હાનસ ॥ રબીલ ॥ અરસો ॥ પસ
સાપાત ॥૩૯॥ લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલ
હાનલ ॥ ખાલેકુલ ॥ મખલુખાત ॥૪૧॥ લાઇલાહા
॥ ઇલીલાહો ॥ રસુલ હાના ॥ જનખલ કેલ ॥ લેલપના
હાર ॥૪૨॥ લાઇલાહા ॥ ઇલીલાહો ॥ રસુલહાનલ
ખાલેકુલ ॥ રજાકો ॥૪૩॥ લાઇલાહા ॥ ઇલીલાહો
રસુલહાનલ ॥ ફતાહુલ અલીમો ॥૪૪॥ લાઇલાહા
ઇલીલાહો રસુલ હાનલ ॥ અઝીઝુલ ગનીઓ ॥૪૫
॥૪૫॥

લાઇલા હા ઇલીલા હો સુબહાન લા ગાફુ રેત સુરે-
૪૬ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબહાનલ અઝીમુલ
અલીમો ૪૭ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબહાન
ઝીલમુલકે વલ મલેકુતે ૪૮ ॥ લાઇલા હા ઇલી
લ્લા હો સુબહાન ઝીલ ઇઝતે વાલ અઝમતે-
૪૯ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબહાન ઝીલહે
એબતે વલ કુદરતે ૫૦ ॥ લાઇલા હા ઇલીલ્લા
હો સુબહાન ઝીલકીબરીઆએ વલજબરૂતે
૫૧ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબહાનસ સતા
રીલ અઝીમો ૫૨ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબ
હાનલ આલેમુલ ગએબે ૫૩ ॥ લાઇલા હા ઇલી
લ્લા હો સુબહાનલ હકીમુલ કદીમો ૫૪ ॥ લાઇ
લા હા ઇલીલ્લા હો સુબહાનલ કાદેરેસ સતાર
૫૫ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુબહાનસ સમી
ઉલ અલીમો ૫૬ ॥ લાઇલા હા ઇલીલ્લા હો સુ
બહાનલ ગનીઉલ અઝીમ ૫૭ ॥ લાઇલાહા

[illegible]

[illegible]

લાઇલાહા ઇલીલ્લાહો સુભનાનલ મલેકીલ મુલકે
॥૭૭॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભનાનલ બારી
ઉલ મુસવ્વીર ॥૭૮॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભ
નાનલ અઝીઝૂલ જબ્બાર ॥૭૯॥ લાઇલાહા ઇ
લીલ્લાહો સુભનાનલ જબ્બારૂલ મુતકબીરો ॥૮૦॥
લાઇલાહા ઇલીલ્લાહો સુભનાનલ લાહે અમા યેસ
ફુન ॥૮૧॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભનાનલ કુદ
ુસ સુબ્બુહુ ॥૮૨॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભના
નરબીલ મલાઇકતે વરરૂહુ ॥૮૩॥ લાઇલાહા ઇલી
લ્લાહો સુભનાન ઝીલ આલાએ વનનઅમા
એ ॥૮૪॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભનાનલ મલેકુ
લ મકસુદ ॥૮૫॥ લાઇલાહા ઇલીલ્લાહો સુભનાન
લ્લાહે બાકુલ મન્નાન ॥૮૬॥ લાઇલાહા ઇલલ્લા
હો આદમ સફી ઉલ્લાહ ॥૮૭॥ લાઇલાહા ઇલી
લ્લાહો નુહ નબી ઉલ્લાહ ॥૮૮॥ લાઇલાહા ઇલી
લ્લાહો ઇબરાહીમ ખલીલુલ્લાહ ॥૮૯॥

લાઇલાહા ઇલીલ્લાહો ઇસમાઇલ ઝબીહુલ્લા
હો ॥ લાઇલાહા ઇલીલ્લાહો મુસા કરીમુલ્લાહ
॥ લાઇલાહા ઇલીલ્લાહો દાઉદ ખલીફતુ
લ્લાહ લાઇલાહા ઇલીલ્લાહો ઇસા રૂહીલ્લા
હો લાઇલાહા ઇલીલ્લાહો મહંમદ રસુલી
લ્લાહે વ અલીલાહ અલી ખેરેખલકે હી વજુરેઅ
રસેહી અફઝલીલ અંબીઆએ વલમુરસલીન
હબીબેના વ અઇમેહીના વ સફીએના વનપલ
ના જાહદહીન વ આલા આલેહી અજમઈન
બેરહેમતેકા યા અરહમરાહેમીન ॥ ૧૦૦ ॥
॥ શ્રી ગંજુલ અરસ ગંજુરાં ॥ ॥ ચેહ
અસનાદ હઝો ખાસાઈયત લીખીહે ॥ ॥
શીવાયત હઝ એક એક રોજ હઝરત રસુલ એકરે
કલાહો અલેહે વકલંમ જહાંનેકુ બઘરાઝી
મકમ્મલ દીખે એ ઉઠે એ હઝરત જબરઈલ
અલેહીસ સલામ નાઝીલ હુવે ઔર ચેહ દોઆલાએ

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥૮૩॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

In actual book, there is a section break here.
Page 97 in this section, starts from page 484 of this scanned file.

નાકીઠઅ·આ થાઠયેઠઠઅ· ॥ ય...

પુરણ છે ॥ યાનેઆઆપતઅંપુરણ છે ॥

ગુલ મુકમાફી ના·મા· કેશરગોપાલ·પુ·પારા

ગા· ॥ ✿ ॥ ✿ ॥ ✿ ॥ ✿ ॥ ✿ ॥

૨૪	૩૧	૨	૭	[illegible]
૬	૩	૨૮	૨૭	[illegible]
૩૦	૨૫	૮	૧	અલનારાનાથાકુદરેશ
૪	૫	૨૬	૨૯	રપાઉપરઅલતી

[illegible]

અલનારારના ધાંતથી ઘેરા

खार उसर. १
लसण सर. ॥
पीपरीमूळगंठोडा ०)=
पीपरी ०)=
धोळी मरी ०)=
डाळी मरी ०)=
धोळी मुसली ०)=
डाळी मुसली ०)=
खुरसर ०॥
डाळी मरी ०)=
[illegible] पीसर.०॥
[illegible] ०)=
खुपा ०)=
अजमा सर.०।
जायफळ नाग.४
जावंत्री ०)=

[illegible] ०)=
अंबली ०)=
लपीठा. ०)=
आदु ०)=
महुडा वाटी.३
उसर वाटी.०॥
अंदरजव ०)=
दराख सर ०॥
संचरा ०)=
खसखस सर.सर.०॥
[illegible] नी.[illegible]
सर.०।
[illegible]
[illegible]
[illegible]

७	७	८॥	[illegible]	१६	१	७
[illegible]	७	७	७	[illegible]	८	८
८८	८	[illegible]	३	७	३	७

[illegible]

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]

[illegible]

[illegible]

[illegible]

हो भाईसब्बा नीतो व्यापड भानी छे ॥ ॥
हो भाईसब्बानी होवथा पताकुमडणकरभानी छे:
हो भाईसब्बानी तो व्यापड भानी छे: ॥ ॥
हो भाईसब्बाने थासरणथागजानणभी: ॥ ॥
हो भाईसब्बाने थासरणउपरे पेलोज मडणापगाम:
हो भाई पारस दभानी धारकथासरणनी छे: ॥
हो भाईसब्बाने पारमांही ने सरहोकरभानी छे:
हो भाई पारउपरे थाव्याकुकभानी छे: ॥ ॥
हो भाई पारे आरदसे पईसा मारानी छे: ॥
हो भाई पारे पईसा कुकाने सरहोकरभानी छे:
हो भाई कलसने हूपलो व्यानकरभानी छे: ॥
हो भाई जोत हो भाने परणमनी छे: ॥ ॥
हो भाई कलस माज जानरभानी छे: ॥ ॥
हो भाई कलसमाही ने सरहो कोधनी छे: ॥
हो भाई कलसउपरे आव्याकुकानी छे: ॥ ॥
हो भाई कलसे थाव्या तारा ने सरहानी छे: ॥

૨૨ [illegible]

૨૩ [illegible]

૨૪ [illegible]

૩૦ [illegible]

૩૧ [illegible]

૩૨ [illegible]

૩૨ [illegible]

~~૩૩ [illegible]~~

૩૩ [illegible]

૩૪ [illegible]

૩૫ [illegible]

૩૭ [illegible]

૩૮ [illegible]

૪૦ [illegible]

૪૨ [illegible]

૪૫ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

૧૦૦ દોપા પાળક ને કાકાણાની છે ॥ ॥
૧૦૨ દોપા પર કેના નેહ પેપા ભાનાની છે ॥
૧૦૩ દોપ કજાસદ્ધિ પરે ભા યાપાદ્ધિતારાની છે
૧૦૪ દોપા મોટા છાર ના પ્યાના છે ॥
૧૦૫ દોપા યસતાને લાઈદ્ધિતારાની છે ॥
૧૦૭ દોપા પોરપ્યને લાઈદ્ધિતારાની છે ॥
૧૦૮ દોપા રપ્યે સરને માંડે છાર ન પ્યાની છે
૧૦૯ દોપા મપ્યાને કરપાધાની છે ॥
૧૦૯ દોપ કજાસદ્ધિ ડાડાને સરદાકુરાની
૧૧૨ દોપા પારદ્ધિ ડાડીને સરદાની છે ॥
૧૧૨ દોપા ધાજ યપ્યે પાત્રની છે ॥
૧૧૩ દોપા ધાજપે મોને જમપાની છે ॥ ॥
૧૧૪ દોપા ધાજજ મોને જકાપાની છે ॥ ॥
૧૧૫ દોપા ગતજ માત પરપારાને દ્ધિડાડની છે ॥
૧૧૬ દોપા જદરમના ॥ દોપા સુરજની છે ॥
૧૧૭ દોપા દરદલપ્યાં છે ॥ દોપા કોલલપ્યાં છે ॥
૧૧૮ દરદલપ્યા છે ॥ દરદપ્યાને લપ્યાં છે ॥
૧૧૯ દોપા પાત ગનાપાત લોલપ્યાં છે ॥

૬૮ દોપ૭ સાત્રવ છે

सपरीरे ४३ना अर्थ तरसठ पम अनेरु
अपार नेद न लाभ. पामा दा छे: लाभ ल
ना धर्य तामा ठा दा ठा: ना थे-नाभा ठा:
श्री सतगोर पर मा भा भा सा मा छे साई:
दीवा अवता नी पेटा फरा थाना छे:
पर माननाः थे अ मा लाभ रेते मां
नररहा भ: सतगोर पात्र अंदर ईमा
न साहाः थादीवा सनन: नरानन
नरआ ला मां हां मं द साहा: ठ मा रा
दीवाः गपरीम आठ लाभ फर काम
दः गोर ई मा मे साहा ना प दगा का दा:

તારેમાલમાલેજસતનાફરમાતે
લેફાને ફામામફા દા દા ॥૧॥ જસત
નાફરમા તે ગોર ફામામને માથે: દી
જગનાફરમા તેપારસતા ધનાના
લાને પાસ: ॥૨॥ જેફો ફાદરમને મા
રગીમાલસે: તેસતા ધમરાપરમા
લસે: ॥૩॥ તાંમાં મમસે સતગોર સાં
માના દેદાર: તારમ [illegible] દજપનગોર
જ માામને ખાર: ॥૪॥ માજે સરગમરતને
પાતાલ: ॥૫॥ તે સતગોર સાહિબ ખર
સાજંનં માર: ॥૬॥ તે નોને દનજાંણા
ફોફા: સામામનખમે સોફા: ॥૭॥

[illegible]

[illegible]

पइरा कां ॥१९॥ भाई तेणे साध साध का
म सत वारे रजा कां: सर पेना धार ना भाव
धर मांकां: ॥२०॥ भाई तेणे पार पे गांम
रूप नान रे दे खे: नर कां मर कां पकां भाव
नो पे खे: ॥२१॥ भाई तेणे सत पात सा
भ कर सा भावे: तां हां कुं भाई सत का कर सा
मां कां: ॥२२॥ ते भाई ना से पावां भ रजा
गे: सत सब कर सं तो कुं मा गे: ॥२३॥ जे
ये कुं मंने मं ते सत पंथ धा पे: ते भाई
तो पद हां को र मां जा पे: ॥२४॥ जे दे सोद
सो कर सा ते अमरा पुर मां नाह से: तेना प तो
यं भरा पर न से: ॥२५॥ तं भेर खे सर सा

[illegible]

[illegible] ॥२६॥ [illegible]

[illegible]

[illegible] ॥२७॥ [illegible]

[illegible] ॥२८॥ [illegible]

[illegible]

[illegible] ॥२९॥ [illegible]

[illegible]

[illegible] ॥३०॥ [illegible]

[illegible]

[illegible] ॥३१॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

मामाम६२२२स्तु ललाहि: ॥४॥
दीमासमानेयासंकाठिपरपीलोजम
मुंपडाझ्फानेमकापानी: पारमानजा:
मिसमलाः मररेमि मानजनरकिमा:
मेहरफ्ती मांमसाहाः याहेमासनमः
नरजनाः नरथालामाहांमहसाहाः
सतगोरन मासदीपा॥ साहेबंदाः
मिमहेम पामाः सतगोरज्ञरपायाः
साहापायाः साहाकादेदारपायाः स
ताठिना सोमतपायाः रोफायानाराज
पायाः यंनंत करोडना सोमतपायाः
मोमरापरमांपामसपायाः सतगोर

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ંસેવભાવરાઃ આસમાસીક તાકરાત
ઃ તરેસરભાવરાવતહેઃ સેસર સો
ક તા સેટા સહાઃ સેટા ભાવનતરે પના
ગ઼ાઃ સેટા ધરને સેટા પારઃ સેટા સોમ
સોગાત નાપારઃ સતગોર રા સામ સાહાઃ
નરઅલતા સાંહાંસદસાહાઃ હકલાહઅ
લાહઃ રાલતાહો સાહાસદરક લલાહઃ
॥ ૬ ॥ ॐ ॥ હોસામાત્યાતે પાર સાંઝાતે
સરહોક રાનાદઃ માર સાંતલાઃ પાસ સતાઃ
હરરેહ સાંતતરરતા સાંઃ સતગોર પાટમ
રમાઃ આંદરરા સાસસાહાઃ થાદેપાસનતન
નરાવંતાઃ નરઅલતા સાંહાંસદસાહાઃ
સતગોર તંમારા હોલા ॥

[illegible]

મંરપાંણનાઃ પાસપતાઃ મરરેમપાણન
રરતાપંઃ સતગોરપાત્રપારપાઃ અંદરરી
પાપસાહાઃ આદેપાસાનાપનસાણંનાંઃ
નરઆલતપાહાપંદસાહાઃ સતગોરપા
રરુપારદાનઃ સતગોરપારસોદર દાનઃ
સતગોરપારસાહિપદાનઃ સતગોરપા
રનસારદાનંઃ સતગોરપારસપંસદા
નંઃ સતગોરપારસાલાચા દાનઃ નરચ
સલાંપંસાહાંઃ નરચાલનસાણંનાંનાં
પંઃ નપાનરઃ સતગોરતપાસદોપા॥
પરપંપંઆદનસાણંનં દ દોપારઃ સ
સરપારપોગોરનોરે દરાચપતારઃ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥८॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

માંહાં મહદસાંહાઃ સત ગોર પાર કરતાર
દાનઃ સત ગોર પાર સોહર દાનઃ સત
ગોર પાર સાહિબ દાનઃ સત ગોર પાર
ન સાર દાનઃ સત ગોર પાર સાહિબ દા
નઃ સત ગોર પાર સમસ દાનઃ સત ગો
ર પાર સલામો દાનઃ નર ધસ લામ સા
હાઃ નર ધલાન સર્વ નનામઃ સત ગો
ર તંમારા દીધા ॥ [illegible] નાદઃ સાદઃ
સધદઃ ઝરઃ તેન ધાંધાઃ [illegible]
[illegible] પાધાધઃ [illegible] મહિમા સરવાધે
[illegible] માંહા [illegible] દીઃ ધાંન ત [illegible]
પર તા તા દીઃ [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

परमसवाइनराजनतवामकारः
आमकारथाइधीकारःसिसरतंग्ना
कारहीयासतारःसंनसारानेघराइ
हितःतारेरमहिमयरसंनमितःम
रमसतनथाजराआंकरःतेनांसर
नांरोरतननरपूरःमराधेकीदूइस
रेकासःतारेसरनापिकनेपरागःते
पंकसाहिमिलसावाःसंनतसरूपास
रनाकाआःनजाअपरेपरोपासःवा
एनराजनथावापरकासःकजसेमा
रमरतमजानेकरानोगतःरेमसरना
पूनेआवासोगतःनरअसानासा
साहितारःनामहापिनरतपंमिःक

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

॥ २५ ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ब: साहिब सतार: साहिब गोपार:
साहिब परवरदिगार: साहिब भेता:
साहिब भालक: साहिब वयल: साहिब वा
पर: साहिब वयनतार: साहिब पालर: साहिब
मख: साहिब कधी: साहिब पारा: साहिब न
र साहिब: साहिब पांसन: साहिब पारसरा
म: साहिब राम: साहिब करसन: साहिब भो
ध: साहिब नकलका: नारा इंगा: नरीन
ननराकार: बालीन भाषकासकन
दिदार: नर वसलां सं साहिब दातार:
सतगोर सोदर दीन सार: न भोजर
सतगोर जादर दी मास साहिब: नर वल
सां मांसंद साहिब: तमारा नां सह्नि पर
भातेमारे नाश्नि: तमारा कांस करतभ

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

नेसपत॥२१॥ धसोमंतः॥२२॥ पराकृसं
रूपः॥२३॥ पंडितसतोश्री कोरनः॥२४॥
पसरतः॥२५॥ दकताही॥ ॥२६॥ काजमः
२७॥ परजाईतः॥२८॥ काकमरूपः॥२९॥
पडितसतोश्री पैसारः॥३०॥ देरतः॥३१॥र
पकः॥३२॥ केसपः॥३३॥ नरूपतोपत॥३
४॥ तमः॥३५॥ धंमारूप॥३६॥ पडितसतो
श्री नारसाकीः॥३७॥ कनाईकः॥३८॥ पंस
पवगः॥३९॥ पारतोमंतः॥४०॥ कासमं
रूपः॥४१॥ पंडितसतोश्री पांमगः॥४२॥
मानधातः॥४३॥ परमसार्न॥४४॥ धसर
पः॥४५॥ जमंदूरूप॥४६॥ पडितसतोश्री

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

सेद फामामे दान ॥९॥ सेद मोसापार दान:
॥१०॥ सेद मंबलखर दान: ॥११॥ सेद गालखा
दुरा: ॥१२॥ सेद णमाल दान: ॥१३॥ सेद सा
हप दान ॥१४॥ सेद महिर दान ॥१५॥ सेद सा
ले दान ॥१६॥ सेद हा दान: ॥१७॥ सेद पाल
लसाहा: ॥१८॥ सेद हासमसाहा: ॥१९॥ सेद
महमद साहा: ॥२०॥ सेद लमद साहा ॥२१॥
सेद नासर साहा: ॥२२॥ सेद रुसाय रु: ॥२३॥
सेद मोहमा: ॥२४॥ सेद मो सताज: ॥२५॥
सेद महमद दान ॥२६॥ सेद रमान साहा ॥२७॥
सेद षालप साहा ॥२८॥ सेद नाजर सा
हा: ॥२९॥ सेद सलांम साहा ॥३०॥ सेद स
लाहो दान ॥३१॥ सेद संमसमोर ॥३२॥

[illegible]

[illegible]

[illegible] ॥25॥ [illegible]

[illegible] ॥26॥ [illegible] ॥27॥ [illegible]

[illegible] ॥28॥ [illegible]

[illegible] ॥29॥ [illegible] ॥30॥

[illegible] ॥31॥ [illegible]

[illegible] ॥32॥ [illegible]

[illegible] ॥32॥ [illegible] ॥33॥ [illegible]

[illegible] ॥34॥ [illegible]

[illegible] ॥35॥ [illegible] ॥36॥

[illegible] ॥37॥ [illegible]

[illegible] ॥38॥ [illegible] ॥39॥

[illegible] ॥40॥ [illegible]

[illegible] ॥41॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

मंदास्तुरत्न: नपलोमतारः सातफार

सता: नरमांहांमंद साहा: जरमगार:

नरानं नाते नराकार: द्वरसफोर सा:

लोहोक लम: तेपहाफोड दीपारः फेह

सतगोर प्यरमा: सतपंथ तेसदाई

आतंमंगः मोगतमारगनेंद: तेप्यारं

मंदीपारे: सतगोर थे मांमसाहा: नरथ

लामांहांमंद साहां: फ लोई लोह: थेल

लाहो: मांहां मदररसु ललोहे: ॥२६॥

॥ दीपादसदसाथोर नामानेस

रदानाथे: ॥ पर मांनजा: पे समनाल: ह

ररेह मानं नररहाम: सतगोर पात्र प्यार

मा: आंदरहा मामसाहा: थादेवा सन

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

कुवेंकुरनेकुजसनोवेदः नगनथा।
पोसजोसेदः वधरवेदीज गनंनी
सानोपेसमरानोजंनः एकमरत
त्रनदेपमजोः सेसरजोधापीः आदि
गोरेसतपंथसरजाःनेपापनाप्यांकु।
पीःजमासपूरोपासधरोःनरनोपर
कासकुरोःकुजसमाहिकुजाधरोःरखे
सरजपूनेपापनकुरोःजमतोनरानजाः
नकुजंफाटपःनरवसलोमसाहिजा
पूनाकुपःनरमांहिमदसाहिफादासे
हिरःमसापधरमंनेरंजाफेरःनमा
करसतगारःनरानननीफायाःसमां
मातसथा॥पनानेतमुमाहिसंमाजाः

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

पारारापाति त्रासफरोफनासेफाधाती:
नाधूदीपनाफप्रा: सतगोरर्वेसानसां
हां: नरधाताशंहासंदसाहा: हफताति ता
ह: श्रीताताहां: साहासदररसताताहं: ॥२८॥
॥ दीपापाफाफफपानीतेख्याधे: ॥
पारसांनना: पेससता: हरेरेतेसांनांनरर
हास: सतगोरश्रीसांसंसाहा: नरधातासा
हांसदसाहा: नपाफरसतगोरतसारी
दीपा ॥ नरीमेंनांनफपंफानाराईप्रा: त
साश्रीनश्रीते: तसारादसतरे: फसनरपे
सरपंदी: नरनारीप्याफगोपाफनासा
फपत्रासाफपूतेफरी: पांसतंनपाफ:
रुपापाफ: धरुपापाफ: नपतनसाप्य:

[illegible]

॥ ही मा पैतो पार सत नाम नं
धां कम नं साडनां छे॥ आकलो मसत
ना छे॥ धा कड़ि पर पापकर कु।
धा पैतो दी पा सारे नं का पा: सा का
नातरप छे धा का सां हि न करकु का नं दे
पा: पां सस धा का नां नं का पा स का:
फर सां न जा: फि सत सतो: हर रे हि सान
नरर हा स: सतगोर पात्र पार सा: नं
दर छा सां म सां हि: आ दि पा सन प:
न सांनं ना: नर सत तो सां हि सं द सा हि:
सतगोर पार सो दर दान: सत गोर
पार कु पार दान: सतगोर पार स...
प दान: सतगोर पार न सार ...
सतगोर पार सम सर दान: सतगोर

डाकोजपरमारःसाहानांमंनःसाहा
परमराजःसाहाश्रीरामअवतारः
छडासकरीडाकोजपरमारःसा
हाकरमंनःसाहाश्रीबोधअवतारः
छपंनकरीडाकोजपरमारःसाहा
मोरतजाआनीःसाहाश्रीनकलंका
दसमाअवतारःसतसंसाहासेनाको
जपरमारःनबानकरसतगोरःनसा
रदीनःनरअसलांमसाहाःसतगोर
सलाहोदीनःसतगोरसंमसदीनः
सतगोरसाहेबदीनःसतगोरसोदर
दीनःसतगोरकबीरदीनःसतगो
रईमांमसाहाःनरजलामाहांमद

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥३०॥ ॥१॥

[illegible]

[illegible] ॥ [illegible] ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

गांमद समाधः सतगोरपारप्रकारदान:
सतगोरपारसोदरदान: सतगोरपार
साहेबदान: सतगोरपारनसारदा
न: सतगोरपारसंमंसदान: सतगो
रपारसलामतदान: नरवसलांमंसा
मा: नरवलीनरागं नंमामः नमान्
रसतगोरतंमारादीपा ॥ नरागंनते
नराफार: ईरुमफाफादीपासतार: फ
मापेरेफा धूदसरफाम: भापोयापे
पेधापरमांन: नामेपे धूतेनेतपाल:
द्विपनापरमातेभमफार: भनदपर
मानयामलग: हरामामभामे याकल
ग: परमंसतनमाफलरापरा: भं

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

सतगोरपातप्यरमाः अंदरऐमाम
साहाः थादेपासनपनराजनाःनर
थलोमाहामदसाहाः सतगोरपार
फ्यारदानः सतगोर पार सोदरदानः
सतगोरपारसाहेप्यदानः सतगोर
पीरनसारदानंः सतगोरपारसमंस
दानंः सतगोरपारसलोहोदानः न
रथसलोमसाहाः नरथलोनरनं
नंनामः नप्याफरः सतगोरतमारा
दोपा ॥ अफफारे थादनराजनंद
राथाहेतः पेसानाभालोधासेतः
लएनंधांन धनीरेहाःलप्यमादर
साधधोकारपएगंथाः फरमदेमा

नधसरीहा: धर त्रीसनोगनिमोरा
सामोफडा: नहीगेयाः तधासपितमा
नोरः नारमा मारः मारमा फीडाः फी
डामा: धिफ: धिफमा फाधारापरफासः मत
रगडानीधरतायाफासः नरमासरना
मरपिनापनीजतःमरसफोरसानीफ
रसतासातः तमिनरानजनंयमरहिपःम
सतगमाहिपनामाहाहिपःहर्षलिपासङः
नामिमरमाःडामियसतपहीधाफराः
मंगमफाजरंघगनारजापतराःहिपना
सोफतनीमायापरपराःमायामाहिद
रोसतोफः तारिनापनामहिहिमोफःमरा
हिसरनातंकानजीफः नहीपामाो

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

भाइ: सप यप लाइ: सक्र ल यप लाइ: ल
भारो पर भाइ: परो लाभ: हरो संद: नंजे
र भ: कंस भाक्र भर: न भा साहां सद: र
स्र लाला: भा भा भालेसा: हक्र साहासो
रतना याली: ईसा सह संन: होसे ना: ई
सासनं नायाला भ दीना: ईसास साहास
द भाक्र: ईसां सन भार सादीक्र: ईसां
ये स सादील: सेदे सशा ईल साहाना:
सेदन्रर सांहां सद: सतगोर सलाहादी
न: सतगोर संससदीना: सतगोरनर
रदीना: सतगोर साहे भ दीना: सतगोरसो
दरदीना: सतगोर क्र भार दीना: सतगो
रईसास साहा: नारयला साहासद साहा:

[illegible]

ज्ञा त मारी: जं मो त मी: ज मा डो त मी: ते
थइ। थनेगार: दीपांन थाइ सामाजा:
तमे थनाथगा संजामार: सतगोर थोमा
मसामा: नर थलना मांमां मंइ सांमां: मकु
लाटेलाम: थेललामे: मांमां मइरर सुललला
मे: ॥३२॥ ॥३॥ ॥ दीपा
पासांकु लानीथा जाजमाडा ना छे: ॥
पा.जा.मुर मांना छे: पार मानजा: थेस
मला: मररे मे मांनजर रमामे: सतगोर
पात्रथर मा: अंइरथ मांम सामा: आइ
पास नाम: नरानजा: नर थलना मांमां मं
इसांमा: सतगोर पार कु पार दीन: स
तगोर पार सांइर दीन: सतगोर पार
सामे थ दीन: सतगोर पीर न सार दीन:

[illegible]

[illegible]

[illegible]

मांमंदरस्रुतः अक्रुतपापापातमाः
मफसाफाभोरतनायातः श्रीमांमफसंनः
मोसेनः भमांमननयानापदानः श्रीमां
ममामांमंदपाक्रुरः श्रीमांमंनापारमादी
फः भमामयेममाभलः भमामन्नरसत
गोरः सेदयेसमाभलमाफानोः सेदन्नर
मांमांमदः नर यसालामसाफाः सतगो
रसलाफो दानः सतगोरममसदानः स
तगोरनसार दानः सतगोर साफेपदानः
सतगोरसोदरदानः सतगोरकुपार
दानः सतगोरभमाम साफाः नर यानी
मामांमंदसांमांः नरान मांनकु मफा
नारांछुपाः तमांरानभतः तमारादम

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

प्रथम फारमान [illegible] ॥ ॥ ॥

फारमांनजा: पेसम लाः हररहेमा

जनररहीम: सतगोर पात्र पारमा:

अंदरथमांमं साहा: आदि पा सनपन

राजंजा: नरथला माहामद साहा: स

तगोर पार कुपार दीन: सतगोर पा

र सोहर दीन: सतगोर पार साहिप

दीन: सतगोर पार नसार दीन: स

तगोर पार समसदीन: सतगोर पा

र सलाहीदीन: नरथ सालांम साहा:

नरथलानरोजंजांम: मपानुरस

तगोरतमारा दीपा: ॥ दीपांनं पादसा

हाना: हासेनी पाट्णापठणासोरानंन

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

॥ ३४ ॥ ॥ ५ ॥

दासा जामनी माळा ता धाना छे: फरमान
जा: पीर सदरदीन: हररे हीमानान ररहीम: स
तगोर पीर फर मा: अहेरवमां मसाहा:
आदे पीर सनप: नरोज नानर चलमां
हाजद साहा: सतगोर पीर फरपीर दान:
सतगोर पीर सोदर दान: सतगोर पी
र साहेब दान: सतगोर पीर नसीर
दान: सतगोर पीर सम्स दीन: सत
गोर पीर सलाहो दीन: नर चसला
मसाहा: नर चलीन रोज नानामन
पीर: सतगोर तमाम दीया: ॥
दीमांन पीद साना; तमारे पारे थाना:
तमे खसमांथा जे छे तुमा कुदी: ॥ ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

नापरलतान थंभरभया: नेंडोप्यर
मापासनपन्यापरपारपूजा: रघु
पेंदनेंपाऌकि माला: थासतपभनो
थाधारेमाला: तेंनाप थंभरभया:
प्यानात्रतान गमा: सातकुरोंडासाधे:
रानाहिराभंद: थंभरभ या: नेंडोप्यर
मा: पासनपन्यापरपारपूजा: नेंनो
नरपेंदनेंपाऌकि माला: थासतपंथ
नेंथाधारे: तेनाप थंभरभया: त्राना
दीपापरनोगमा: नपकुरोंडीसाधे:
रानान नेंसार प थंभरभे या: नेंडोप्य
रमापासनपना: परपारपूजा: सा

મમદ નેમારિ કુઆતા:: આસત પંથ નઆ
ધારિ: તેણાપઠાંમ રખે ચાઃ આભાકુ માળ
ગામા:: ચ્યારકુ રોડાણાપ:: કુમમાકુ ચાર
ણી સોમતમારાયા:: તમારાધાંનાવ્યગ
સો:: અંમેધ નેગાર:: ઘડાઘડાણા:: પાત
પાતણા:: તતતતણા:: દીપાળ ચ્યાદ સાહા
ણા:: જેહ સામ માહાદેન માપુરખ સો:: તેહ
સામ ધરપાર આગામ અકુપો:: તેંમ સા
મ ગોર ગતમા અકુપો:: તે સત ગોરસો
દર દીન સામા:: તમારે સતે તમારે દ તેહ
રાંને:: તેણાપ નાધનામ ગ્યાસો:: જે કોઈ
ધ નેગાર ણાપ:: તમારે સાગા સકોચામો::

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥१॥
३५॥ ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

पानतो सतगोर समंसदीन नोः पानतो स
तगोर नसीर दीन नोः पानतो सतगोर सा
हिब दीन नोः पानतो सतगोर सादर दीन नोः
पानतो सतगोर कबीर दीन नोः पानतो
सतगोर इमांम साहानोः पानतो नर याहा
मांहामद साहानोः आदम राजन तेमान
नो कबुलात कुरीः जगो जगनां पातक छुतारी
सतगोर इमाम साहाः नर याहा मांहाम
द साहाः हक लाईलाहः इललालाहः मांह
मद रसुलालाहः ॥ ॥८॥ ॥३१॥

॥ ॥

इति पानना [illegible] संनाछुतरमांनी ॥ ॥






realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ ॥ ॥ ॥ ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

कायाः ओरासा धनतारनाहीमनमागाः
हीसतीनमांकरुरोडसुनाम्यानाः हीस
तीखपनकरोडसुमेघानाः हीसतीप
त्रासकरोडसुफनरनाः हीसतीपामक
रोडसुपरानानाः हीसतीसातकरोड
सु[illegible]दनाः हीसतीनवकरोडसुन
[illegible]नाः हीसतीचारकरोडसुक
[illegible]रनाः हीसतीअनतकरोडसु
[illegible]नंसाहानाः हीसतीन भायाक
[illegible]सतीपनंपांकानाः हीसती
[illegible]कसापरनाः हीसतीकालरचस
[illegible]गानाः हीसतीनमलीनमात
[illegible]सतीपारसाहानाना पनाः

संदेसाभानाः दासता सत्र साहेबनानाः

दासताफोलफाऍसंनापरपारनाः दास

ताऍफलाभनेथेसाहनारः पारपेगाभ

रनाः दासतासातफरसतानाः दासता

नानाथनेओरासासदना [illegible]

छासासं त्ररणाढनाः दास [illegible]

नाः दासतानपसंनपा [illegible] ः दा

सताभादासूरननाः दास [illegible] लभता

रानाः दासतायसरफोका [illegible] नाः दास

तीनपफोकनागनाः दास [illegible] भसे

धनाः दासता यणारन [illegible] तीनाः

दापानादासता येफरानाः [illegible] धंना

भापफराः नगोनगनाफरभ [illegible] दफाधो

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

नरधातामांहांमंदसाहाः सतगोरपा
रकपार दीनः सतगोर पार सांदरदी
नः सतगोर पार साहिब दीनः सतगो
र पार न सार दीनः सतगोर पार सांसं
स दीनः सतगोर पार सलाहो दीनः ॥
नरधसलांमंसाहाः नरधातामांहां
मंदसाहाः नराजनमनामंः नखानउरः
सतगोरतमारा दीपाः ॥ सुमामयाद
तमेः द्विनाद तमेः सबद तमेः तज तमेः
पुप तमेः छक तमेः पक तमेः ऊरतमेः
नरांजन तमेः नराकार तमेः पंदाकर
दीसर तमारः सबदसा सरजांससा
रः आदसरजमारज पांहाः सतरक

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

दीवाबाजोरीहंजभाकानीही: भरमांन
ना: भसमलो: मरहीमांनर रहीम: स
तगोरपारभरमा: अंदरथी मांमसाहा:
याहीबीअनपनरीजना: नरयालीमाहा
मंदसाहा: सतगोरपारकबारदीना: सत
गोरपारओदरदीना: सतगोरपारआहि
भदीना: सतगोरपारनआरदीना: सतगो
रपारसमसदीना: सतगोरपारसलाहि
दीना: नरयसलोमंसाहा: नरयालीनरी
जननाम: नबीकरसतगोरतमारादीना ॥
समामतमेयादनरीजननरांकार: दिव
कारमेसमार: पतीसरनाभाग्नामार:
मलरमरतपरतामांग्ना: मलरमरतमा:

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥४३॥ ॥ ॥१४॥

दा। पाजानेसोधाजरोजपापाणीनाछे:

भारमांनेजपेसमलो: हरेहमान:

नररहोम: सतगोरपारपारम: मंद

रपमामसाहा: आदपाससनपः नरा

जना: नरयलोमाहामदसाहा: सत

गोरपारकपारदान: सतगोरपार

सादरदान: सतगोरपारसाहेबदान:

सतगोरपारनसोरदान: सतगोरपा

रसमसदान: सतगोरपारसलाहोदान:

नरयसलामंसाहा: नरयलामाहाम

दसाहा: नराजंनजांम: नपाकर: स

तगोरतमासदापा॥ समामायादन

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

मापेदमासतार:थाएपरमानमामा
हामंदरस्राला:हकुसाहामोरतामायला:
एमामहसंन:होसन:एमामणंनय
लापद्दान:एमामंमाहामंदपाकुर:ए
मामणापरसाद्दीकु:एमांमयेसमाए
ल:एमामंजरसतगोर:सेदजरमांहा
मद:तमारोपरपार:नप्लाजरसतगो
र:नरयसलामसाहाद्दातार:सतगो
रसलाहोद्दान:सतगोरसंमसद्दान:
सतगोरनसारद्दान:सतगोरसाहि
पद्दान:सतगोरसोदरद्दान:सतगो
रकुपारद्दीन:सतगोरएमामसाहा:
नरयलामाहामदसाहा:हकुमोला
नासोलतान:माराना दऽगी:तमे

[illegible]

[illegible]

दाभारपामनजानोमननोक्षुगासहो:
भरमांनना: भेसमनोहररेहेमान
नररहीम: सतगोरपात्रभरमा: मंदर
ढमामसाहा: याद्दभासननननरानना:
नरयानामाहामदसाहा: सतगोरपार
कुभारदान: सतगोरपारसोदरदान:
सतगोरपारसाहेभदान: सतगोरपा
रनसारदान: सतगोरपारसमसदान:
सतगोरपारसलाहोदान: नरयसल।
मंसाहा: नरयानानरानंननाम: नभ
रुर: सतगोरतमारादोमा: ॥ समाम
तमं याद नरानननराकुार: यककुारभ
सहिभासतार: भरमा: भासनम: ॥

[illegible]

परमाणिस्मारीः नरचलतमांहांमांहस्मा
हाः सतगोरधर्मास्माहानतदेवाः॥
सतगोरपारकव्यारदाननादेवाः
सतगोरपारसोहरदाननादेवाः॥
सतगोरपारनसारदाननादेवाः॥
सतगोरपारसांमसदाननादेवाः॥
सतगोरपारसमाहोदाननादेवाः
नव्यारः सतगोरनरचलसमामस्मा
हानादेवाः चाहवासनपनाराइणः॥
सेसरनाधइणः तं मेरमोसतपंथमे
ताकरीणिजावतहणः हसेवपतारमा
हः तं मेनरामं नानराकारः माजीसर्व
मांसनादेवाः सक तत्यात्यामातं मा

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ ॥४५॥ ॥ ॥२१॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

तमारा पगाने परता पैंकु राने: तेजा पने
भोगता धार करी: थमर पेहने मलको
करने: रपा संकने पामाको: नप्पाकर
सतगोर: नरपम लाम सामि: सतगोर पा
र सलामो दीन: सतगोर पार सेमस दीन:
सतगोर पार नमार दीन: सतगोर पार
साम्हि दीन: सतगोर पार सोदर दीन:
सतगोर पार कप्पार दीन: सतगोर धमा
म साहा: नरपात माहामद साहा: तमे
यादि पास नपनाराय का: पातापलाते
तनापसनार: भोलतानं ना भोगार: ना
पर दीपना सोलतान: नापूना पर दी
दार: तमे तमारा पामामा पा : ॥

जारेवनरीमम ताः तारे तमेपामाघ
धीः याजतेपामापाजोः तमारेफरमेः
तमारेघरमेफरानेः तमारेसतेः तमा
रेद तेफरानेः तमारादे याएः तमारामा
याएफरानेः तमाराज्ञेमासतोफेफरानेः
ना
तमेमेहरनजरफरानेः एजापनेप्या
पनधारापोमाडोजाः जेमनपाडुडु
रोडाजाभ्यापोताः जेमघपनंफरोडामे
धापोताः जेमप्यत्रासफरोडाफेनरपा
ताः मपेते त्रासफरोडादेपनामेजापू
राफरोः जाप्यू द्यापनाजरजापूराफरोः
याजयमरपेदनेपाएफेफरानेः प्यार
मापासंनपनाफपायेफरानेः सेतसे

ठा सेनाः कालकावि मनापरमार नेपर

तापि करानेः तमारे सते तमारे दते करानेः

सप सकतना पगने परतापि करानेः ते

मापने व्यापनं घारा पामाठेः रपामां क

जमापास याले: मारे व्याका जा पिरार।

जोः नरयालो नसावं नं नक जाकानार।

येडाः दसमायापतारः सतगोर पात्राव्य

रमाः औदरधमामं साहाः नरयालोमाहा

मदसाहाः मीलोनातसेजा प्रनातारज्ञ

हारः धजापनें प्रजागोत्र माहेः एकोत्र

सोमाहेनाः एकोत्र सोव्यापनाः सातको

जसोजसानाः एजापपासना करेः जे

जापथा सारायेः तेजापने तमारापान

जने परतापि करानेः व्यामं न घारा

[illegible]

सांईनाः कोलकोटिजनापरमारनेपर
तापिकरानेः तमारेसतेतमारेदतेकराने
सपसकुतनापगनेपरतापिकराने
जापनेव्यापनंघाटपोभाडोः र
जमापास थालोः मारेव्याडणा
जोः नरथलोनसानंनंनकुजफाना
थेडाः दसमाथपतारः सतगोरपात्रव्य
रमाः श्रेदरछमामंसाहाः नरथलोमाहा
मदसाहाः मोलोनातमेणापूनातारडा
डारः छजापनेफोजगोत्रमाहेः छफोत्र
सोमाफेनाः छफोत्र सोव्यापनाः सातको
जसाजसानाः छजापपासनाकुरेः ने
जापथासाराफेः तेजापनेतमाराषाम
जनेपरतापिकरानेः व्याम नघाट

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

२४

लोमाहामंदसाहा:कुलाटलाह:पलतहा:
माहामदरसूललाहि: ॥४॥ ॥
हीवात पनेउवासको यासासना छे:॥
पारमांनगा: पेसमला: हररेहिमान: नर
रहीम: सतगोर पात्र पारमा: अदरवमा
मंसाहा: वादीपासनप: नरीगंना: नरय
लोमाहामंदसाहा: सतगोर पीर कुपारदी
न: सतगोर पीर सोदर दीन: सतगोर पी
र साहेप दीन: सतगोर पीर नसार दीन:
सतगोर पीर संसंस दीन: सतगोर पीर
सेलाहो दीन: नर यसलामं साहा: नर
यलो नरीगनना: सतगोर तमारी दी
पा: ॥ समांमी त मेंगा पूने मेंहेर पुरा:

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

तमनसनना: तमेथलेम: तमेथला:
तमेरामः तमेरहिमानः तमे यदिपासन
पः नारायणः नकलंकः नयाजुरः सत
गोरनरसमलोभंसाहाः हातारः सतगो
रऋसलाहादानः सतगोरसंम
सतगोरनसारदानः सतगोरसा
नः सतगोरसोदरदानः सतगोरप
दानः सतगोरछमामसाहाः नरम
हाभंदसाहानयासाग: समामातम प
यलेकरो: तमेसाहिमसोलतानः नेकप
नायारमदसमानः सेरहपयेरामह
फादामोफामः तथामामसाहिमसोल
सतानः नेकोजनरमहेफादाशामः तया

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

सतगोर पीरकु प्यार दीनः सतगोर पी
र सांदर दीनः सतगोर पीर साहिब दी
नः सतगोर पीर नसार दीनः सतगो
र पीर समस दीनः सतगोर पीर सलाहो
दीनः नरचंद्र साहाः नरचलीन दी
नननाम सतगोर तमारी दीनाः ॥ चली
मि दीसाः अलो सर प्योदाः मुसनासाः
दमि पलोः तापिजा कोटः लोहि कुसादः
ननसेन पांचन दीक्षा साहा दावरः को
लांनाम गासवाराः सांप्य कु पार मानः कुरीः
सेलान प्यालो धरकरोः दमदीहिलोः पार
साहिलोः दमे साहानोर तना चलोः ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥५०॥ ॥२२॥ ॥२३॥

हे पीरजी ... सामीमाणा का ...

पारमांनजा: ... समाणा: नरहरि माणा: नर

रसास: सतगोरपात पारमा: ... मांस

सांसां: आदि पासन पनरोण्या: नर अ

ला मांसां सइसांसां: सतगोरपीर का अपरदा

न: सतगोर पार सोहर दान: सतगोर पार

सासि अप दान: सतगोर पार न सोर दान:

सतगोर पार सम सदान: सतगोर पार स

लासो दान: नर अ सला म सांसां: नर अला

नरो जनना म: सतगोर तमाराहो पा: ॥ ॥

सपांमांत मे सोरोजनहार: पारमा कों अ

पतार: आदि पासन पका अमरूप: आद

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

નાપાઆ: શ્રી ફોરમનાપાઆ: શ્રી પારાના
પાઆ: શ્રી નરસાહનાપાઆ: શ્રી પાસંગના
પાઆ: શ્રી પીર સદરાંનાપાઆ: શ્રી રાજના
પાઆ: શ્રી ફેરસાનનાપાઆ: શ્રી ધાંધના
પાઆ: શ્રી નાકુલ ફુનાપાઆ: સકુસોપાના
સાહેસોરલગોલલનાપાઆ: નલાનરસ
લગોર: નરલસપાંસસાંહે: પારાનાસર
દ: સતગોરસપાહેદાન: સતગોરસસસ
દાન: સતગોરનસારદાન: સતગોરસાહેબ
દાન: સતગોરસોદરદાન: સતગોરકુબાર
દાન: સતગોર ૭ સાસસાહેનરલલસાહે
સદસાહે: સેતસેહેસેનાફોલફાલેસ
નોપરપાર: નાંબદાપનરલસમ: કુલા

[illegible]

लोंकनादादानाआः सपासीतमारेनाम
काकंपीःतमारेकरमेंघरमेः एनापनेस
तपमारगमाहिराख्योः गोरनोरनोदेघ।
रयापोः एनापनगोनगेतमारोछेः एना
पनामंतातमनेछेः एनापनेपाकपावन
करोः सतगोरईमामसाहाः नरयलीमा
हामदसाहाः हकलोयोलाहः ईललाहोः
माहामदररसुललाहः ॥ ५२॥ ॥२२
दोपापरकेनानिहधेपाओंव्याघानाछेः
पारमाननाः पेसमलाहररेहमानःनर
रहीमः सतगोरपाखयरमाः अदेरफ़
मामसांहांः यादेपासनबनसाननाः
नरयलीमाहामदसांहांः सतगोरपा

रुक पार दानः सतगोर पार सोहेर दानः
सतगोर पार सामेय दानः सतगोर पार
नसार दानः सतगोर पार संमंस दानः
सतगोर पार सलामे दानः नर यसला
मसामेः नर यलीनराजन नामः नप्पा
करः सतगोर तंमारा दीपा ॥ गोर पामाः
नोर पामाः रहेर सोक ता पामाः पर मालि
सनपः मामेसर ना पामाः पर माननाराये
पाकः सत पामाः हत पामाः पेह पामाः याहे
यालसतपंथना पामाः पे हप सपर पारना
पामाः नप यक पेर धमानना पामाः मोपासे
कलकना पामाः अमसर कोलपर यतना
पामाः नपकोल नागना पामाः मारको

ગઈધનાથાઆઃ સાટસાહિરનાથાઆઃ
નાથસેનપાઠુ નદાઉ નાથાઆઃ આરખા
ડાઆરપાડાનાથાઆઃ આરસિંદઆરકુલ
ખનાથાઆઃ અડારઆરપંનાસપતનાથા
આઃ અંદાસુરજ નાથાઆઃ નથલોખતારાં
નાથાઆઃ અઉદેનથનનાદેનલોકુનાથા
આઃ પથનપાંડાનાથાઆઃ અગનાતેજ
વનદેપનાથાઆઃ ઘરતધાકુાસનાથા
આઃ ઘઘોકુારપાહિકુરડાકુલપનાથાઆઃ
જડખધનંજોગનાથાઆઃ ધડઘદાનાથા
આઃ સતદતખપાનાથાઆઃ સતજતના
થાઆઃ સતાકુરેહિડાનાથાઆઃ ધડસઠત
રપનાથાઆઃ સાતપારસતાનાથાઆઃ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

२०४

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ ॥५४॥
[illegible] ॥ ॥ ॥
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

સતગોરભમામસામીઃનરચલીમાંહીમ
હસામીઃહકુતીબ્રતીહીઃભતતીહીઃમાહીમ
હરરસુતતીહીઃ ॥૫૫॥ ॥
દોહા ઘેસત્રાનેતાભૈતારાતાછેઃ
મરમાનનઃભ્રંસમલીઃમરરહીમાંનંનરરહી
મઃસતગોરપાતરપરમાંઃહંદરભમાંમસામીઃ
ચાદપાસનાનવીજનાઃનરચલીમામી
મહસામીઃસતગોરપારકુપારદીનઃસત
ગોરપારસોહરદીનઃસતગોરપારસાહીપ
દીનઃસતગોરપારનસારદીનઃસતગોર
પારસમંસદીનઃસતગોરપારસતાહીદી
નઃનરચસતામંસામીઃનરચલીઃ ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ત્રમ રમાઃ અંદર ઈમાંમ સાંહાંઃ વાદેના
સનાપઃ નરીજનાઃ નર વાતા માંહામદ
સાંહાંઃ સતગોર તંમારા દીનાઃ ॥ વમરપે
ઘડા વેમંધા વાઃ પાર સાજ્ઞા વમરપા
વાઃ અપાર વાચર દેદાર વાંપોઃ ઈમાં
[illegible] લાંમંતરાઆઃ સંત સપૂરા વાપોઃ
[illegible] કોડ દાંનાઝાપોઃ આલેત ઘરે મરેતે
[illegible] ઝરનાઝ નાઝ પાર સાહાજઃ જેરઅ
[illegible] નેઃ તેનામ આરઝરીકના સાઅતે
મનાઃ સતગોર ઈમાંમ સાહાઃ નરવાતા
માહાંમદ સાહાઃ હઝાલેલાહઃ ઈલાલા
હોઃ માહામદ રરઝલાલાહઃ ॥૫૮॥

[illegible]

રખાવમાઃ અંદરખમાંયસાંહાંઃ યાદના

સનાતનઃ નરીજનાઃ નરવાતમાંહાંમદ

સાંહાંઃ સતગોર તંમારા દીધાઃ॥ ચમરષે

દીકાવેમંધાવાઃ પારસાનુસા ચમરકા

વાઃ અમલ વાખરદીધાર યાંપોઃ ખમાં

નંસલાંમંતરાખોઃ સતસખુરા યાંપોઃ

કોડકોડ ધાંનાકાંપોઃ ખોલેત ધરીમરેત

લરેઃ જરનાકુ બાકાપારસાહાંનઃ નેરખે

સરપાવેઃ તજામખારકરોડનાસાંખત

મનોઃ સતગોરખમાંમસાંહાંઃ નરવાતા

માહાંમદ સાંહાંઃ હકલાવે લાહઃ ખેલાલા

હોઃ માહામંદરસુલાલાહેઃ ॥૫૮॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

મરી ચાલનામ સરાજ: પરાઈ માંનારીમા:
અમ્મારે ચાલેપ્યાર માહા: પાલાજીઈ પલા:
પર તા ચામાસ પપંનં પાયા: સંઈાસ્રરજ:
નપલેખ તારા: ગોપતા: પરગટા: ફાયામાં
ગા ત્રમા: ચાયા પેખા ચે: જે કાયજ રનાપા
સનાકરે: તેજાબના ચાસાપૂરો: ચાઈખ
રમાચે પરમાપાચો: માંઈ સેનાખ્યાપારો
ચ: અનતરૂ પેખખ ત્રફાયા: ફેરતારમ્રરત
સાચ: સતગોર ચમામસાહાં: નરચાતામાં
માંમંઈસાહ: મમ્રતાજીતાહ: ચીતલાહી: માહાં
મઈરરસ્રતતાહે: ॥ ૫૮ ॥ ॥
દીપાકુમ સહિડાણનેસ રદ્દાંકારધાંતા:

[illegible]

નપાપનાકુરનહીએ: ગનાનીઆધાંમન
રહે: ગોરમંનાંગાંનાનનહીએ: યાદુકુનમ
દાએ: આેલમઝપના: લકુરનાપૂનાપરા
પરલલહીઞમાઝના: દસીદઞામાપઞલ
રલલહીઞપામાના: નાપકુારપીનપીઆરમા:
આમકુારેવાદઝનાદવલા: લહીમાહીનોદ
ગાદેપલા: વાનકુમનગામાં વલા: આલમ
નરાનંના: વપલારપાર: ઞોનરવોલમ
ઝપના: હીઞપામાના: જેનરમાનલે: જેન
વંમરમાંગલગા: વમર
રપ્રજલે: ઞોનરલેહીલે: વમરાપરમાઞગા: ઞોમા:
જેનરનુમાનલે: નપૂજલે: ઞોનરના
વલે: ઘોરવઘારે: લનાપનપોમપ:

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ ६५ ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥૬૬॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ગાયત્રી બેગાડી ના મરપાસામ

નાઉ પેળવ ઉઠાવવું ઈ

રાજ મતી॥૧॥ મરપાસ જોઈ૨॥

ના ના ના ગા ગાગા ગાના

મરણ પણ ના ૩॥ના હરજે રાજ ૪ના

ઠા ખાખાજ્ઞાના ગા વદાણ્ણના વાડ

નાશ્યુંના રાજ ઉૈ ઠા ઠાના ગાણા

મરણ પ્રશ્ન ઉતરનનો બેઠાના ૫॥

૪	૮	૬	૨
૫	૩	૩	૯
૪	૮	૬	૨
૭	૨	૫	૭

મા જન પાસ

છે તરંવઠ પર

ગાઠ

[illegible]

॥३॥

3

[illegible]

[illegible]

तजीजा: पाञ्जाहुसपपासोञा
जहीणाङ्गाहुङ्गिङा अजलनाः सलाञ्जेंहु
रें सतरेजाः हुलगी लङुयपानङाःहलगोन
श्रीपादसाः हलङुसलपञमजोमनाःञ
सङरजीः रेंहुनजाः जुरसहराहुपु
हाःङानलिङुपहारङा मेंहञ्जेंसञ्जसे
रजनाङञङुहुंञमरजरपलाहुञा
रहेंमारञु जसेःइतनाञमरजरप
नाहुयारहेंजारञुजासाःइतनाञमर
जङुरनाहुः जनसेंहु मेंरीलगनः
ञपलनः मेंनाज जा जोङुरुइतलज
जुजपरजाहुोञमेंहु पाजोहुनःहुसरा
रीजमेंरा मेंरीगीपारसहुांपैनसलपः
नापेंनञिङुरनालङुः जुजपरनाहुोञ

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]


[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]



[illegible]



જાણજુ ઉનાળાસુધી
દેસમાં રેસે કે અ
વસો ઉનાળાના
જાણજુ તમોએ ગા
હાલમાં સથવારો
ક્યારે લેવા આવ.
સાળા ભરવા થયા
સમાચાર લખસો
કૃપા કરસો ખાનાં
રેસે ને મું સું ક.

તા. ૪-૧-૭૯

જી ભા ભેગા

કુવરાજ કરમશી

ભા. વાલજી

ત્યા દશોરૂ કેતેન્દ્ર

સર્વે ત્યા આપણું

ઘર સુખી રાખે

તી સગાંવગી લી.

ત્યા ભાલાજી ત્યા

ની ત્યા આપના ઠીકર્ધ

ાસ પરચાત ત્યાં

એમ કુશળ સર્વે

ચરસે

તો રમેશ ભાઈની

ની વાલી પડ્યા

ા કુપા ફરસે

ીને ને જણાવવાનું

ં ભેદાજ કુવાની

સમાચાર ના

ં જે લખ્યે. પત્રોત્ર

ા સમાચાર લઈશું

નાના-મોટા સહુ વિદ્યાર્થીઓ મા[ટે]

અમારાં પુસ્તકો

૧. સુબોધ વાચનગાડી – બાળપોથી

૨. ફૂલપાંદડી

૩. ફૂલવાડી

૪. લેખનદીપ : ભાગ ૧ થી ૪
ધો. ૧ થી ૪ માટે

૫. ગુજરાતી સુંદર વ્યાકરણ : ભાગ ૧–૨
ધો. ૫–૬ માટે

૬. સરળ હિન્દી વ્યાકરણ : ભાગ ૧–૨
ધો. ૫–૬ માટે

૭. અંગ્રેજી નિબંધમાળા ધો. ૫–૬–૭ માટે

૮. ગુજરાતી નિબંધમાળા ધો. ૫–૬–૭ માટે

૯. હિન્દી નિબંધમાળા ધો. ૫–૬–૭ માટે

૧૦. અંગ્રેજી નિબંધમાળા ધો. ૧૦–૧૧ માટે

(ब) વિભાગ (ક) માં સ્થળોનાં નામ આપ્યાં છે અને વિભાગ (ખ) માં તે સ્થળ શાને માટે પ્રખ્યાત છે તે જણાવવામાં આવ્યું છે. બંનેને યોગ્ય રીતે જોડો :

(ક)	(ખ)
૧. રેહા	૧. ચિરોડી અને ફટકડી નીકળે છે.
૨. બિદડા	૨. કચ્છનો જાણીતો બંધ છે.
૩. તુણા	૩. કેરીના પાક માટે જાણીતું છે.
૪. માતાનો મઢ	૪. સૂડી–ચપ્પુનો ઉદ્યોગ છે.
૫. વિજયસાગર	૫. મચ્છીમારીનું સંશોધન કેન્દ્ર છે.

૬. નીચેના દરેક વિષે તેની અગત્ય બતાવતાં બે-ત્રણ વાક્યો લખો :

(૧) ભૂજ (૬) સુમરાસર
(૨) કોટેશ્વર (૭) જખૌ
(૩) મરૂ (૮) નખત્રાણા
(૪) ભચાઉ (૯) ચરાઈ
(૫) નરેડી (૧૦) આધોઈ

નીચેના દરેકનાં મુખ્ય બે-બે કાર્યો જણાવો :

(૧) સમાહર્તા (૩) શિક્ષણાધિકારી
(૨) મામલતદાર (૪) જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેટ

૮. નીચેની હકીકતો નોંધો :

(૧) તમારું નામ
(૨) તમારા ગામનું નામ
(૩) તમારા તાલુકાનું નામ
(૪) તમારા જિલ્લાનું નામ
(૫) તમારા તાલુકાની કોઈ એક જાણીતી વ્યક્તિની માહિતી
(૬) તમારા ગામના લોકો અને એમના મુખ્ય ધંધા
(૭) તમારા ગામનાં હવાપાણી, વરસાદ, ખેતી, પાક વગેરે

In actual book, there was a section break earlier.

Actual book page 96 of this section had ended earlier on page 222 of this scanned file.

[illegible]

२ भला आलजीना॥ सोलाणुंरेताला हुला॥ २॥
मालरेसाराइदरपे॥ रुलाणुंरेताला हुला॥ ३॥ भभ
शालमालरुभीशा॥ सोलाणुंरेताला हुला॥ ४॥ भोल
लघत्रारी॥ सोलाणुंरेताला हुला॥ ५॥ मुसापार
ठरीमां॥ सोलाणुंरेताला हुला॥ ६॥ मुसापारसा
हीरा॥ सोलाणुंरेताला हुला॥ ७॥ ठघला॥ रुघला॥ सुला
णुंरेताला हुला॥ ८॥ भाअेदलरुबांद॥ सोलाणुरे
ताला हुला॥ ९॥ येमरला डितालफु॥ सोलाणुरेता
ला हुला॥ १०॥ असीभाउला रुपीरो॥ सोलाणुंरेताला
हुला॥ ११॥ ३ादरुला पाअेदद॥ सोलाणुरेताला हुला॥
१२॥ ठरुदल ठमीद्व रो॥ सोलाणुरेताला हुला॥ १३॥ भ
लीलाठी॥ आपरो॥ सोलाणुंरेताला हुला॥ १४॥ भाअे
नज्रोठरो॥ सोलाणुंरेताला हुला॥ १५॥ रुअेरला रुफु
रा॥ सोलाणुंरेताला हुला॥ १६॥ अलमाकतारो॥ सो
लाणुंरेताला हुला॥ १७॥ रुरुदपा क्रनाद॥ सोला
णुंरेताला हुला॥ १८॥ नकुपलो रुफु अेना॥ सोलाणुं

केतालाहुला॥१९॥ ठकेत लाकेशीब॥ सोलाणुं केताला
हुला॥२०॥ माठेकी अला केरीमां॥ सोलाणुं केतालाहुला॥
२१॥ मालअल्लुल ठके॥ सोलाणुं केतालाहुला॥२२॥ बा
अेरकुल॥ पाअे रकुल॥ सोलाणुं केतालाहुला॥२३॥
बाकीमां दाअेमां॥ सोलाणुं॥२४॥ गरीब अलसामे
ठेजुद॥ सोलाणुं॥२५॥ मनारो दलमने अखुं॥ सोला
णुं॥२६॥ रजाब रउफु॥ सोलाणुं॥२७॥ ठनुनलामेठ
जुना॥ सोलाणुं केो॥२८॥ ठबीबुला॥ कुलला न॥ सोला
णुं केो॥२९॥ वकील लोकेपुरी॥ सोलाणुं॥३०॥ कोदर ला
मुकीदर॥ सोलाणुं केो॥३१॥ ठधलामुजब॥ सोलाणुं
॥३२॥ कीआ हरला हुकेम॥ सोलाणुं॥३३॥ अलाठीमाला
केरीमां॥ सोलाणुं॥३४॥ सतारलुं आरबी॥ सोलाणुं॥
३५॥ वाअेणुं आरफीआ॥ सोलाणुं॥३६॥ कबीरलामा॥
तअली॥ सोलाणुं॥३७॥ सदकुला अेदल॥ सोलाणुं
३८॥ ताहेर हुलाठेरो॥ सोलाणुं॥३९॥ वकीउलावेठेमेर
लाओदीनो॥ सोलाणुं॥४०॥ वेठउलाबकील॥ सो॥

पलोडिलाना सम सोलाणुं ॥२२॥ सरीडिला पकरी
ना सोलाणुं ॥२३॥ रफुला सोलाम सोलाणुं [illegible]
मेहेणा रसला लाणे सोलाणुं ॥२४॥ नरीन सला
मनसुं लासे सोलाणुं ॥२५॥ ठबीणुला ठमीध सोला
णुं ॥२६॥ मेहेणुद सला डिला नरीध ॥ सोलाणुं ॥२७॥ त
बीणुला पधणुं ॥ ॥ सोलाणुं ॥२८॥ पसेरेला फदली
ना ॥ सोलाणुं ॥२०॥ पसेरेलाना सरना ॥ सोलाणुं ॥२१
पसेरेला ठरन ना ॥ सोलाणुं ॥२२॥ पसेरेला पासाला
रना ॥ सोलाणुं ॥२३॥ पसेरेला मानसणुसाना ॥ सो
लाणुं ३ ॥२४॥ पसेरेला नाना डिनीना ॥ सोलाणुं रे
॥२५॥ पसेरेला ना ठे राना ॥ सोलाणुं रे ताला ठुला
॥२६॥ पसेरेला सारराना ॥ सोलाणुं ॥२७॥ पदेरेला
सरीफ ॥ सोलाणुं ॥२८॥ लासे डिला ललफीसे सला
सोलाणुं ॥२९॥ पलीसा ररीना ॥ सोलाणुं ॥३०॥ पदे
रेला सरीफ ॥ सोलाणुं ॥३१॥ लाडो सपल ठे ठन
दलरापालमाठा ॥ पसा लराल रीरी ठुप डिपातरी

॥૮૯॥

નળપાએતા॥ઠઉલાએઈઆનીલા॥આદદેલાખાદે
પા॥અનરા અલાનુ॥ફુલસીનોશદરેલી॥ફુલન્ડલા॥
॥૧૯॥ લાઆઈલઉનાએ॥ઠરીફુલરાદરા॥ફુલઆઠ
રા॥ ભ્રુફુપાફુલન્નઠર॥ફુલાઆઆ॥અલાલુખરા
ઠ॥ભુલઠરીમાંઠા॥ઈમાંનલાનાઉલાએ॥ઠઈઆપા
મઅંફુમાઠા॥લાઆઉગાઉપાર॥ઠ આઆપાઉપારી
દિ॥૨૦॥ બ્ધીઆ આઈઆ આ॥લાઠીમાળાપાવેલા
ફુપાઅન્લીના॥અલાફુલરોરાઉનાલા॥લાઠાઆઠી
ના॥બાલમાંઅન્લો॥ફુલરીતાબાળલાઈ॥ઈઆબાઠ
રા॥ઠાઈધરે॥લંલામાઠાલરેના॥પેલાનુન્લાઆ
ફુલરેલાબાઉલાઈઆરી॥૨૦॥ ઈઆએફુઆલુદરે
લંલાલાઆમાઠાલરીના॥પાબોલામુન્લે॥અપઠો
અલ્લાઆઆ॥અલાઠા॥ઈલંલાઠ॥નુફા॥ઈલો
રઈલા॥પેઠબોલા॥મુન્પીતા॥અળતાસીના॥પઈઆ
સીના॥પલીફુરાનીલા॥૨૦॥ ઠરાનનુનાપલી॥
ફુલરલમાં॥ઉપામાઈઆઆઠ॥તાઈઆનોઈમાન

[illegible]

॥१००॥

आरीनले नु लाय सावीना रेलाता अलाहने

रसुला हमाइना अला असुराना मकउराम

पला अेनुं अलाहोमा तेन अला छमानरी आके

मान अपद हरीप मानुन लाना अनारी लोना अ

लीरोमाहोप सोल लानो अलाह पनलनु फुली

आपाल नुला उनापनी आननानुजी लाआरक

लाला आउरे तलीमाना अनमां अलीनमां

अलोनना ने आलनुल नुराना रेताया अनमां

॥११०॥ फुपारनुलनाला हनीना अननां रीनपाल

नरालमनाछरालमरी आउपानुरानन आ

लना पसीना उपरीना दी आली आ रसुली

ललाहे नुकलीमां अलाह हनद लंना अलाहो

रपला आललीना अलाहो ॥१२०॥ अला आपरीन

हननीना नुसापाइना हछला हमाल रेसनुप

लानुरांन नुलना आआ रफुं नुला अे कल उ

लपलाहे अपदना द आमा ॥ १२०॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥२०१॥

३उिपतअ२३तधी। अला३ाअ२कुरजीगुतछे

अेदवानी३उिपतअ२३तधी। जमीआकमान

धर३ रआछे। जेमतआअे३मेठन। जअराउअे

तठ३मधुदाणोतेइने। सणीआमाठेज्जपतेपा

आवेछे। ते३उिपतअ२३तअेक रवेषाजणामा

णीछे। अेदवापडीने आवेछे। अेदवानीअ२२

तधी। संद२माणकु२जमातेछे। अेदवानी३उि

पतअ२३तधी। मेठेरअकेशफीलकुरफूरेछे

तारेधणीआकरवेउठअे। अेदवाआजुनीआ

जणमु३ठेछे। तेद२पाजतीस्तोणा आ२रो

लआछे। तेमेठेनजअराइअेत३ठेछे। इआ

मठनदजुस्तफा। ठररोजवामेत्था सालके।

त्थालधीनेपोतानीजमणीआजुवेआंधे। ते

पुदातातात्मेफ२माव्युंछे। तेनेधोरणाआज

अधणमणठीधाअे। ३ाअेतेजपहोनअपेण

णतीजअे। वस्तीजे३ाइअे३रताराखीने वाये

આસાલક - તે ને સા હેબ ઘરણીમે હે રવ્યાની કરીને
પોતાના ફરઝંદ ની પેરે રાખસે - તે વઇ ઇન્ય રા
ઇઝ્મેલ કહે છે - ઇમામ હમદ શાહ સતફા - નેકોઇ
તમારી ઉમત માં હોશી - ઝરવે ઉમતના ધેયા રે એક
જ્યતા રૂધી વાંચે - આસાલક - તે ને સાહેબ પેગા
બરત ને હે ઝાણે રાખસે - વળી આઇ છે બપ યુંહો એતો
એદવાલઅોને ફરતમદ સાથે ધોઇને પાએતો
તો તેની દેહીના દેખ - સરપેના એ - બણા ઝોએ ને
ઘેરબાર પડુંહોએ તો - એદવાલ બાને ઘર ઉ
પરગુકીએ તો - એદવાળી ગઉવલ પરફેલ ફો
સોર આવી ને આગ રાઉિલોરને - રુદાક દરુનન
નેહાયે આવાહ ઇએ - એદવા પડીએ તો - સાહે
બહોડાયે સહી - વણી એદવા ફનરનોપ પતેયા
રનણ - દન એ રૂપ રતે તેવા દળઝણ લગી પડે તો
મલા એ કેનણા સીન હનર - તેપં દાનીર ફીઝાઝા
રણ ઉનારને - તેના એ કેબપ રાઇ એલ કહે છે ॥

कोरोइलमारी उमतमांथी. हररोजचारअडे.
जपेतांहाज़रथायछे. आआलमे. तेनोसंपालतजो
छे. पुदातालाअेफरमावुछे. तेनेलमलमांहे. अेकतोर
र. सेतरवजसीसडरसे. अेकअेकसेतरमांहे सीत्र
सीत्रहजार घरहसे. अेकअेकघरमांहे सीत्रसीत्रहजार
तखतरमाहसे. अेकअेकतखतनाउपर. सीत्रसीत्र
हजारहुराक्षिपोहीहसे. अेकअेकहुरानाहाथमांहे.
सीत्रसीत्रहजारतबाखलहसे. अेकअेकतबाख
मांहे. सीत्रसीत्रहजारजातनामेवा. सोभितहोअेत
से. तेइआमेनिअमतबराइअेलइरेह छे. इमामहोमद
मुस्तफा. तमारीउमतमांथी. हररोज दसोहे. मांहे
जतेआपसे. तेतेपछेरजबडरसे. अने अेदवा
हररोजचारअडेपडसे. जपतासुधीतेनेरोजे
आमतनेदाडे. पुदानामंदरमांजयावलहकापास
तेपुदातालाअेफरमावुछे. तेवइजयराइलकोछे.

जेहआनतनेदरुस्तका. जेरोइतमारीजि
तमांडेथी. अेआजुनी धावावारअगीआर-द
नअेरुपरते. तेवादनअगीआरलगीपडअे.
तोतेनेवास्तेखुदातालापोतानोखुदाख. तेवदा
नेवास्तेमोकलअे. तारे रुताला पासे. पेगाम्बर
बेठा हता. तारे तेमनमेदरसुलनाअेखुदछे.
छआपारुपखरवरदीगार. अेणेबंदेदनीआमांडे.
करीकमाइकीधीछे. जेतमेपोतानोखुदाखमोकलो
छे. तारेखुदातालाअेफरमावुंछे. अेरोगबंदेदनी
आमांडेदनरुपरत. वारअगीआरअेदवापडी
स्यामालजीछे. तेवादनअगीआरलगीपडीस्यां
मालजीछे. तेनेकरबंदगीवास्ते. तेनेअनेपोता
नोखुदाखमोकल्योछे. छआमनमेदखुस्तका. तेवा
जखरावअेलरुनछे. जोअेदवाडुंगरउपररवेशी
नेपडलोडुंगरपरधरद्देजे. जोअेदवापाणीउपर

पडीकु रनाखीअेतो॥पाणीपाछु फरे॰ अनेमारगमा
तेअठी॰ अेदेवान्मीनउपरव्येसीनेपडेतोम्नीन
अत्यथरीथाअे॰ अेदेपापडेतोभुधातालामेठेर
पानीउपरआवीने॰ तेथंधानाकुलगनाथ्येअे॰ अेदे
पानोअफाअेलरसुलपेगाबरेधणीधणीजीधोछे
अेदेवानेवीवीनदेपाडोअेनथी॰ अेअलातालाईया
राकेठेपाअेछे॰ तेमेठेरनथराइअेलकेठेछे॰ ए
आमठमदमुस्तफा॰ नेनोइदीकानननेठापेआ
पाठुइअे॰ तोअेदेपापडीनेनअेतोफलकेरीनेआवे
तेथरकतमारपेअेदेवानोछे॰ ॥ थानेनामुथ
सीअेतसीधाकुफुरतोछे॰ ॥ ✿ ॥ ✿ ॥ ✿
॥नोसफुरनामुतथुछे॰ नथीसमठेपकु॰ ॥
॥ ✿ ॥फरमानछ॰ थीसमीलाहे॰ रहेरहेमान
नीरहीन॰ अहुनेथीलाहे॰ [illegible]
न॰ नरलछन॰ वलफनल॰ फरमानछ॰ थीस

જીલ્લાહ॥ હર રહે જાણ॥ બીર રહીમ॥ અલહ
જાહ લીલ્લા હે॥ રબલા આલમી નકી॥ વલે અ
કબલા॥ વલે ક સલની ણા॥ કસલ કીણા વે
હા સલવાતા॥ વેહા સલામો॥ અલા રફુલહ
જહજહીણ॥ વલે અલ્લા હે॥ વેહી અજનહ
અલા ખેરખા લકી॥ વેહેફર અફ સોહી॥ ન
બાણાજ॥ જહજ્દીણ॥ હજરત રસુલલ॥
પણાહી॥ સલ લા આલે વ સલમ॥ કરત હજ
દ ફસ્લ ફાજી॥ પેદા કીધુ છે॥ તારે પપરહ
દોસ્ત સરીફમાહે કીધો છે॥ અણે પાકે પરવ
રદીગાર નોરા છે॥ વજુદ આદમનો હ
વા॥ સલ લા આ લે વ સલમ॥ પરવેજ
ખુદાતા લાએ બે ત્રિમીજ પેદા કીધી છે॥
લેપણ ઉર અમારે છે॥ કેહે અજ્હદન
મેહેનજ બાપ આલ॥ સલવા તો લા આલે
વસલ મ આ વા છે॥ તારે બીબી ફાતમા હી॥

२ ॥१०४॥

જહુરોજ । અલાહો તઆલા ॥ અજહુ ॥ તે ધમેલ
હાજર હોતા । તાહાબીબીફાતમા અ રે કે હુ છે જે
અલાન આલે રનરે । આ હો શોશાનબરાઇ અમેલ
તારેમે હેગનબરાઇ અમેલ બોલા નહી ॥ તારે બીબી
ફાતમા અ રે હુ છે જે । આ હો શોશાનબરાઇ અમેલ । લ
મે અલાન નોજવાબ રેન પાછો વાલોનહી । તારે મે
હેગનબરાઇ અમેલ બોલા છે । રે આ હો બીબીફા
તમા હા । બાઇ અનન શોશો રેન રે આ છે । બાઇ
અનારી હિનરતો ઘણી રેમોટી છે । તારે બાબી
ફાતમા હા । જહુરા રજ । અલા હો તઆલા ।
અંનહુ ॥ અલંલા હા । આલે ધ અલંનન હુ છ
છે । આ હો નબી રસુલંલાહ । તને મોટા છો ।
રેને હેગનબરાઇ અમેલ મોટા છે । તારે જરે
હનદરસ અતફા અરે હુ છે જ ॥ આ હો બીબીફા
તમા હા ॥ મોટા તો નબી રસુલીલાહ છે ॥

તારે બીબી ફાતમાએ કહ્યું છે જે. આહો મેહેરજ
બરાઈઅલ. મોરા તો બાબા જાન હદર રસુલીલાહ
છે. તારે જે હે જબરાઈઅલ. સલવાતોલા. આ
લેઇસલામ ને કહ્યું છે જે. આહો બાબા રસુલીલાહ
તમે મોરા છો. અને મોરા કેવાઓ છો. પણ ઉમ
રતો અમારી ઘણી મોટી છે. તારે હજરત રસુલ
લ પનાહી. સલંલાહો આલેવસલંમે કહ્યું છે જે
આહો મે હે જબરાઈઅલ. તમારી ઉમર કેટ
લી મોટી છે. અને તમારી ઉમર માહે તમે ક
હ્યાંજ છે. તારે જે હે જબરાઈલ. સલવાતો
લાઆલેઇસલામ ને કહ્યું છે. આહો હજરત ર
સુલંલાહ. પરપન ખુદાતાલાએ એક તારો
પેદા કીધો હતો. તે તારાનું નામ કુતુબતારો
હતો. તેને ધરૂતારો કહે છે. તે તારો બારેઉ
ગતો હતો. તારે સીત હજાર વરસ લગી

उगम रणोरहेतो हतो॥ ते वारे जरे आपे नतो
हतो॥ तारे श्री नहजार वरस लगी॥ आपे नणो
रहेतो हतो॥ ते कुछ बतारो अमारी उमर
माहे॥ उगमतो ने आपे मलो दीठो हतो॥ अ
पाअेक लाख ने चालीस हजार वरस लगी
अमारी उमर माहे उगमतो ने आपे मलो
दीठो हतो॥ तारे जरनहनद मुस्तफा अेकेनु
छे॥ के आ हामे हजरत बराईअल॥ ते वारे अ
मारा नुर माहे थी॥ खुदा ताला अे पेदा कीधो
छे॥ तीस लाख थी आगल पचास लाख नो॥
अउद हजार वरस थी मोहोरे॥ खुदा ता
लाअे पोताना नाम के नुर पकी॥ हमारे
नुर पेदा कीधु छे॥ आ हामे हजरत बराईअ
ल॥ लमे सुणो तो ते वात छु॥ तमारी पासे ब
आंन करीअे॥ खुदा ताला अे पोताना॥

જુરની તારીફ કીધી છે॥ તે તમે બંદે રાખ
જો॥ તારે મેહેરબાન જબરાઇલ એ કે સંતર
આ છે॥ તારે હજરત મહંમદ મુસ્તફાએ કેનુ છે
આ કોણ છે જબરાઇલ॥ અલલાલાલા·
આલે હોવસલંમ॥ તેને કે લખેલા રોઝા
ઠોકતા॥ તેને કે વાણીઆંણ હતા॥ તારે મેહેરબા
ન જબરાઇલ બોલા છે॥ કે તે તારાને પાંમની
આંણ હતા॥ તારે હજરત મહંમદ મુસ્તફાએ પુ
છુ છે॥ પાંમની આંણ તે કીઆ કીઆ છે॥ તારે
મેહેરબાન જબરાઇલ બોલા છે॥ તે તારાને કો
ણમા કેબે ફીરતા॥ ગાડામા કે કેસ હતો॥
માથા ઉપર તારો હતો॥ હાથમા કે અંગોઠી
હતો॥ એવા એવા પાંમની આંણ હતા॥ તારે
હજરત મહંમદ મુસતફાએ કેનુ છે જે॥
આ કોણ છે જબરાઇલ॥ અલવાતો

॥૧૨૬॥

ના. હો આલે વસલંજ।। તેનારા નેકોનમાંહે

બેહેસતના।। તે નસલનુ એન હતા।।ગાહામાંહે

હસનલોતે।। બીબી ફાતમાહા હતા।। સા પાઉપર

તોસો હતો તેરેઝુલંબા જુજુર હતું।। હાથમા

હેઅંગોઠી હતી।। તે હજરત અલી હતા।। તે પામે

તનપાક છે।। તે અમારા જુર બરાબર છે।। એવી

તારીફ સાંભળીને।। મેં હજબ રાઈ અલબા

ના છે।। કે આલે રેજ અલાહેન।। બીબી ફા

તમાહા।। એવા અલાહ વાહા છે।। અને આતર

અલાનેગાહાની છે।। વસી ખુદાતાલા એ

જેકાંઈ આજ પેદા કીધી છે।। તે જુર અરશે એ

માંહે છે।। તાહા જુર મહમદનુ સતફા એ સજ

હોકીધો છે।। તારપછે વલીખુદાતાલાના।।

ઘરનું।। ફરમાંન આવુ છે।। એ જુર હમારા।।

એ દોસદાર।। હમારા।। એ હજરત હબીબ

હમારા।।

અન હન દ॥ માહાસ્કર લખ માહારા॥ સતગો
રજનાજતને॥ પોતાન્ડું નાપ્ખુ ઉપાડો॥ અનંત
મારી મોહોબતમાંહે થી॥ દસ દરીઆવ પેદા કી
ધા છે॥ તે માંહે થી॥ પહેલો દરીઆવતો॥ મેલન
નો પેદા કીધો છે॥ બીજો દરીઆવતો હલમીનો
પેદા કીધો છે॥ ત્રીજો દરીઆવતો હેઆલનો પેદા
કીધો છે॥ ચોથો દરીઆવતો હેમતનો પેદા કી
ધો છે॥ પાંચમો દરીઆવતો અકલનો પેદા કીધો
છે॥ છઠો દરીઆવતો ફકરનો પેદા કીધો છે॥
સાતમો દરીઆવતો સબુરીનો પેદા કીધો છે॥
આઠમો દરીઆવતો અસકનો પેદા કીધો છ
નવમો દરીઆવતો ખુબનો પેદા કીધો છે॥ દસ
મો દરીઆવતો ઉનત રહેમતનો પેદા કીધો છે
એવા દસ દરીઆવ માંહે॥ મોટા મોટા મુકાન
ઉપરના દસ દસ હજાર વરસ લગી॥ અમના
રાજુરને રાખ્યા છે॥ એવા દસ હજાર વરસ સુધી॥

ગ આછે ॥ તો હાલ ગીનુ રતાં અનદામાં રઆછે
તે દઅહઅરવર અપછી ॥ ખુદાતાલાના ઘરનુ
ફરમાંન આવ્યું છે ॥ એ દાસ દાર હમારા ॥ એ
હજરત હબીબ હમારા ॥ એમ હમદમાં હારસુલ
ખ હમારા ॥ એ રસુલ મેહબુબ માહારા ॥ એ સત
ગોર જતતે પાહેર આવા ॥ તારે નુર મહંમદનુ
સત ફાના ॥ બાહેર આવા છે ॥ અને તે નુરાણી
પરકાસ કીધો છે ॥ તારે પછે ખુદાતાલા
નું ફરમાંન આવ્યું છે ॥ એ નુર હમારા ॥ એ દાસ
દાર હમારા ॥ એ હજરત હબીબ માહારા ॥ એમહં
મદ માહા રસુલ બ માહારા ॥ એ રસુલ મેહબુબ
માહારા ॥ એ નુર જતતે માહારા ॥ સતગોર
બ્રમા જત તે ઉઠીને પોતાનુ દીલ ધંધો ના ॥ તા
રે હજરત સેગાબર ॥ અલંલા આલેય સલમે
ઉઠીને ॥ પોતાનુ દીલ છંછોડ્યું છે ॥ તારે મહંમદ

જુગત ફાના તેના જુઆર કના ડેપો ॥ અનંત
અનંત જુગ રના કરા પડા છે ॥ તે માટે પીર અનંત
અનંત રૂપાની ॥ જ્યાંજ તજ ણાસ પેદા પીધ છે ॥
આ ટાંતે કે તેજ બરાઈ અલ ॥ અલ પા લો લા ટો
આ લેવ અલંત ॥ તારપ છે વડાકે ના એક લાખ
~~જે એક્સો ટ ઝાર ॥ પીર પેગામ્બર પેદા કીધા છે~~ ટ
મારા જ રના પર જુઆરક ના ટેપો પડા છે ॥ તે
માટે પો એક લાખ ને એકસો ઠ જાર પીર પેગામ્બર
પેદા કીધા છે ॥ પછે વળી કરા આઠ ઠજાર ઝગ સે તે
તેરા ॥ અમારા જ રના જુગ જુઆર કે માટે પીપડા
છે ॥ તે માટે પીઆ ઠ ઠજાર ઝગ સેને તેર અમુ રસઈ
પેદા કીધા છે ॥ પછે વળી કચા કે તા એક લાખ અમા
રા જુગ રના કરા એ મુઆર કે માટે પો પડા છે ॥ તે
માટે પો કેતા એક લાખ જરાફ રસ્તા પેદા કીધા છે
પછે વળી કરા સી ઝઠ જાર અમારા જુગ રના સીરાજ ॥

॥૧૭૮॥

બારકમાંહેથીપડાછે॥તેમાંહેથીએનેક્રેઆએવા
નુંએનીપેદાકીધાછે॥પછેવળીકરાજેકેઅમારા
જુરના॥પેસાનીમુબારકમાંહેથીપડાછે॥તેમાંહે
થીતોમોટારણજુવલપેદાકીધાછે॥પછેવળીકરા
બેઉઅમારાજુરના॥જમણીઆંખમુબારકમાંહે
થીપડાછે॥તેમાંહેથીપેહેલેકરેકોતા॥મેહેરબાન
રાઈઅલપેદાકીધાછે॥બીજેકરેકોતોમેહેર
મેહેકાઈઅલપેદાકીધાછે॥પછેવળીકરાબેઉ
અમારાજુરના॥ડાબીઆંખમુબારકમાંહેથીપ
ડાછે॥તેમાંહેથીપેહેલેકરેકોતા॥મેહેરઅસરાફી
લપેદાકીધાછે॥અનેબીજેકરેકોતોમેહેરઅજ
રાઈઅલપેહેદાકીધાછે॥પછેવળીકરાબેઉ
અમારાજુરના॥જમણાનાકમુબારકમાંહેથી
પડાછે॥તેમાંહેથીપેહેલેકરેકોતા॥મેહેરમેકાઈ
અલપેદાકીધાછે॥બીજેકરેકોતોમેહેરના॥

ગુરવાઇ અલપેદા કીધા છે॥ પછે વલી કેતા બેદ્રિ
અમારા ગુરના॥ ડાબા ને ગુબ્યારસ માંડેથી
પડા છે॥ તેમાંડેથી પેહેલે કેતા તો અદરાઇ
અલપેદા કીધા છે॥ બીજે કેતા તો ને અલ
જલપેદા કીધા છે॥ પછે વલી કેતા બેદ્રિ અમારા
ગુરના ... ડાબા ગુબ્યારસ માંડેથી પડા છે॥
તેમાંડેથી પેહેલે કેતા તો ... પેદા કીધા છે॥ બી
જે કેતા તો ... પેદા કીધા છે॥ પછે વલી કેતા
બેદ્રિ અમારા ગુરના ડાબા ... ગુબ્યારસ માંડે
થી પડા છે॥ તેમાંડેથી પેહેલે કેતા તો અરક પેદા
॥ કીધા છે અને બીજે કેતા તો ... પેદા કી
ધા છે પછે વલી કેતા આઠ અમારા ગુરના ...
ના ગુબ્યારસ માંડેથી પડા છે તેમાંડેથી આઠ
... પેદા કીધા છે પછે વલી કેતા આઠ અમારા
ગુરના ડાબા ... ગુબ્યારસ માંડેથી પડા છે તેમાં

॥१०५॥

ठेथी आतउआणा आतहोजप पेदा कीधा छे॥ आठे
माउआणा सेतां ... अली अप पेदा कीधा छे॥ तेहो
जमणे दरवाजे बेठो छे॥ पछे पछी केवा आतम
मारा नुरना॥ जोगाग कामुआरउमा ठे थोप
डा छे॥ तेमा ठेथी आत जनीन नालआप
पेदा कीधा छे॥ पछे पछी उआ आतअ मारानु
रना डाबा गामुआरउमा ठेथोपडा छे॥ तेमा
ठेथी आत आस मा ननालआप॥ पेदा की
धा छे॥ पछे पछी केवा केताअेक लाख आमा
रानुरना दातमुआरउमा ठेथीपडा छे॥ ते
मा ठेथी केताअेक लाख तारा पेदा कीधा छे
पछे॥ पछी केवा आर अमारा नुरना जोगा
मुआरउमा ठेथीपडा छे॥ तेमा ठेथी आर
पे॥ आर उलेप पेदा कीधा छे॥ पछे पछी के
वा॥ आड आठ अमारा नुरना॥ जोगा ...

બારક માંહેથી પડા છે ।। તે માંહેથી અડસઠ
તીરથ પેદા કીધા છે ।। પછે વલી કેતો એ કે અમા
રા ગુરનો ।। ઝમણા ખભા મુબારક માંહેથી પડા
છે ।। તે માંહેથી ધારઠે ગો પેદા કીધા છે ।। પછે વ
લી કેતો એ કે અમારા ગુરનો ।। ડાબા ખભા મુ
બારક માંહેથી પડા છે ।। તે માંહેથી દીવસ પેદા
કીધા છે ।। પછે વલી કેતો એ કે અમારા ગુરનો ।।
ઝમણી બાજુ મુબારક માંહેથી પડા છે ।। તે માં
હેથી મંદર માં પેદા કીધા છે ।। પછે વલી કેતો
એ કે અમારા ગુરનો ।। ડાબી બાજુ મુબારક
માંહેથી પડા છે ।। તે માંહેથી સુરજ પેદા કીધા
છે ।। પછે વલી કેતો એ કે અમારા ગુરના જ
મણા હાથ મુબારક માંહેથી પડા છે ।। તે માંહે
થી પેલે કેરે કોતા ।। ઝુરી વાએ વાદલ ।। સર
ઝુર પેદા કીધા છે ।। બીજે કેરે કોતા વાએ તો
ફાન ।। અર અર પેદા કીધા છે ।। ત્રીજે કેરે

૧૨૨૦૧૧

૩ાતા ગોજ્રણા રજા દેલ પેદા કીધા છે ॥ આ પેકે
ને૩ાતા ॥ પીજ્હી અમકાર પેદા કીધા છે ॥ પા
અમેકને૩ાતો રપેલમપદસ અસરાફેલ
ની ॥ ધમણ ॥ તેની તોસઠ મરમોજ નસ્રધી ॥ એ
પાસ્રછલાં બીપેદા કીધી છે ॥ છકે કને૩ાતો શ્રી
લપંતકુરા પેદા કીધા છે ॥ આલમે કને૩ાતો અ
મરાપરીમાઠે ઉરાણી કુપર પેદા કીધા છે
આઠમે કને૩ાતો અજરતાલજુનતે ॥
આડ પેદા કીધા છે ॥ નવમે કને૩ાતો આડ
તાફાન પેદા કીધા છે ॥ દસમે કને૩ાતો અ
જરજારવણસપતી ॥ જેવા દારજાલતા
લના પેદા કીધા છે ॥ પછે વસી કેવા દસએ
મારાઉરના ડાપા ઠાપમુજારકેમાઠે પીપ
ડા છે ॥ તેમાઠે પીપઠેલ કને૩ાતા ॥ સરાપત
નાકુરા પેદા કીધા છે ॥ પીજે કને૩ાતો ॥ સે

લાંબ દરીઆવ પેદા કીધા છે ॥ ત્રીજે કરોડે તો
દુધનો દરીઆવ પેદા કીધો છે ॥ ચોથે કરોડે
તો ઠામ કોસર પેદા કીધા છે ॥ પાંચમે કરોડે
તો દુનીઆ નાઠજે ટલુ દુધ ॥ તે સરવ પેદા
કીધું છે ॥ છઠે કરોડે તો ફુલ ॥ ભાતભાતના
પેદા કીધા છે ॥ સાતમે કરોડે તો એકલાખન
માણીસ ઠજા રતન દીઠ પેદા કીધો છે ॥ આઠ
મે કરોડે તો લીલા નાળુ ગડા ભાતભાતના
પેદા કીધા છે ॥ નવમે કરોડે તો પશુ પખી ભા
તભાતનો પેદા કીધો છે ॥ દસમે કરોડે તો
દુનીઆ નાળુ ગડા ભાતભાતના પેદા કીધા
છે ॥ પછે પછી કેટાદસ અમારા જુરના ॥ બે
ઉઠાવનાદસે આગણી દિઠબારકે માઠધી
પડા છે ॥ તે ના ઠ ધોપે ઠલે કરોડે તો કે મન
પેદા કીધા છે ॥ બીજે કરોડે તો તરકાનપે
દા કીધા છે ॥ ત્રીજે કરોડે તો જુ રદ અંગોની ॥

ખતંન અલે નાંન પેગાબર સલંલાઠો આલે
વસલંમ નો પેદા કીધી છે॥ આ પેહેલે નુરે હતા જી કે
મે રાજમા પેગાબરે આ સાપે દા કીધા છે॥ તે આદ
ન ઘડીઆ ઠબને પોત્યા છે॥ તે બખત આ ઠબ પેહેલી
મે ઠેરાજ આ ને પોતા છે॥ પાંચમે તે કે નુર હતા તે બ્રા
હુરમા નો ઇમામ ઇમ લ પેગાબર કે વાસ્તે॥
ખુદાતાલાએ લીલા ઘડી મોકલો હલો॥ તે પેદા
કીધા છે॥ છઠે કે જે નુર હતા ઉઠડી અલ ના ને પેગા
બર સલલાઠો આલે વસલમ નો પેદા કીધા છે॥
આલમ તે કે જે નુર હતા ઘોડાની જાત પેદા કીધી છે॥
આઠમે કે જે નુર હતા ઉંટ ની જાત પેદા કીધી છે
નવમે કે જે નુર હતા કુતરની જાત પેદા કીધી છે
દસમે કે જે નુર હતા મોરા પંખીની જાત॥ જેવજ ના
વલે નાના જાનવર પખી અરવ પેદા કીધા છે॥
ઘણ પઠ્ઠો કે આદ એ અમારા ઉર ના॥ એ ને ના

जुग्यारे माहे थीपडा छे॥ ते माहे थीपे ठलेरे
क्रोडता॥ आमर लोक पेदा कीधा छे॥ बीजे
क्रोडता कुंजार लोक पेदा कीधा छे॥ त्रीजे
क्रोडता जुरतकीण लोक पेदा कीधा छे॥ चो
थे क्रोडता फडर लोक पेदा कीधा छे॥ पांचमे
क्रोडता आलम लोक पेदा कीधा छे॥ छठे क्रो
ता काग लोक पेदा कीधा छे॥ सातमे क्रो
ताेने बखत लोक पेदा कीधा छे॥ आठमे क्रो
डता ठाळ लोक पेदा कीधा छे॥ नवमे क्रो
ता आलो आ लोक पेदा कीधा छे॥ दसमे क्र
डता जुगल लोक पेदा कीधा छे॥ पछे पांडे
ना दस सहस्र मासानुरना पछुद जुग्यारे
माहे थीपडा छे॥ ते माहे थीपेठ लेरे क्रोडता
नेरनाननाे लोक पेदा कीधा छे॥ बीजे क्रो
ता मधुर लोक पेदा कीधा छे॥ त्रीजे क्रोडता

अलेमांन लोरे पेदा कीधा छे॥ आप रे ते रोतो
आयालो रे पेदा कीधा छे॥ पासने रेते रोतो
आठ्य नीरनना राज लोरे पेदा कीधा छे॥ ख
ठ रते रोलो रुप अलो रे पेदा कीधा छे॥ आन
मे रेते रोतो ठाफनलो रे पेदा कीधा छे॥ आठने
रते रोलो जुरमद लो रे पेदा कीधा छे॥ नवने
रते रोतो जरलो रे पेदा कीधा छे॥ दसने
रते रोतो जुरोपुराय॥ नवी आठ्य मले ला
ठा आलेप अलगना पेदा कीधा छे॥ पछी
वली रनादस अमनाराजुरना॥ पेठे ठाठ
मुछाररनाठ धीरदा छे॥ तेनाठ धापे ठले रे
नेरातो रुपड पेदा कीधा छे॥ बीजे रेते रोतो
मुअर पेदा कीधा छे॥ त्रीजे रेते रोतो अपर
नअतनी पेदा कीधी छे॥ आपे रतेरोतो अप
रस नी आनी पेदा कीधी छे॥ पासने रेते रोतो

કુફુર પેદા કીધા છે॥ છઠે કરે રોતા તો ફરાન
પેદા કીધા છે॥ સાતમે કરે રોતા તો મુરજાન
પેદા કીધા છે॥ આઠમે કરે રોતા તો જવેર પેદા
કીધા છે॥ નવમે કરે રોતા તો લાલ પેદા કીધા છે
દસમે કરે રોતા તો પાણાનો નીલમ પેદા કીધા છે
॥✿॥ એ રસી ઉતપત અરસ ની આદે
મણાતનજ બારે કમાટે પી ખુદાતાલા
એ અરસ પેદા કીધી છે. આ ઠામે નજર ભરા
ઇલમ॥ સલવાતો લા॥ આલેવ અસલમ॥ ખુદા
તાલાના વડી॥ તાર પછે વલી ખુદાતાલાના
ઘરનું ફરમાન આવ્યું છે॥ તે માટે કલમનો
હક જપઆ છે॥ અને વલી કહું છે જે આ ઠો
કલમ તને પોતાના દલમાન પોલખો॥ તારે
કલમે કહું છે જે આ ઠા પાક પરવરદીગારે
અને કે આર લખી એ॥ તારે ખુદાતાલાએ ફર

આવું છે જે આ ઠાકર લન તને લખ્યો॥ અને વ
ક્ષી કરી છે જે॥ ઠકર લા અલાહ॥ ઈલીલાહો
તારે ઠાકર લનનો લાહો ઉપર રાખી છે॥ સીન
ઠાનર વર સલગી માલી છે॥ અને તારા ઠાકર હું છે
જે॥ ઠકર લા અલાહ ઈલીલાહો॥ અજેન લખતા
લખતા સીન ઠાનર વર સલગી આવ્યો છે
તારવ છે પશી ખુદાતાલાનું ફરમાન આવું
છે. જે આ ઠાકર લનતને લખ્યો॥ અને વક્ષાક
રી જે જ ઠકર લા અલાહ॥ તેજ ઠકર લા
લાહનું નામ નરે॥ ઠાકર લને આલહું છે॥ તેના
નની ઠાકર લહું॥ ઠાકરન વસલાઠેથી પારી
ગ આ છે॥ અને ઠાકર લનતો અલાહી અગ્દામાં
રઆ છે॥ તાં એક ઠાનર વર સલગી માલુમ
હું છે॥ અને ઠાકર લને અગ્દાજી ઘા છે॥ તારે પશી
ખુદાતાલાનું ફરમાન આવું છે॥ આ ઠાકર લન

તને અરઉભા ડો॥ તારે રેલને પોતાના નીવુદી
પાડીને બાવો રે તાલાને રે હુ છેને આ ડોપા
રુપરવરદીગાર અે નાન રેને છે આપ્રા
નાતબ રાબ રલ ખાવો છે॥ તારે પુદાતા
અે ફરમાવું છે॥ રે આકારે લન॥ અે નાનતો
નરનદર॥ ર ગ્રુલતાનું છે અેનાન ને આ
પરણે પેદા નારેરના॥ તો આલપાતાલને આ
લ આસમાન॥ ત્યાં અરસ કુ રસાને લોકાકેલ
ના પેદાન રેરના॥ ને અેનાન નરનદનુ પેદા
ન રેરતા॥ તો રે સીઅેનગ્ણ સપેદા ર રેરતા॥
અને પોતાની ખુદાઈ પ્રગટાવ અરન રેરતા॥ તે
માટે રેલન તને લખ્યા॥ અને વળી રેઠાણે નેને
નદર રસુ લીલાહે॥ તારે રેલન તોલો ડોઉપર
રપાવાપે આછે॥ અને ઓનરના રવરસા
લગી॥ લખ્યું છે॥ તાડારે હુ છેને॥ નરનદર
રસુલીલાહે॥ અેનલખતા લખતા॥ ઓ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

નાતનીદાસલીએકરાતે કલાતનોજ
આપવાનોતોવાર છે॥ તારેતવીતરોનઈ
તેરુરેજવાપ દીધો છે॥ એતેતારાવસાર
ફુછે જો॥ આલેરત સલાતનોરલત॥ પુદાતા
લાએતતોગોરાજ દીધો છે॥ એતેવસીરેફુછે
જો॥ પાતેરરોજતએલાતે॥ પેરેખરરેતફુ॥
એવાસાતે સલાતનો જુવાપદેવો સનો॥
એતેવસીસુનતપઈ છે॥ આલેરત સલાત
પાતેરરોજતને એલાતે॥ પેરેખરરેતફુ॥ એ
તેમોરાજલોરલનાનીછે॥ તારેવસીરેલતે
રફુછે જો॥ આરાપારેપરવરદીગાર॥ તે સા
લપાતાલ॥ તેસાલઆસમાંન॥ ત્યાએરે
કુરસીતેલોરારેલત॥ લેતાએમારાપેરેમા
રે છે॥ તાતેએતતેએવડીગોરાજપાપેદારી
ધા છે॥ તારેએતેએરેલાખતેઆસીક રતાર
પરકલગી॥ તેરેલનાલખાવા છે॥ તેરેલતે

[illegible]

અણેવશો અજારા ફળ લડરણ પેડો - ડેલનો
લઇ અેમનો અજારો ઘણો રોપડસે - અણેવ
શોડઠ સેજ અવલડલને લઇ અેમ - હોઅેન
ડલને સાઠાદત - અસાદિ ડોઅણ - ઠડલા અેલા
ઠા - ઘલીલાઠો - નઠ નદર - રસુલીલાઠે - વા
અેદ ઠુ અલા - સરીડુલઠુ - અેઠ દવળ - નઠેન
દીન - અબદ ઠુ - પેઠ રસુલઠુ - અેવાડલનો
નેડોઇપડસે - તેડલનાનો આવાળ લીસતરુ
ધીપોમસે - લારેલેડલનાની ડુ સોપડી - અા
ઠેલીસલણાદ રવાજ ઉઘડસે - તાઠાડુઠ સેજ
અેવા ડલનો ડેનારાનીલો - લીસ્તમાઠેરાડીબાં
ધીછે - અેડલનો ખુડુનારાજવતાલીસ
મા ઠેઆપેસઠી - અેવીફરસ્તા દોવાના
નો છે - અાઠાના ઇજબરાઇઅલ - સલવા
લોલા - અાલેવસલજ ખુદાતાલાનાપઠો -
તારપ છેવસ્તીખુદાતાલાનુ ફરમાન અાવુંછે

એનુરતન મારા॥ એ દો મેહાર ન મારા॥ એન જરત
નવીય માનારા॥ એમન નદ મા નાકુરે તખમા
નારા॥ એરકુ તને નેજુય માનારા॥ એનુરતન
તરે માનારા॥ સતગોર મામાજ તને જુગેરુન
મોતને એ તમતો નરીતરે તાયપડાવો॥ તા
રેનજરતપેગાયરે॥ સતંતાં આલેવ સતને॥
તારેઈતમતો નરીત કીતાયફ રસ્તા અજરાઈ
અલને પડાવો છે. જેધ કીધ રતી આસમાં નર આ
છે. અને અંદર માના સુરજ આલ છે॥ આજવાળે
નની ઉતપતથા એ છે॥ તેને આજનાજુકેન છે.
એખરકત અરવે આજ નામા નીછે. તારે વલી
મનનદજુસ્તફા એ કહુ છે જે॥ જે કે આ સારે એ
મારા જુરના॥ કુદાનુ આજુબારકે માન પો॥
પડાછો॥ તેમાનપો આર ચીજ પેદા કીધો છે॥
તેમાનપોપેન તકે નેકાતા વા એ પેદા કીધા છે॥

બીજે કરોડે તો પાણી પેદા કીધા છે॥ ત્રીજે કરો
ડે તો અગન પેદા કીધા છે॥ ચોથે કરોડે
તો બાબ પેદા કીધા છે એવા ચાર પદારથ
પરપચી નાને પેદા કીધા છે॥ આ હોના છેને
ને ત્રણબરા ઇઅલ॥ અલપાતો ના આલેપક
ના॥ ખુદાના નાબપતી॥ તારખ છે પણી ખુદા
નાના નાધરનું ફરમાન આવું છે॥ એનુ રના
હાશ એ દીન દારના હારા॥ એ હજ રત હબી
બના હારા॥ એન હનદના હા રસુલ બના
હારા॥ એ રસુલ તેને બુબ ના હારા॥ એ નુર
નલ લકના હારા॥ એ અલગોર નના ના બ॥
તના રીતો હાબતના નો પો॥ અને ચાર ચીજ
પેદા કીધી છે॥ તેના નો પાત નકે ઇ ચીજ ઉપ
ર અગલી આર ધરો છે॥ તારપછે તને અર
પેગાબરના અલદારકરછું॥ તના રાનુરતે

॥૧૧૯॥

તમારા નાનને ઝાઠે રરુરી કે॥ એન પ્રુહાલા

લાના ઘરનું ફરમાન આવ્યું છે॥ તેમાંઠે મારે

ગુણ નાળ પાપ લખા છે॥ આ [illegible]

[illegible]

પ્રુહાલાલાના પતી॥ નુરન ઠનદરુ મેલફા

નાનુ રીનુ રાખ ઉપ રઅ મે પારપ આ છે॥

તેમ અપારપણે પાએનુ સાપાકે ગઆછે

તાઠાળ પણે મઠનદ ને નુરે કે હું છે ને સ

ભાન આલે કે મરે પાએ॥ તારે પાએ કે હું છે ને

પાઆલે કન કલાન॥ અને નુ કોરા છે. તારે

મઠનદ નેનુરે કે હું છે ને॥ જે નો તું પાં હોછે

તેના અને નુર છઈ એ॥ પણલું કેનો પાંહો

છે રે પાએ॥ તારે પાએ કે હું છે ને॥ એ કે પાંહો

પ્રુહાલાલાનો લક છે॥ તેન એ કે પાંહા પ્રુહાલા

લાનો હું પણ છઉ॥ તારે મઠનદ નેનુરે ને

છે ને॥

વાચાતોપોતાનારનાઠણએ છે અને મોરા
ઇસ્લાતરૂજરાઇકરે છે. તારે પશીનનાઇને
જુરે કહું છે જે. દણીઆનાઠાજઇને કે કુરાન
કરે ન વાચે. તારે વાચે કહું છે જે. રોઇમા
રાજનનાં આપશે. હું તેરાન કરે ન જે જુરમ
ઠાદના. તારે ન ઠાદ ને જુરે કહું છે જે. નાઇ
એ બંદાને પોતાના નનાં જુરાન. રજારે
સરે વાચે. તું તો બાપકરે વાચે. રજમાન ઠેએ
બઘણી છે. અને બંદાપીરૂ પાચે સાઠબ
નાઠરૂનપીના. જે રોઇ સાઠ બને ગાને તરે
બંદાજુરૂપુગજુ છે રે વાચે. તારે વાચે કહું છે
જે. રૂજનાઠે કે વાચે બ છે જે જુરનાઠ નદ
ના. તારે ન ઠાદ ને જુરે કહું છે જે. વાચે રૂ
છપો આવે. અને છપો ના એ. રૂ તો સંનુ ની
એ બજુવે છે. અને તારી એ બ કોઇ જેરૂ નથી

॥९९८॥

[illegible]

realpatidar.com

पाञेद हुअला· अवीकुलहु· कोठेदव
न· महमदहीन· अबद हु· पने रसुलहु·
अपाक लमो पढीने मुमन दीनदार थञा
छे· तारे पाञे पोताना पीर गुरसद· गोर
कबुल कीधा छे· ताहा पोतेन पीजीओनत पर्व
नी रआ छे· पेला पाञे गुणनो पाल कीधु
रण· ॥ लखी तंग गुणपाने वपाण
गुण· आहो मेतन पराछञल· सल
पालो लांआलेप सलंन· तारे वणीहउ
मअलाहीनुरम हजद उसलफाना·
उवीणुरावडप रञ अपार थञा
छे· लेअअ पारथछ ने पाणी गुणजा
सेगञा छे· ताहा लछ ने महजद
नेउरेकहु छे ने [illegible]

तारे पाणी अेरे कुछे जे आ लेरे नके
ला न प ण लं डो ण छे ।। तारे नठ नद
नेजुरे रे कु छे जे ।। रे जे नो लु पंहा छे ।। तेना
अने नुर छ ई अे ।। पणा लु डो नो पंहा छे
रे पाणी ।। तारे पाणी अेरे कुछे जे अेरे
पंदा पुदाला लानो लु छे ।। अे न अेरे
पं दा पुदाला लानो कुपण छद्वि ।। ता
रे नठ नद नेजुरे रे कु छे जे ।। पाणी तो
पोताना नेरमा ठेना अे छे ।। अने मा
राछ आलरे पु राछ रे रे छे ।। तारे
पणी पाणी ने नठ नद नेजुरे रे कु छे ने
दनी आना ठेनघने लु रे पु डो न रे री
मरे पाणी ।। तारे पाणी अेरे कुछे जे ।।
डाछ्ना राजना आयमोते कुडो न रे री

जोतस्वरुपनाहनो॥ तारे जोतस्वरुप
रेहेतुं छे॥ नो जे आ पंड नो पोतानो
नलनो कांरीना आतरे आप॥ पंडनो रेतु
गयुं छे रे पाणी॥ तारे पवन पाणी ए सेहतु
छे॥ जल माहे रे पण ए पछे जोतस्वरुप
नाहनो॥ तारे नरनाहनसुत फाअे रे
तुं छे आ हो पाणी ने पाक छे॥ पवन
आवी पवन ने जोते जल माहे धीवा ने
छे॥ जल ने बाधी राखे छे तारे जगां ध
आ ने छे॥ तेजे तसा वि जल पवन बांधाय छे
जल माहे जल पडे छे॥ जे रला पंड आतम
नाबुद तेला आने पेदा थाय छे॥ ते रेला जल
माहे नाने छे॥ नापाकी थोय ने पोते पाक था
आ छे॥ पछे जल ने सुरज पाक करे छे॥

त्यांपवनपाक करेछे॥ सूरजनी
गरमीथकी लूणमांहे फेरण पामेछे
बछेवा अफेणने कोडीनाथ स॥
तारे खुदाताला नी हीकमत मांहे थाअे
छे॥ तारे पाणीलूण पाक थाअेछे॥ पाणी
लूणमांहे अेपीअेम छे॥ तारे पाणीअे
कडु छे ने॥ तेने पण गणे छे जे अमने
नगारको छो॥ जे नुरमहंमदना॥ ता
रे महंमदने कडुरेकु छे॥ अ सावर
तो व्या असला॥ अने तो वंदा साहे वण
गने गाऊरछ श्री॥ लूणमांहे तो अेवध
णी छे॥ ताइपर गणे तो अेक खुदाता
ला छे॥ तारे मंहमदना नूर उपर पा
णी अेछ जातना [illegible]

तारेनहनाहनोकरेरेकहुंछेनो॥केलनो
तधअेभअनोलपडरेपाणी॥तारेपाणी
अेकलनोकेआछेनो॥अवलकेलनेत
धअेभ॥होभेनकेलनोआहादत॥अने
दहोअनो॥नकेलाअेलाहा॥धलीलाहा
महनहर॥रस्कलीलाहे॥वाअेदहुंअ
ला॥सरीकुलहुं॥अेनेदवनो॥नहनह
दीनो॥अअदहुं॥पेहेरस्कलहुं॥अेवा
केलनोपडीनोकननदोनदारधआ
छे॥अनोनहनदनोदोननाहेआपा
छे॥तारेपाणीअेपोतानापीरजरस
दगोरकेजुलकीधाछे॥ताहापोतेन
पानोइनतधवनरआछे॥॥ ॥

॥१२३॥

गनुरा जीनो- अपुरा छे॥

गुणनीनो अगनगुण लखो छे॥

आगोनेने नमपरा छे॥ भलवातोला

आलेपकालंमा॥ तारे पणीनेने अला

नी॰ जुगनगनदजु सतफानाजुरीपुराप

उपरअ अथार प आ छो॥ ले असवारी

छनो अगनजुणपासे गआ छे॥ तान

नछनो नगनद नजुरे तु छे॥ असलान

आलेउनरे अगन॥ तारे पणो अगनेरे

तु छे॥ आलेउन असलान अने लउरोल

छे॥ तारेनानगनद नजुरे तु छे॥ जेनो लु

पंदा छे॥ ते नाअ मेनु रछछ आ॥ पणालु

रेनो पंदा छे रे अगन तारे अगनेरेतु

छे न॥

[illegible]

॥११४॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

गुरन नरदगुके तफाना॥गुरायुरा
खडिपरत्नअकवारधन्ना छो॥लेअकवार
थछणेआपगुणपासेगन्नाछो॥ताठाण
छणेनरदणे गुरेकु छो॥असलाम आले
कररेआप॥तारे आपे कु छे जे॥आलके
न असलाम॥पासेरठनत॥असलाठे पठेप
रकतकु॥ठपेमालकु॥अणलने कोरा छो॥
तारे पशीम ठनदणे गुरे कु छे जे॥लकेना
पंदाछे रेआप॥तारे पशी आपे कु छे जे
कुता पंदा पुदाताला ना छे जी॥उक्तता नवी
रसुलीला॥आलेपकलंजनो छे उ॥जे गुर
नरदना॥तारे पशीन नरदणे गुरे कु छे
जे आपे गुणतागरीप छो॥अती नानी
आरछो॥त्यानकातकीण छो॥तारे पशी॥

ननन इने जरे करे छे ने हवी आमाने
छनेतु के पुराण करे सरे आप· तारे पत्रमा
पे कर्तु छे ने· जनमाहे धी तो ओ ए ना धाए
साहेब नाहे करन वीना· ने ओध साहेब नेग
नेत करे· पंदातु सेत पुं ओए ना धाए· अने
तो पंदा आप· साहेब नाग नेगार छत्रि·
ला छजुनमाहे ताएब घणी छे· लाछपव
गने तोए कपु दाताला छे ~~जुरे~~ नवीका
जुरबर हकर्ते· नेजुर नहनइना ए पुन
वी साहेब उपर· आपे छ जांन आसकु छे
तारे नहनइने जुरे कर्तु छे ने· कसनोतछ
ए बनो त पडरे आप· तारे आपे कत
नो करो छे ने· अपल कलन तछ ए ब
धाएन कलन साहेदत· असाहेदा

[illegible]

[illegible]

॥१२७॥

तेलोक माहे पेछ नानो घणी कहे ॥ त्या
पछी मरकर रहे छे ॥ ने ओछ माण स आदमी
पाणी गुण माहे थी पेदा थया छे ॥ ते लोक
माहे नस ताछ घणी कहे ॥ त्या पछी पेर
हीन कहे छे ॥ ने ओछ माण स आदमी अ
गनगुण माहे थी अगनमरण ॥ त्या पेदा थ
या छे ॥ ते लोक माहे नलाछ घणी कहे ॥
त्या पछी पर कहे छे ॥ ने ओछ माण स
पापगुण माहे थी अगन मरण ॥ त्या पे
दा थया छे ॥ ते लोक माहे गरी पाछ घणी
कहे ॥ अतीजन नीझार कहे ॥ त्या
नसत ठीनकहे ॥ ने प्रभु दाता ला अ
फरमायुं छे ॥ आर गुण माहे थी आरसी
पेदा कीधी छे ॥ ते माहे थी पापगुण
ने तो अती अगली आर आपो छे ॥

ते आप गुरु एने तो॥ अने अगतीआ
र आपो छो॥ ते आप गुरु एने तो अप
दा अपदी लगण॥ अलाज अने वुलदी
धा छे॥ अने न आन ने नदरु अत
फा अने नुं छे॥ आ नोते ने नवपराछ आ
ल॥ अलधातो ला॥ तारपछे पणी॥ पु
दा ला लानुं फरमान आव्युं छे॥ ते मा
टे पीर सारगुरुणी तो फरपतलधी
छे॥ जे कोइ नाएस आदनी आप
गुरुनाटे धीसरण॥ आपे दाकी धा छे
ते ने अने आपनाटे सो पीरुं॥ आ
पणी नी स्तनाने नगा दइ रुं॥ ने
को इ नाएस आ दनी॥ अगन
गुरु नाटे पी अने सरण॥ आपे
दा की धा छे॥ ते ने जे अ नारा ने नाम

ने आपसे तो॥ लो सत नाने जगादे
ष सुं॥ जनी कोइ अगम नाने नलाख
करी सुं॥ जे कोइ नाणासे आदमी पा
णीमुण नाने धीअते सरण आवे दा
रीघा छे॥ तेने जे कोइ अनाराजजाना
ने आपसे तो॥ लीसत नाने जगादेष
सुं॥ जनी कोइ पाणीमाने नलाख करी
सुं॥ जे कोइ नाणासे आ दमीपाअणु
ण नाने धीअते सरण आवे दारीघा
छे तेने जे कोइ अनाराजजानाने आ
पसे तो॥ लीसत नाने जगादेष सुं॥
जनीकोइ पाअे नाने नलाख करीसु
अे नणु दा ला ला अे लणुं छे॥ आनो
११ लाइ नवनाइ अल॥ तारप छे पनी॥

पुहाला लाहुं फरमान आपुं छे॥
जुरमान ६ जु स्तफाना लनाजुआर
उनाठथी॥ अने अरथे मलउ ज्याणे
जगा आ॥ अने अरथे पहाउी दी छे॥
लाउलपल अरथेनमीमठमहना
जुरनानानाठ थीपे हाथथ छे॥ आने
मेठ नगम राछ अस॥ असलपा तो ला
आ लेपअ लंन पुहाताला नापठी
पशी ते धोपरग आगले॥ नमीसाठम
नानुरपउी॥ हाहा आहनन पोताछे
हाहा आहनपउी अपअ हानपोता
छे॥ तारपछेउ रान आइल हनीआ
माठपरवारपे आ छे॥ अनपुहाताला
ने फरमाचुं छे॥ नस्तागजुआरउ
मठमह जु स्तफानुं॥ तेअनेलीहनी॥

परउत माने पोपे दाडी धा छे॥ पेआ
णीमुआरउ मन नदजु सत फाणी॥ ते
अमेली सतनामें दमाने पो पे दाडी धा
छे॥ आजो जु आरउ मन नदजु सत फा
णी॥ ते अमेली सतना नछआ माने पो॥ पे
दाडी धा छे॥ रेजु आरउ मन नदजु सत॥
फाणी॥ ते अमेली सतना तेज माने पो
पे दाडी धा छे॥ डाबे उभु आरउ मन नदजु
सत फाणुं॥ ते अमेली सतना अलख मा
ने पो पे दाडी धा छे॥ नाउ जु आरउ मन
नदमु सत फाणुं॥ ते अमेली सतनी अपारे
माने पो पे दाडी धा छे॥ रेजु मु आरउ मन मद
मु सत फाणुं ते अमेली सतनो जत माने पो
पे दाडी धु छे॥ नो वे उभु आरउ मन मद

रुरूतफानुं· तेअतेली सतणी ते
आना ठे थापे दाजी धा छे· जले आमे
आरं नठ नदरूसलफानी· तेअमे
ली सतणा जेर ना ठे थापे दाजी धा छे
दात रूआरं नठ नदरूसलफाना·
तेअतेली सतणा जर दा सावमा ठे
थीपे दाजी धा छे· गठी रूआरं नठ
दरू सफानुं· तेअ ते ली सतणा मध
माठे थीपे दाजी धुरछे· पला वेउि मरूआ
रं नठ नदरूसलफाना· तेअतेली
सतणा जदना ठे थापे दाजी धा छे·
आनु वेजि रूआरं नठ नदरूस
लफानी· तेअमेली सलणा उपलमा
ठे था पे दाजी धो छे· तीथ वे उजु आ

२३ नरनइ महमु सलफाणा॥ ते अमेली
सतना संखावलमाहे थी पेदा कीधा छे॥
नइ त्रिजुआ २३ नरनइ महमु सलफाणु ते
अमेली सत ना जफराण माहे थी पेदा
कीधा छे॥ आत्रडीहि जुआ २३ नर नइ
महमु सलफाणी॥ ते अमेली सतना संताने
माहे थी पेदा कीधा छे॥ नरदामु आ २३ नर
महमु सलफाणा ते अमेली सत नी सलके
णु रोमाहे थी पेदा कीधा छे॥ नाडमु आ २३
नर महमु सलफाणा ते अमेली सतना रेणु
रमाहे थी पेदा कीधा छे॥ रगवेडि मु आ २३
नर महमु सलफाणा॥ ते अमेली सतनी पंद
नी माहे थी पेदा कीधा छे॥ २ मरा अमे नर महमु
सलफाणी॥ ते अमेली सतना फुलगासमाहे
थी॥

पदा कीधा छे. अम खुदा ताला ने फर
मायुं छे. आ ठामे ठ नबराइ अलअ
लवा लो ला. आ हेव अलंन. खुदा ताला
नाफजी. अे ताशेफ अरवे नु रजन हमु
सलफानी करी धा छे. तारे अेवी नथी आठे
नीता शेफ आलखी ने न नबराइ अल
पोताना दलन ठाणथी. कलमोतइ. अे मनो
पडा छे. अने ता ठा रे नुं छे न. अपलकल
मतइ अेम. दोजे मेकलने आठा हत - अ
सो ह ठो अेन. ठरलाइ ला ठा इली लाठा
नठन हरर सुलीला ने. वा अे हनुं अला.
सरीकुलनुं. अ ठे हपन. मठ मह दीन. अम
हनुं. पठे रसुलनुं. अे वो कलमो पडी ने
सहध आवे छे. अने सा ते मला महरी दी
छे. नबी गारइ मा मेकनुं छे न. अे वा सु

घडलमो पडीजे मरद स्थाओरत छमान
आखुतराख से. तेजवली स्तीन से. ताजा
नरलीनालागव से. अेवीजुरनामाणोनजी
गत. लमानकु ध सं पुरलाछे. जेओछलागे
आलनेनरनीआर. तेफरीनलीअपतरेआ
वागवनजुगसं भार. अेजुरनामुं वासे स्त्री
आलने. तेगतजमालउ मलामछे. मेनेजाने
नेराखुं उमलामछे जुरनामुं संपुर ले. जु
रनानानानरफनवसे नवालु. ॥ ॥
॥ श्री ॥ गमोटा जुरनाननीपासी घलल
फीछे. ला रप छे वनी पुरा लालानु
रना नआवु छे. जे आनो मेने अरनसा
उअल. अे नननवी सानेवडेछे अेतारी
फसरवेजुरन नेनछेमु सेत फानीजोधाछे
जेओ छजुरनानु छमाणसुं वाये. स्थासां
ज.नि.

त्यांनु रनाउलणीने पोतानी पासेरा
खे. त्यारखाणेपोताना घरमांहे राखे
लो तेनेखुदातालापोतानोपगांलने राख
से. तेखुंदानेदीनदनोआमांहे पोतानो
दरोनेराख से. यहाने दाह खुंदानो अहु
लआ दीपो म सेहे. तेने अंतराहनबी
खे. तुरनाउसांनहाथुंहोयतो. तेखुंदा
नो हुकुम नकरता मांहे लो पासे. फरके
तालेनुं अपलनाउलखसेहे. अनेवलीवा
नपरेग. नहतफरस्ताउरसे. तेखुंदाना
गुना. त्या. दीनदुनोआमांना. त्याआखरी
तना घनांमाहेख फजल करसे. तेनोउ
परस्तानमांहे आमारघाकेननी. तेनो
मीटी याज. ठाद खासे नहीं. तेनेखुदा
तालासेलांनधडोहेरगमीस से. चेला
डालख तोहरोत. बीजडीतालखनं खुके

॥ १३२॥

नेरशी आणे डीलाय अजर. जेर हाडि. यो
पर डीलाय. फुरडाण. ज ड जदकु स्तफ।
सलंला डो आलेच केलग. अवीयारे
डीलाय पडाणो कयाय थाके. जेडोइ
यंहाणु हाता लाणो जुरणाकु यांसे. स्या
आलफे. स्यालयाणे पोलाणा घरमाते
राये. ते यंहाणा घणा. तेनीमाल पोलाना।
गुणा. तेना आतपरी आंणा गुणा. आडेय
फललडर करे. जेडोइ छमांणकुयामे
स्या आलफे. तेणा गुण आडेयफललडे
रके. स्याहकगणहफे थाके. तेयंहाडि
पर केतांणकुडरमाल केणगी. तेने [illegible]
य आयरीलणा आणरथी रायीलसे
लेने गाण आण जरहणो केयाय थाके.
लेने धनी आणाता फाणथी रायीलसे.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥१३३॥

रहनत डाणि हडतालाणानु रनामामाहे
थो नप सेणवा एक तरफ उलाडी डागा
छे. ते तरफ मालको णे घएणु माल
पेआ छे. अने पशी मणोमाहे मा एक छे
जे तरफ कुल तणगा नपीने हेठ मोडे
लोकु. तारे ते पातनो खबर कुलतां
नगन नपीने थए छे. ताहां अछारहा
डाणीपार हती. ताथी मामा पोपाआ
ली आपी छे. तारे कुलताणम हमहगल
लोने. ते डोता अहेठ मोडेला छे ताहांमा
सघला हता. स्यातर डने आरुप घणा
हता. त्या अनपने मुसलमान घणा ए
ता. तेमा एक से हरफ डीहा. स्या मालम
छे. तेणे मालकीने घएणु मालपेआ
छे. तेने घएणु हा अलपे उछे. कुलताने

गनजनपी अे. अेत्रीताप पोतानीपासे.
पादीनेपामीनेउछे. तेवामोनेप्रुदाता
लानुरुत्रराएउ त्रीधुछे. त्यांउठीनेप्रु
रषानीओठीधी छे असानल. त्यांफलल
नकठानी. त्यांनोयालीपरनाम. त्यातारी
फथणीठीधी छे. पछे अे ठरफछमांनिभंगा
पीलीधाछे. ठठीगतसरवे पामीनेतेउछे
अनेठजरतरकुतनामोठारेनप्रुपत तेञ
रनामाउपरपेछछे. ने अेत्रीतापसरुलतो
ननठनदगनजतोनेपरेसाछे. अेणे धना
नोराठीधा ते परणपरेसाछे. नेठोछनुर
नाठया मीसालपीने. धरणछजलदीधी
छे. अनेदाऋदारीदेतात ता. तेनामां रा
नानासाठेपेपरेसाछे. तेनेठानेलीस्तना
दरयानसाठेपेउधाडीमेल्योछे. तेना
पप्पाराणानपापसालहो. तनेपार

तेना रुडा साक आ काल कीधा छे॰ तेने आडे
तेना रमोतेल म एवो दीधा छे॰ अेपडी सो
मानी स्या मेतेरपा नो॰ अेपडी रा अेत प्रुदाल
ला अेमरु सो छे॰ तेने तो मरतेल नुरना मानी
छे॰ जे शेख नुरनानु पासे स्या आलन॰ तेने
समदवान कीधा अे॰ तेने प्रुदाता ता पो
ताना॰ पना ठमा ठे राम से॰ जे शेख पेनेदा
कन ठमप नुस्त फानी॰ पासे स्या आलम॰
नुरना नु लपीन पोता पासे राखे॰ तमारे नी
मान पडता रे कर दाने ठेशारो राखे॰ तेनुर
नामा साथे कजदोडे रे तेने नुलके रापे गापर
तेनानु फश धाअे सकी॰ तेने प्रुदाता तापो
तानी पना ठमे राम से॰ जे शेख मनमद
नुस्त फानी पेठे दाम॰ त्या तारीफ दील देवे

[illegible]

[illegible]



[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

जे ओछतनारापे दाकयामे त्या आलते
स्या पोतापाके राख्ये. तेनो ठउताला ए
तरतयोनो टोडो थो छे. तेयं दानोडमा
छनोरी थछ छे. अने नठउतालाए फरमा
वुं छे. तेयथरथछ नथ राछ अते नतनद
रकलोलाने दीधा छे. जे ओछछमान कुंद
मे त्या आलते. तेयंदाने साठे य. मोनो
देसे. त्याउरतयउसासउरके. करवेमु
ननत्याकजनागी. नरदत्याओरत. न
रेनरी नरतलो रना ठ थोना से. अने आने
नान जयनेज उपर आपके. तारे ठउताला
तेयं दाउपरजानेदेसे. त्यालफाएतडीधी छे
ठजरवरसलगी. मुउानमाठे छने यंदगी उ
रसे. त्या भारी उमर रोज राखसे. तेनो कीया
य

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

तेनी प्रुदातालाने उमे दघरणी घरणी छे.
तारे पछो प्रुदातालाअ करे माप्रुं छे जे
जेनत नीक ना नाना राशी दा छे. अने प्र
ज्र प्याछ आसी छे. पेला पेगाम्बरनो छ
सेरो जीला ठा. बीजा पेगाम्बरनो मुसे नरा
मुसा. त्रीजा पेगाम्बरनो. ओलराजीम प्र
लीलीला. चोथा पेगाम्बरनो इसा साम
ला. पांचमा पेगाम्बरनो आदुम असला
छठा पेगाम्बरनो अस्समा छअल. ते जेनना
मुना जगाफरजनमदथी. अने नीरत माने
राप्पा छे. ते जो इन्दु रना मुचासे त्यासालने
तेनो तानु प्रुदातालाछहि. अने तेनु अप
लना जलपी छे. तो सस साठेपे धने सा
छे. ते पंदाना दमेठजरजुनाठो स्ते तो छे.

तेने अपलनाठ लपी अे. दस ठेलरठ
पेली अेा तेपं हाने पासले. लसतमा
रथा से. तेपं हानो नरतपां नोरो अे
लीआनानि पडीथा अे अनेरोने डे अ
नतना हन अेउधी. फरसतालसतनी डे
रतेछन से. तेनेली सत नीरा अेत
नारी था से. तेपं हानाडीलनां ठे
नेरलाठपाछा छे. तेरलाधनाठा अे
लोपरणुहालालाअेमडे मा छे. सातं
नो. पी नेउ. साते प नदेल परार
रसे. ते पररेल अरपेनेउ रनानं
नीछे. नेनलाअेउनरगपे. अेउ
लाडराने उं. पीनतांडा तनउं
तेपं हानेरे पररनाठेपुछारउ तेप
आप से. ते आपेप रा नररपरे पां अे

तारे फरस्ते उन्हु छेनी अुघरने मतछ
रपंदाघोरते आ मतना• इश्क आशा
नछे• तेथ रउतउ लनालछ अे थना
नी छे• अेतु पुदालालानु फरमांन
आवुं छे• आ नो ने रनथदाछ अत
नलयालोला• आ लेयनेलेन• पुदा
तालाना यनी• अे नुरनामानीनेशीरा
न• तेननेनदनथारसुलीलाअे नेलना
यीछे• पाशी यल नेंपुरराछे• अप
लउलनेलछअेप• दोअेनउलनेसानो
दत• असाोदेनो अणा• नउला अे लाना•
छलंलानो• नानदरसुलीलाने•
पाअेदनु अला• सरीउलनु• नेने
ननमदन-
दवण• अप्पदनु• वेने रउलनु

स वाजु रनानानी आसीयल सी घा·
रुद स पुरणछे सठी:: जे वापुसलग
नां सानी परत हती ले वाउतारीछे स
ठी· जल मुरु साठे पळणे· पंहातो अ
लणछे· साठे पळणछे· जेयांसे साल
जे तेनालजु नातु कुसलानछे:: ला· पा·
फा· गो· २· गा· पीराणाना॥ ॥
॥ ॥ ॥ ॥ ॥ ॥
उगनो आदि सगरे कुं· मरे र नधे
जुग उन ज· असतांन ते आद
दल पाप डी कोरे नल ते आप
साश्री· गुरु स देव डो· रगत
परण अंदरो ने गुरु ने सर
सवती· स उत जसा वाद न
नं गा गोदावरी उरत असे

॥१३७॥

[illegible]

अस्नानां पाप परमोछे तेपु
तरीपजनान नथपधंनते·
गंधपुपदीपला· होमीला ओमी
अलीपुजनीयेह श्रीआनंदेवज
लगाडो जाणे मगाये सो प्रेमपद
पावे अजाणे मगाये सो अेपताण
पे· सेजा· सवेर सासउसासम
डला· उलरता· आाठ तजार जाह
१०००॥ स्रीआनंदेवजडोअरपण
ठ· ॥❀॥❀॥❀॥❀॥❀
उनतो आदेसगाडेडे· सडेरनाघेठ
रहाडेमल असलांन· छहलपाप
डीडोडेमल तेआपासासीपत
सनायदेवजडा लेख सडे· गडेडया

तेणं· हल सागरमांहेरत्न अमोलाण
पापपरमोछंते पनरीपणनानन
छपंध ले· गांध धुप· दीपसां हलता
फुल भेली पुज· श्रीपीरनपदेपण
लनउो· जाण मडापे ओधे मपदेपा
पे· अजाण मडापे ओ भैपलजपे·
तेजा रूपर साहेबसास· मडला
ऊलरता· जप· ५००० ॥ छतजरे·
जप· श्रीपीरनपदेपणलनउो भे
पणांहे· ॥ ❀ ॥ ❀ ॥ ❀ ॥ ❀ ॥
ऊनजो आदेसगरेउं मुहेरनघेउं
हेउजाल अमलांण· पाप हलपाप
डीडाउनल· ले आपाआसीमाहेपण
डा· पारवतीसउत· नदेपान· जन
सागरमांहेरत अमोलाण· पाप

परनां छंले पुरीपंजन नान नछपंथ
ले· गंधधुपदीपलां हल· लाधां ल·जे
तीफुजन नीवेहलनने· आनाहेवजल
नने जाणा मडावे सां त्रेनपहपावे
अजाणा मडावे सां अेधल जावे सा
ज मधर· आमउ आम मडलाउ
लरला· ५००० पामठजार जाप माह
पजु लनने अरपरोठे· ॥ ॥
॥ ॥ उजाणां आदे मनाइ डुं· यडर
मधे अपेणी अंत्रपान· लेआदाह
लपाधंडीडाडनल· लेआपाआश्रीज
रनंजनीसाहार हेयजा जतीस इपना
पासा· अधम सडेल गेहपान अपेणी
सागरमां डरल अमनान·पापह
रनां छंले पुनरीपंजन नछपंथ

गंधधुपदीप लाहुलताम्बोल अेती
पुजानीवेद अलप्यतानुं जणा भडा
वेओप्रेजपदपावे अजणो भडावे
ओअपतजावे· अेज अेपरेओ
अउओअ· भडलाउतरला·ये
ठजार॥ २०००॥ जपे अलपजारवं
जजराडारदेपज जोलीअरेदी·लज
डुअरपठे· ॥ ✿ ॥ ✿ ॥ ✿ ॥ ✿

॥ ५००। ६०००। ५०००। ५०००। २०००।

२१५००

[illegible]

पां॰मे हेमइर नाजरखां धुं॰ कमा
राखां धाछुरे॰ तो खावा आहनको
नरावुरे॰ आंत लहुर श्री हीनको
रांग॰ कनकु राखे अेक सोलांग॰आ
छखलाके आकरे॰ आछखलाकु प
रले धरे॰ नाजे काको ट॰ लोलोकाक
नाड॰ घरघर फरेणवी आहे खकाआ
सपार॰ अलाकी अलाछ॰ नहनद
कोखाद आछि॰ हकलाने लाला॰ छली
लाहे॰ नाहनादर॰ रक्क लीलाहे ॥

॥ ॥ ॥ ॥ ॥

॥ ॥ ॥ ॥ ॥

॥ ॥ ॥ ॥ ॥

॥ ॥ ॥ ॥ ॥

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

	[illegible]		[illegible]
1	[illegible]	1	[illegible]
2	[illegible]	2	[illegible]
3	[illegible]	3	[illegible]
4	[illegible]	4	[illegible]
5	[illegible]	5	[illegible]
6	[illegible]	6	[illegible]
7	[illegible]	7	[illegible]
8	[illegible]	8	[illegible]
9	[illegible]	9	[illegible]
10	[illegible]	10	[illegible]

	[illegible]	1	[illegible]
1	[illegible]	1	[illegible]
2	[illegible]	2	[illegible]
3	[illegible]	3	[illegible]
4	[illegible]	4	[illegible]
5	[illegible]	6	[illegible]
6	[illegible]	7	[illegible]
7	[illegible]	8	[illegible]
8	[illegible]	9	[illegible]
9	[illegible]	10	[illegible]
10	[illegible]	10	

આસમાન	ખેત્ર ના નામ
1 હસાપર	1 હરિઆરા મતી
2 બગા પર	2 માન સરોવર
3 માણ્યા પર	3 ભોજા શહેર
4 બાશ મેર	4 સર બા ત્રિશરી
5 ખોમ્બેલાપર	5 પંચપુરી
6 માહા પર	6 બઈરા પર બ:
7 આળો દાયા	7 રાબ પરી
8 ગોબુજ	8 [illegible] ખેત્ર
9 હીમ પરી	9 બુન ખેત્ર
10 દોસ્મ દેરમા:	10 બુઆર બા ખેત્ર
ઝંને પ્રપના	પાસન ઈ મુળ રરપા
રહેરવરણ	ને
ખેત્ર બુવારા	
બાણાઆ કુવો	

	[illegible]		[illegible]
1	[illegible]		[illegible]
2	[illegible]	1	[illegible]
3	[illegible]	2	[illegible]
4	[illegible]	3	[illegible]
5	[illegible]	4	[illegible]
6	[illegible]	5	[illegible]
7	[illegible]	6	[illegible]
8	[illegible]	7	[illegible]
9	[illegible]	8	[illegible]
10	[illegible]	9	[illegible]
11	[illegible]	10	[illegible]
12	[illegible]	11	[illegible]
13	[illegible]	12	[illegible]
14	[illegible]	13	[illegible]
		14	[illegible]

દેવતાનુ નામ	દૈતના નામ
૧ [illegible] દેવા	૧ [illegible]
૨ [illegible] દેવા	૨ [illegible]
૩ [illegible] દેવા	૩ [illegible]
૪ [illegible]	૪ [illegible]
૫ [illegible] દેવા	૫ [illegible]
૬ [illegible]	૬ [illegible]
૭ [illegible] દેવા	૭ [illegible]
૮ [illegible] દેવા	૮ [illegible]
૯ [illegible] દેવા	૯ [illegible]
૧૦ [illegible] દેવા	૧૦ દૈત [illegible]

	[illegible]		[illegible]
1	[illegible]		[illegible]
2	[illegible]	1	[illegible]
3	[illegible]	2	[illegible]
4	[illegible]	3	[illegible]
5	[illegible]	4	[illegible]
6	[illegible]		[illegible]
7	[illegible]		[illegible]
8	[illegible]		[illegible]
9	[illegible]		[illegible]
10	[illegible]	9	[illegible]
11	[illegible]	10	[illegible]
12	[illegible]	11	[illegible]
13	[illegible]	12	[illegible]
14	[illegible]	13	[illegible]
		14	[illegible]

	[illegible] नाम		[illegible] ना नाम
1	[illegible] देवा	1	[illegible]
2	[illegible] देवा	2	[illegible]
3	[illegible] देवा	3	[illegible]
4	[illegible]	4	[illegible]
5	[illegible] देवा	5	[illegible]
6	[illegible]	6	[illegible]
7	[illegible] देवा	7	रावण
8	[illegible] देवा	8	[illegible]
9	[illegible] देवा	9	[illegible]
10	[illegible] देवा	10	[illegible]

[illegible]

[illegible]

[illegible]

ग्रं ग ण रुमप जला पेः तोकुय
न सरी च्या पाना ना वेः॥ १ ला॥ ग्र
ला पार सर ज पुन श्रा पिः जे नो ग्रेरु
रती छ पी ते सो प ण पा ग्रेः॥ २॥
श्रे पे नो ना ला म री मरी ना। ग्रेः
ता ना। ग्र ला घा द रसा न पा ग्रेः॥
॥ २ ३॥ ग्रे म पी ला [illegible] मा म सा
श्रा पो श्रा पः ते नरु हा मा ना पेन
ग्र ना पो ना [illegible] प ४॥ २ ४॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

1 [illegible]

2 [illegible]

3 [illegible]

4 [illegible]

5 [illegible]

6 [illegible]

7 [illegible]

8 [illegible]

9 [illegible]

१० तांद्राद्रारानंगद ०

११ तांद्राद्रानुरनद •

१२ तांद्राद्रामृला ०

१३ तांद्राद्रापृजा ०

१४ तांद्राद्रापरजा •

१५ तांद्राद्राजवृ ०

१६ तांद्राद्राहापां ०

१७ तांद्राद्राजणजा •

१८ तांद्राद्राजवृणाणा •

१९ तांद्राद्राणागजा ०

२० तांद्राद्रारणजा •
द्राद्रापेदा •

२१ तां द्राद्राणवृ •

२२ / २३ तांद्राद्राद्रजजणी [illegible]

२४ तांद्राद्रालेपाणमा •

૨૬ કાકા. રામજી લખમશી.

૨૭. કાકા. રતનજી રામજી.

સ્ત્રી કુંદનબેન સમજુ

१ सा ॥ श्री. मनहर लखोछी ॥ ॥

श्री. सतगर साहेबने करु सलांम

सतगुरु एक नीरे तर नांम.

सांई सतगरो नेतगेनांन नेलाले

तोतांन सघेतांकु लखांण टपाले

सतगर वचनते पर पई सुणीले

सतगर प्योघते प्रेमे लगीले

चंचल जांतकु तो पर पाले

ऊसीसर करवो सतगरण लीपाले

कुतत कुलाव ऊपुघी पर हरीले

साहेब नांम केहेतां नीसे तरीले

कु ही सा आ सांई हो. पाछी ॥

अलअलीअने तुनेको आ

सोहम

लीआ नहनार नांमरे

मनहर सु नेने नेहकीआ

तेने तली आ अंतर मांतरे. ॥

સઘલી વાતની એ વાત જ સાર

મંત્રસુધ પાંમે સતફલ જવપાર

કારણ સઘલુ રે તંતન તણું

મુનીવર એણીસું કહીએ ઘણું

કાઆ કલેસ નોઇ રસો તંત

પીર કરી રાખો સંચલ નંત

જેસ ગેલાંને તંનપેર પાલે

મુનવરની જીભ ડોલે ઉપાટે

કાઆ કાસીને તંનછે ગંગા

ગુરૂને સરણે ના લાગે રંગા

તુંહી સામા સાંઈહો પીરજી

રંગ રંગાવો દીલજાં

અને કાં ફરો વનવાસરે

ઘરમાં લીરખે સોઘીએ

તો પીરજી રહે પાસરે ॥ ૨ ॥

॥२॥

घरनां तीरथ ने घरनां वेन

नीरमल होवे जो आपणुं तन.

ज्यांहां लगी तनसुं फरता फरीये

तीरथ वनना अरथ न सरीये

कारण तननुं सघळु जाण.

अनंत अनांणी सुं बोले वाण.

सोधो सासत्र ने वेद पुराण.

पुछो पंडीत सतगुर सुजांण.

सतगुर सासत्रे साखीये पाप.

तनपर पाळे नहीं सोक संताप

॥ दुहो साच्चा साँई हो.॥

तन पर करो धनीपरो

अने परथी नां दुख अपाररे

कारण सगळु तन तणुं. ॥३॥

एम सतगुर कहे पोकाररे

वेनी वेती कीने एही जतंन
नेगे नीरमल पाले जोन.
सांई सतगरो तज अलीमांन.
सतगरु सरणे लागती नीजगेनान
सतगरु गेनांनो सतसंग करीले
गाआ नोही नजर परहरीले
गेनांन वसं नरुहामां धरीले
सतरंग लेक साहेब नुं करीले
अेसत लगती अेपरन गेनांन
सगपो कीनो दरसरी सनांन
तुंही साया सांईहो. पीछे
परघर हरी वापी र आ.
तीनोनोई ले नो जागरे
देह पडी अलगो रहे.
अेसलगरु कहे गेनांनरे ॥७॥

॥૩॥

અન્તર પીછાણે નેત્રંતને ગાલે

ઉલપીન વેસ્વ તેગેનાંને બાલે

એઉ અ દૈતરે તાસે બ્રેન

આદે અનાદી નો નાંણે નરેન.

સરવે સેધાનતી ઇછી સાર

બાહેર લીન નોંગે બ્રેન વીચાર

સુધ વીચારે હું તું ટલીલે

અનંત અન્તર નંત હરીનાં નલીલે

સતગુરૂ ગેનાંને લેસન ઉ હીલે

અનંત નીરાલંત ઉન નરહીલે

॥તુંહી સાચા સાંઈહો॥

નેનવસ નરહે આપણુ

તોઉન ઉરી ઓળખે ઠાંનરે

નંન ઓળ્ખાલે નીન નંના ॥૬॥

નો ઓળખે પુરંણ ધાંનારે॥

एवे अनुतवे सांई सतगरीले
सतगर वचने कुबुध परहरीले
अलख अलक अलकनां अलख.
एवु दीदार पायो मुनीवर आलख
सगले पुरण सांई परकास.
प्रगट नहोले वेण वेसवासे
वीनां वीसवासे वेसवास अफले
अकुल सरुपने कोई न कले
वीसे वेवारनां सरवे मोहे
अजन अरना पीछांणे वीरला कोए
॥ સુહી સાચા સાંઈહો પ્રાણ ॥
सतगर वचनदीलनां ग्रहो.
तो कारज सरवे होवे रे
नेननीननीन पेलनां लहे.
तो अंतरपीछांणे सोवेरे. ॥ ६ ॥

॥४॥

ताआप्नीते अेकज जोते.

वरतांने ओलखावे सोवे

ताआ संगे तेन कलपीन फरीये

तो परंन संगे सकल परहरीये

आपवीयासी तने तेने तेन.

जनेन ओलखो तने लेगे तेन

तेननां अघरन ओलखी लजे.

तो नरनारायेण नीरंतर लजे

नेहां नर तांहां नारायेण जाण.

तेनसुध पालो होवे अेमजांण

॥इती साचा साईहो ॥ ७१.५

तेनसुध करो जुनीवरो

तनकशो पराई वातरे

तेननु लखसण ईनछे.

ने करे अरी परी वातरे. ॥७॥

સુધ ગ્યાનનું નહીં લખસંગ લેહે
કેની નીંદા ના કરે તેહ
દેખે સઘળે અલખ રેહેમાન
તેને અંતરે હોએ પરેમ ગેનાન
અનેક ભગતી સાધન જો કહીએ
પરેમ ગેનાન વીનાં અરપે નાલહીએ
પ્રેમ ગેનાની ઊપાધી ના દેખે
સુરીજન વીનાં અવર ના પેખે
અનેક રૂપ નામ ગુણ ને કરેમ
દરસદીએ દેખે સબ ઘર પરેમ
દુહો સાખ્યો સાંઈહો ॥ પીઉ ॥
સબઘટ સાહેબ દરસીએ
તો આપ રંગ સરવે જાણેરે
અવરદેયાને સે પ રહેરો
રાખો સુરત લગાઈને ॥ ૮ ॥

॥૫॥

અવર ઊપાધી તે સઘ પરહરીએ
અનંત અગાર દરસરી કરીએ.
અગાર દરસરીએ અરથ સરે.
જીવ ભવસાગર સુખે ઊતરે.
અગાર દરસટીએ હોએ નહાકાર
અનંત અગાર તે સારો ધાર.
મુનીવર સાવધાનપણે ને રહીએ
અગાર દરસટી રૂદામાં ધરીએ
અગાર દરસટીએ અગાર નીરખે
અનંત અગાર તન મોહીલે હરખે
॥તુહી સાચા સાંઈહો. પીઉ॥
અગાર અલી અવનારણ
તે આદ વીસનવ પરગાંણરે
આલે અંગાર પરગટે
સોએ ઈશ્વર પીછાંણરે ॥૮॥

हरी जेनो जनहोए परसंन
अरु परु न पावे जंत
हरी चरणे जन नीरमलहोए
मुनीवर हरी ने नीरंत्र जोए
जनछा वाचा ने क्रमा सही
मुनीवर राखो रुदा मांही
गोरनर परसादे बोला जंत जेह
अनंत अजर सांत लाधा तेह
सरवे परकारे जनहरने करीए
सतगुरु सरवे लेक सांई मीनहरीए
॥ छुटी साखा सांईना पीछा॥
साहानु सतगुरु मीलजे
सतगुरु तेहो लहीए लेहरे
आदवी सतव नर अली सतछ
नारा अण
एनाबोले मारे वेहरे ॥१०॥

५ पेटताणुं कंइ जो करीए
अली अलीनांत अवनीस ओसरीए
अवर छीपाडीए अरुप न सरीए
हरी हरी
अली अली कहेतां जुग नीसेतरीए
प्रेमे प्रीते जपो अ वीनास
अलख अवरनी तजो आस.
फलने सरपे तजो सारंग पराण.
एतो दुरांन दारो पुरण जाण
फलन जो साहेब नीं सेवा करीए
केवल जगती गेनांन ह्रदयामां धरीए
तुंही साया सांईडो ॥ पीडी ॥
साहेब सुपेयार घणु दरे
जो छोडे अवर आसरे
सरवे आसा परहरो ॥ ११ ॥
तो गोर नर तरे पासरे

वसे वासना परहरीये लोग

तेने साहिब वहाला परजोग

तेनुं तन गुरु चरणे जो रहे

तेने अतीसे अंत लव गमे

तेणे अेक साहेब वहाला करीआ

तेणे रीधी सीधी लोगपरहरीया

हरीने हरीजन वहाला सही

सत संतोक श्रीगुरु वाणी कही

श्री गुरु वाणी कहुं वचंन

सांभलो कुंनीवरो अेक मंन

॥ हुं ही साच्या सांईहो । पीछा॥

श्रीगुरु वाणी ओचरे

गुरुने वहाला जोतरे

वोस वीस्वना चमंनपर

ते परतो अेक चेतरे ॥ १४ ॥

૭

હરીને હરીનંન સદા એકુન જાણ.

અનંત અંતરમાં નીશ્ચે આંણ

હરીથી હરીનંન જોરા સહી

હરી ત્રીગુંણ. હરીનંન ત્રીગુંણ નાહીં.

હરીનંનને એક હરી મીતવંત

અવર કે આંહી છે નહીં તંત.

હરીનંન પુનતાં નીશ્ચું પુનાલે

પુનંન પુને હરી ત્રપતપાલે

સાંઈ સગલે એક ધેહન ધરે

પરગટ કહીએ હરીનંનને રૂદે.

॥તુંહી સાચા સાંઈડા. પીર॥

પ્રગટ રૂદે હરી નંનને

તે તન પેસે બેપારે.

અચરત ખેલ અતોલગલ

તેનો કોઈ નાલવે પારરે ॥ ૧૩ ॥

गुर्जने चाला गुनीवर जंन.
तेनुं के आंख्ये न चाले नंग.
तेहरी जं जनी हुं सेवा करुं
तेनां वचंन ते नास नके धरूं
अेने हरीजंन. हरीजंन हुं जांण.
अेमकहे भीना रतेण वांण
हरीहरी जंनचमे अंतर नाहीं
रुप भेपाग हील अेकुज सही
हरीजंन हरीहरी अहोनीस करे
हरीने हरीजंन अेणुं नाचीसरे
॥तुही साच्या सांईहो. पीओ॥
हरीन हरीजंन अेकुर्ड
तन हाेए नहे जो जागरे.
नंनजेस डाआनां जागीए
अेनश्रीमुख्यकहे नरचांगरे ॥५॥

સરવે ધરતીએ બીદક જોએ.

તેણે જલે કરી અરપે નહોએ

પરગટ હોએ તોહાં કારન પાએ

હરીપરગટ નેઆ. હરીનંન ગાએ

જેજેલખ સંગ હોએ ત્રીસ

તેહરીજેન તે પ્રગટ જગદીસ

હરીનંદ લખસંગ રૂદાનાં ગ્રહે.

અનંત અંતરનાં સતજીરહે

સંતનાં લખસંગ કરીએ જેહે.

એક તંના કુનીયર સુગીએ તેહે

।। ૩ હો સાચા સાંઈ હો પીર.।।

એક જંન પઈને સાંભલો.

સાયધાંનપઈ ને જુગતરે

જેન તેના કરીને આદરો

લખસંગ કેરી જુગતર ।। ૧૫ ।।

જેમતેમ કરી આપીએ વાલ.
તો પરંત ગીનાંન પાંનો સાચ સાન
જેન રૂદાનાં કુબુધ પરહરીએ
હરીજંનતંન અમૃત નાધરીએ
સાર વચંન બોલે સો સંત
અનેન અંતર નાં વાલા ભગવંત.
હરીજંન હરીચરણે નંમન નાંડે
અવર ચારગ તેની છાંડે
હરખ ને સોક બે ધરે સમાઈ
પર ઊપગાર કરે હેત મનલાઈ
॥ દુહી સામા સાંઈહી ॥પઊભા॥
પરઊપગારી પરમારથી.
હરી જંનતેનું નાંનરે
જેને કાંમ ક્રોધ વાપે નહી. ॥૫॥
નીરમલ બુધી તનાંતરે ॥

६

ग्नो के आंहे हाणा अे नही.
धीरज वीरजी जांणे सही
हरखे सरवे पवीत्र करीले
नीरकुंनी संगले चोदस फरीले
कुनल सुलावने नोननीत धरीले
जहेर वानेने पवीत्र रहीले
साया हरीजनके अे मेन होवे
वीसे वीकार ना दीसे कोवे
हवले ना ऊपजे. कसीले परमांण
लगनी गेनांन ले सत करीने जांण
॥कुही साच्या सांहीे- पीढी॥
सत करी जांणे ते हरीजन
जेने अेक हरी सु ओपरे
अहार वेवारे वलगी रया ॥१७॥
तेनी लगनी पोपरे ॥

જુગતે આહાર ને જુગતે વેહેવાર
અનંત અંતરમાં વસતુ વીચાર.
સોલ સુ લાવે હરો નંત નંત દરીલે
પીર પૈર્લતેને સદા અનું સરીતે
સતગરૂ સાહેબને સરણે રહીલે
ગોર નર લગતી તેને કહીલે
તંત નીરમલ તે તુંની વર લોણ.
બાહેર લીત્ર તે સારંગ પરાણ.
અતર અડલગત રૂદે સાવધાંત
આઠ નાદનું તેને નહીં તાંત
॥ તુંહી સામા સાંઈહો પીઠ ॥
આઠ નદ અલી તાંત નહીં
પરહરીલે નીર ધારરે
ધીર વીર સામા સદા ॥ ૧૮ ॥
તેના અનું લવ નોનહીં પારરે ॥

नेना अनु लवनो नहीं पार.

गुंण गंभीर ते हरी नंद सार.

धरती ने पाने हेसगत धरीले

नीर ग्रहीने नीर परहरीले

सतगर साहेब ते भीरव लोग.

पांणसु पसरते नीर परमांण

हरीनंद हरीनां नील करे पखांण.

हरी चरणे हरी नंद नरवांण.

हरीनंद हरसानां हरी परमांण

हरीनुं संतरण नो. हरी नंद लोग.

॥नुं ही आ आ सांईहो ॥५॥१॥

आठ गुण जते नेहरीनंद.

आंक रहीत वाहा हेतरे

घईरागे पस वासे भरा.


ते हरीनंद हरीना भींतरे. ॥१॥

पर गुणजीने हरीचंन पावन
मांज रहीने ते ओतंन तंन
सरवे साधु सीने दीधे मान.
हरीचंन लगनी ने श्री नारायण
कलप वरसनी पेरे सतरुप.
दीलरखडी रहीए [illegible] नरपे.
नीत्र लाग्ये सगला जेने
रेहेन रहा नां कहीए तेने
हरीचंन सतां सती नही डोले.
जाहा पदमनी नीरंतर बोले
कहो साम्या साईहो पाळा ||
जाहा पदमनी ने हरीचंनने.
जे जुगनां जरलगहोलेरे
अनंत लोअंन ओघडे ||२०||
ती सबधर दरसंण लेएरे

(મુ. મા...
મધે માંબ મા.
ત્યા માતાજી ત્યા
જીવરાજ ત્યા મા.
વાલજી ત્યા ઉપાડી
કુટુંબ સર્વે ને ઇ...

જત. આ...
મા. રતનસી કેસરા
પરેના પરબત રતન...
ત્યા છોટુ વિશ્રામ
મંગાળા ઉપાડે ત્યા
ત્યા રામ રામ વા...

જત વ્યાપ...
વાંચી દીવાન જા...
સંભારીને લખ...
જાણું અમારાં સમ...
વકીલ પાણી...
[illegible] ઉપાડે ત્યા...
[illegible]
ગામ [illegible] ત્યારે [illegible]


પુરસોતમ
કી તે લખસ્યો
દેસમાં આવસું
ખ્યાલ મગાવ્યાં ને
બધી અમો આવસું
આપની પાસેન

सांई परगट हरीजनने रे.
गोरनर साप्रेम. अमृतवांणी वहे
हरीने हरीजन. हरीजनने हरी
अेपुध राखो रुदा मां धरी
श्री गुरु बोलीआ बोले तोले
अनंत अंतरमां प्रगट होहे
सतगुरु संत जन सेवनहे
सोने परेम पद पामे तेहे
डाआ डलेस साधन वेग करेम.
सत संगले जलीले परीबरेम.
॥कुं ६२ आग्या साहेब. पद ७.॥
परीप्रेम सतगुरनो जले
जे गुरु लेह पीछांणरे
ते नारा हरीजनने रे
ते हरी तन नही जांणरे. ॥२२॥

સતસંગત નો મહીમા ઘણો
પાર ન પામે કોઈ તે તણો
એક મને સેવી હરી પીછાણો.
સત સંગતેરે સાધન જાણો
સત સંગતે પાવે પરમગતીન
પરમ ગતીને પાવે હરસરી સમાંન
હર સરી સમાંને સગલે હરી જોવે
અનંત અમર જીવન જુગના સોવે
સાવધાંન પામોરે રૂસીજન.
સાંઈ સતગુરૂનો કરો જતંન.
||ડેહી સામ્રા સાંઈદા પાઠ.ક||
સાવધાંન સતગુરૂ હરી.
સાધન કરો તન મનરે.
એપુરબ્જીઈ પરી પરમની.
તેનાતુંસ જતંન રતંનરે. || ૪૨ ||

૨૨

તાનુંસ અનંત જુગની નું હોવાર.
તે નહીં પાંમો કોઈ વારં વાર.
તે એવું જાણે તે પણ આવે નહી
સાંઈ સત્તરંગ તણો સાધો સહી
શ્રીકૃષ્ણ સાહેબે કહું તે કહીએ
અનંત અન્તર તે કાંઈ નવ લહીએ
મારગ ટોલાઈ લગનો તણા.
પંથ માંહે બહુ માનઈ ઘણા.
તેને લેઈને પીર રાખ્યો અંત.
રાખ્યો સતગુર સાંઈ એક તંત.
|| તુંહી સામા સાંઈહો. પીછ ||
એક અદ્વૈત સુ ચીત રાખીએ
સહીએ લગની લગવંતરે.
અરપર નવ જોઈએ
તો મોક્ષ હોવે અંતરે. ||૨૩||

2010 Before -Satpanth Manuscript 26 (176)

सत हरीनंत. गुणगनांनी जाणो.
जपे अेक नर पुरस पुरांण
जगती पाखेरो साधेन कोसु.
गरत पाखो नेन जोनंन केसु
सांई सतरंग नेनकुरो धरीले
तेनहरी नंन साधंन सरवे करीले
हरीहोले तांहां सरवे पाले
पीलो अपरनी ओले ओपाले
हरीसतरंगे सकुप सुध होले
मुगती सारे ते पांचे सोले
॥ जुटी साखी साहेबो तपीओ॥
मुगती चार पांच सही
सतरेने सारंग परांणरे.
वली वली सतरी नेहने ॥२७॥
चोखे संत पेरनोणरे.

वलीवली अवसर नही चालीए
सांई सतारनां सरवे दुख टलीए
सतरंग तणोवीरा लेई नींत
सतगुर सांपे नीत रहे हेत चेत.
सरवे सतरंग सांई नुं करीए
आतमा जांणी देहने परहरीए.
मनकरम, वचन, काया ए करी.
सगले जांणीतने एकज हरी.
सरवे सेसटी सु सरखी प्रीत.
अनेक अंतर सतरंग केरी रीत
॥ तुही साचा सांईहो ॥ पीडीओ ॥
एन रीत सतरंग तणी.
नीरमल जगती परमांणरे.
अखंड देखांत आदर करो
ते अनीपलगती जांणरे ॥२५॥

અનીન લગની તેનું નોંમ
સોઈ પાએ નહીં ગલુ ગોંમ
સગલે જાંણે એક રેહે નોંમ
અનંત અંતર ને પરેમગેનોંમ.
સબ ઘટ જાણી સરવેને વેદો.
અનંત અંતરે કેને નહીં ભેદો
આસના સરવેસે અંતર જોતી
સબઘટ સરવનાં એકન સ્વોત્તી
બાહેર ભીતરહી એક નીવાસ
સતગરૂ સરવેજો કરે પરકાસ.
॥ તુંહી સામા સાંઈહી પીછાંણ ॥
સરવેને સતગુર કહે
તત્વેએનો મુનીંવર વીસરે.
બાહેર ભીતર વસી રહો.
જોતીસ્વરુપ કરો સરીરસો ॥
॥૨૬॥

बाहेर भीतर अेकज सांई

अनंत अंतर बुध शाखो नांई.

सब घर साहेब गेनांने लहीए

अेक गुरु ने सरणे रहीए

ताहा अनुभवते गेनांनी वाहाहेत

संसारीनो छुलल ने संत.

पुरवे प्रीत जेने नहीं होए

गेनांनी पुरसने न ओलखे सोए

परपंचताहेनेनुं रहे जेन

अनंत अंतर पणे नही हरीनंन.

॥तुंही साचा सांईहो. पीओ.॥

संसारी ते ने कहीए

जेनी परपंच ऊपर प्रीतरे

असत तेने सत कहे.

ताई गेनांनीनागीं नही रीतरे .॥२७॥

असत नेने सत करी गने हईले
तेनेरुदीले सांई नय रहे करीले
सतगर सतनंणे अरप सरीले
तो नवेन नारंण पड़ी डीगरील
सरप सासत्र कहे ए लेव.
यईनंन पुरसने आनंन देव
आतनानंणी सरवेने नवीले
अनंनअंतरना साईनो गनीले
अंतर दरसटेजुवो एकन सांन.
बाहेर दरसटीजुय अनेकन नांन.
॥नुं डी साख्या सांईहो ॥ ८ पछी॥
बाहेर दरसटी नय राखीले
अंतर दरसटीए हरी लेहेरे
ईरखा पाले सत गुर तणी.
तोलीव दरसंण हेएरे ॥ २८॥

અંતર દરસરે દરસંન નીરખે
૨૫ બાહેર દરસરે સાંઇ ન પરખે.
ગોર નર કહે ઘણું ઘણું પોકારી.
બાહેર દરસટી રહો ઓસરી.
એક દરસરી નીરંતર ધરીએ
અનંત અંતરનાં ધેન પરહરીએ
હરીને હરને. હરને હરી
વેદ વચંને વાણી ઓચરી
અનુતનારે અંગીકાર કરીયું.
હરી હર નાંનને નારે ધરીયું
॥ તુંહી સાચા સાંઇહો. પીરશાહ ॥
હરી હર નાંન નારે ધરીયું.
નારે કરીણે અંગીકાર લેહરે
હરી હર નાંનનાં અંતર નહી
તે બોલ્યો મુનીવર વેદરે. ॥ ૨૯ ॥

2010 Before -Satpanth Manuscript 26 (176)

हरी हर पय उसो नहीं लोह
अेम बोले मोरे वेद
नरनारी जगत सहु अेह
अनंत अंतर नो नहीं संदेह
नारायेण नरने वीसारे नहीं
नरनुं तंत नारायेण सही
अेक आतमाने जुजवां रुप
आपीर अेकही छे नह रुप
परना वीसनव नाहेसर देव
अेवा गतुरखअेक लोगी करसे सेव

॥ तुंहो साम्या सांईहो पीउआ॥

अेक तुरत चंग देवाई
अेकही अेक पछोगरे
त्रीगुण पली पापीआ
घट तंत करी पीछांगरे ॥ ३०॥

२५

लख चोरासी चारे जोग.
एक सरुपी सरवे जोग
कारन कारण रुप वीलासी वीं
कनक कुंडल. जल लेहेरी जेम.
फुल मांहे परमल जेम तेम.
तंतु पेजारो पट नव होवे
पट मांहे तंतु सुज होवे
तेम तीनपती सरवे जगदीस
सरवे घट मांहे एक ज ईस
॥ तुही साचा सांईहो. ॥ पीरीछा. ॥
सघघट एक गुरु सांईआ
एक अनेक न सारो
सतगुर चरने गेनां नडहे
घट मांहे अपारो ॥ ३२॥

ઘોડા માંહે પરબોધન ઘણી.
નીંદાના ડીને ડોલેન તણી.
સરવે સેસટી ને પરણાંમ કરીલે
સતગર વચન હૃદામાં ધરીલે
શુધ સતરંગ હૃદા માં રાખો.
એસા પઈને ફ્રંને ન તેન દાખો
તમતેમ દાખે અરપ નવ સરીલે.
ડાયે કુલે નીર નાલરીલે
સાસત્ર લાગનાં ના આવું ગેનાંન.
વેધી વસેડે આવું અલેમાંન.
॥ કુડી સાયા સાંઈહો પીડીજા ॥
અલીમાંન તલેરે કુનીયરો
સતગુર પારસ પરમાંગરે
હરિ હીરો વે ધીલે.
તેમહરી અંતરમાં લાગરે ॥૩૨॥

૨૭ ઘનીઉં સોનું વાટે જાણે
અનંત અંતરમાં હોટે નપાટે
સતગુર ગેનાનનો ભેદ ના લઈએ
ડરેના ફલને રે વલગી રહીએ
ભેદન જાણે સતગુરનો સાર
ખર પર ચંદન વેહે નેન તાર.
આહાર નીંદરાને ભએ નૌ પુંન.
સરવે દહીને એ જાને જાન.
તનું સા દહીનને અહદુ ગેનાન
ગીનાંન નહીં ને પસુ સમાન
||તુંહી સાચા સાંઈહો. ||પાઠ||
ગેનાન સમજોરે મુનીવરો
પેરડરવાને નં નરે.
પીર જંબ જુગની ફતે
સુણોને મુંનીવરે બંનરે. ||૩૩||

એવુ જાણીને મેનો નેન
ગેનાંન તણું તત કરો લીનેન
પરંત ગીનાં નવીનાં છુરવુ નહીકહીએ
મનેન અંતર માં રાખી રહીએ
વાદ વીવાદ ને વેસ તજીએ
એકે મંતે ગોર નરને ભજીએ
તો દીલ લાવેરે પરંત ગેનાંન
જો નેન તજીએ કુવાસા અલીમાંન
જહાંલગી કુંકુ સુવાસા ના લેસ
તેઆંલગી ભોગવે જનકા કલેસ
॥તુંરી સામા સાંઈહો પીછો॥
કાઆ કલેસ ના કીજીએ
નીરમલ કીને દહરે
વાસના સરવે છોડીએ
એક સુરીનંન સાથે નહરે ॥૩૭॥

પાસના સરવે જીરે ગલે
અંતર નાંહેનો બંધન ટલે
સત સંગને પાળે પાસના તંગ
હરીસમરણે જો લાગે રંગ.
સતગુરૂ કરી આની. જાણે લગતી.
તો અંત આવે હરી જીવંત જુગતી.
સતગુરૂ કેરી આ સત સાસત્રહોએ
સતસાસત્રી તેહેરી જંન સોએ
સાચા હરીજંન કહીએ તેને
અનંત અંતરનાં પરનારીપતંને
||તુહો સાચા સાંઈહો. || પાછિઆ||
પરનારીએ સુધ રાખીએ
તો મીલે આવે ગેનાંનરે
ચીલ ઓળખુ ચંદન કરે
તો ટલે નાહી અગનાંનરે. ||૩૫||

પરચારી સતગુરુ જોરે જલીઆ.
તારે જીવના સંકટ ટલીઆ.
સંકટ ટલે ને સંતોષે પેઠ.
તે નડરસે વેસે આલાગો પીયાર જેઠ
વેસે આલાગે રે મીલછી નેને
દુખ ની ને વરતી નાહો એ તેને
દુખ પેરવરતી ન કરને જાણ.
હરી સાથે વૈરાગ જ આણ.
વેસ સાથે વેરાગ છી નેજો
જીવતાં જુગતી નાકડી એ તેને
॥ દુહો આઆ સાખીઓ ॥૫॥
જીવતાં જુગત હોઈ રહો
તો વેસે તલો વીકારરે
જેતોન જેલા તોડીઆ
તોડરી ન પેસે ઠારરે. ॥૩૬॥

पसे आ सापे कोन नलगुंहोवे
35 ठरीठाना पेसे ठोठे
सरवे दरेन अट दरसंग जोना.
डुलनी ऊरीआओ नतलसे सोना
सासु साधन ऐक वईराग.
अनंत अंतर न प्रगटे वेग लागे.
ने आं वेराग नांहां रीधी ने सीधी.
ने आं वेराग नांहां नवे नीधी.
सउपपदारथ वईराग जोग.
अनंत अंतरनां साधन परमांण.
॥दुहो साथा सांईहो० पीछाण॥
साधन ऊरो वईरागनां
तो सऊपपदारथ होवेरे
पण वैरागे नां नवी
तो अरथ न सरीए ऊईरे ॥३७॥

વણ વૈરાગે અરથ નાસરીએ
વણ વૈરાગો ગંન લટકલા ફરીએ
વણ વૈરાગે નવ ગલે અગ્નાન
વણ વૈરાગે ન ચલે નીજ ગેનાન
વીવેક વીચાર વૈરાગ ને ધ્યાન.
સકલ પદારથ એ ચારે તાન
ચાર વાએક દ્રઢતાં ધરીએ
અનંત અંતરનાં હરીને વરીએ
સરવે સાધનનાં મુખ્ય વીવેક.
ને પી ટલીએ અગનાન અનેક.
॥તુટી સામા સાંઈહી પછી॥
અગનાન ટલે સત ગેનાન થી.
ગંજ પાંચે અસીયેત ડંતારે
દેનતાઉપને ઠીરી ॥૩૧॥
કામ કરોધને ડંતારે.॥

૩૧

આપે તંતને ઝવીસ્યેલ ડોળ

નક્ષીપને ઊરી ક્રોધને ડોળ.

સત ગેનાંને તે. વીવેક ઊપને

તારે તંત કુ લક્ષણ તને

ગેનાંન ભ્યારપે અનુભવ લહીયું.

તારે તંતરે કુલપીત ગલીયું.

વેસેવા સના કરીલે લે આગ.

ધરીલે લગની. તીવર વૈરાગ.

તંતને જીતવા માહે નેહ.

અનંત અંતરે કરવું તેહ.

॥મુંહી સામા સાંઈહો. પીઊ.॥

વલીવલી જુવો વૈરાગને

સાચી લગની છે હરે.

વણ વૈરાગે પર નહી.

મુંનીવર લણો તેહરે.॥૩॥

પરંતગેનાંનની ગતીતાંનદરીલે
પરંતગેનાંને વીચાર કરીલે
પરંત ગેનાંને. તંનપેર પાલે
અંતરમાંહે નથી ચીન્હે ઊપાલે
પ્રણાયા એતનું ડરે ને ધે આંન.
સંતજંણ માંહે આવે સમાંન
જેને નીત નીત સતસંગ વીચાર.
અંતરમાંહે તંનપાંરો ન સાર.
દેહસુભાવ ભાગી પેરે ટલીલે
જેતેન આતમા મેલંન જલીલે.
।। તુહી સાચા સાંઈહો. પીઠજ ।।
આપણું આપ મીંનેનહી.
કરે અપસુ પ્રીતરે
તેકદી ના હોવે આવલે.
ગોરનરસુ રીતરે. ।। ૭ ।।

૩૮ તીનર લેહની અવેહા અરી.
તેગે બેસે તેન ઠાંગણ ઠરી.
તીનર લાગેરે વાસના લેગ
નીરચરત પાંજેરો સગલાં અંગ.
શ્રીગુરુ સવાંનીરે કહેછી એહ.
તીનર સંગતે પુરસ વહે.
એ લખસંગ રૂદાતાં ધરીએ
અંતરતાં હેપી ધેન પરહરીએ.
પુરે લાગે મુંની વર લહીએ
શ્રી ગુરુ સવાં ની એતન કહીએ
॥ ચુંઢી સામાસાંઈ લો ॥ પઉ ॥
શ્રી ગુરુ નારાએણ કહે.
અરેજ ગેનાંન ગુરુ વાગરે.
સબ ઘટ સાખસી લેકછી.
તે આદ અંત નારાએણરે ॥ ૧ ॥

नारालेगे परस्ताने कहे गेनांन

आद अंत नाद गुन ने बोल

अेअनु लवन अेत्रनां आेग.

ते परेलगत अेलही नारालेग.

परनाले नारद ने कहे गेनांन.

पांआ देवकसीवर नीधांन.

नारदे वीदर वेआस ने कहुं.

गंनीवरनुं गांन परसंन दयुं.

वेआसे सुखजेने कहे ते वार

लेले जयनारे पआ आधार

॥इती आद्या साईहो. पडीओ.॥

जय पांडु कुडाले सदा

सुखजी लहे गेनांनरे

नेनक पदी पर पांतीआ.

प्रेन गीनांन नीधांनरे ॥४२॥

सुजाणे परीखतने करो ऊपदेस
।।३८।। टाळा तेना करेन कलेस.
सुणतां लागती प्रेम गेनोड.
पाम्या पद परीखत नरवाण
तेणे प्रेम गेनांन लागती लही
अंतर मांहे तेने जुगतीज सही
अनेक गेनांनी ने रांम राटे
हरीपद पोताने गेनांन पसाये
धेन लखनेरे हईये धरीये
तो खेल अवतारी पद लहीये
तुंही साम्या सांईहो ।। [illegible] ।।
हरीपद लेहे कोई वीरला
सतगुर कहे पोकारे
जे सतगुर सरणे नेचारहे
तो पंतज आवेढारे ।। ३ ।।

જેઓ લગી દૈતનો ભાવના રહીએ.
તહાં લગી જીવંન મુગતી ના લહીએ
જારે દૈતનો પાલટે અંત.
તારે અંતરમાં મુકાલે જંત
અંતર દરસંને અગનાંન ટલીએ
કાંમ ક્રોધ માઆ પરહરીએ
સતરંગ અંક ગુરૂ નું કરીએ
એકજ ભાવ નીરંતર ધરીએ
એકજ આતમા સરવ સંસટી જાણે
આપ એકેરે કેવલ સોહે
||તુહી સાચા સાંઈહો. પીઆજી||
અંતર ગત ભીલટી કલા.
સાધો જાંણો કોએરો
કીરપા પાલટે સતગુરૂ તણીં
તોતતજાણ દરસંન જાણેરે. ||૮||

४०

सरवे आतमा अंतर नही आंन.
ओतंम लगनी हरसदी सचांन.
सतगरु चरणे गंगा ने नेन
तेनडुरे पेसे तणुं आय रेन.
हीनो लगत तो ओतंम सही
तेने पेसे पेसतातो नही.
तेने चहाला हेर नही श्री रंग
ते सासत्र गेनांन तणो डुरे लंग.
वेद डुरंता सगलां आपरे तेह.
फल ओडाखो देहपरहरीट लेह.

||तुंही साचा सांईडो. पीअजा||

फल अहंडार नींदीर पणुं
अेअंध अगनांन नु जुलरे
आसा त्रसना जुगत नही
ते संसे गोट जुलरे. ||४५||

સતની લગની એકમ નેહ.
દેવ દરસરે નેનું દેકેન તોન
પરતીવંતાની પેરેન સોહે.
દુજો વેસેઆ કાહે. બુધ નહોવે
પરતીવંતા પરવારને નરો
તે સાધવી લરપાર ને ગજે
એક સતરીએ કેનો હોવીસન કરીએ
તોસીને પાલા લવનારંગ તરીએ
સરવંગ કીરતેન સતારંગ સેવા.
અરચંન વંદન દાસ તવ તેવા.
॥ કહી સાખા સાધિકે. પીછે ॥
સાત પરકાર ઊપર કહા.
સુગલે ગુનોંવર દેખાંતરે
જે પ્રકાર પાછલ કહુ.
તે નધા લગની નીદાંનરે
॥૩॥

સંખ્યા લાવ આલંબ ને વદંન.
એ નવધા ભગતી રાખો તેન.
અનેક પ્રકારે ગોરનરને ભજીએ
ફલ અહંકાર ને વાસના તજીએ
તેને ગોરનરસુ નીરંતર પ્રેમ.
તેને ગોર નર આપે જોગ ખેમ.
જોગ ખેંમેરે લેંગન રહીએ
જોગ ખેમે મન સાંઈમાં લલીએ
જોગખેમેટલે જનમ મરણ
જોગ ખેમે સીતલ અંતસ કરણ.
।।તુંહી માયા સાંઇહાં પીઉ।।
જોગ ખેમ પાલે સદા.
અનુભવ લીઆ અપારરે
તેનો અરથ આગલ કહું
સુણજો મુનીવર સારરે ।।૮૭।।

જોગ જોગ સંત બુદી પરકાસ.
જોગજોગ તેજનો નહીં નાસ.
સંત બુધી ચરપેરે જોગી જન.
આમરે અનેક તેજ સાધન.
અનીંત લાવે સીસ હરીને નમીંએ
ગોરખ દેખાપા પીરીને ગમીંએ
આપો સંત બુધી જુગતે અંતરજામી.
ગુલાંમ અલીતો કરે પરનામી.
સ્વાંમી સેવક અપરાધે ભરીયો.
અસરણ સરંણ તોરી સરણે રહીએ
॥ હુંરી સાચા સાંઈહો. પીરી.॥
અજંન અંત્રમાં સ્વાંમી સમરંન.
રહેઅહો નસ જાગરે
ચપ તેનો પ્રેમે કરી આ.
તે અંતરમાં પીછાણરે ॥ ૪૮ ॥

४२

સરણે આવે તેની રાખો લાજ
દાઆ ડરો શ્રી નકલંકી રાજ
માગુ નહી રીધી સીધી ને લોગ.
માગુ એક પરનારપ લોગ.
હે લખ સ ગુનને આપો સહી
એક સાંઈ વીનાં દુજુ લાસે નહી.
કરૂં વીનંતી કેરલી કપી
સેવક તણું કાંઈ ચલન નથી
આપ રહીંગતે રેહેમાન કરસે
અનઅંતનાં કારન સરસે.
॥ દુહો સામા સાંઈહો. પીઠ.॥
કારન સરે સતગોર પણી.
તે અનંત અંત્ર નાં રમીરે.
પ્રેતે સાંતલવું નંનતે
આરસ કરા નાં માઅણો॥ ૪૯॥

સફલ તનખારે જનમનેરે.
બાહિર લગતી અવરપા તેહે.
ગુલામ અલી કહે સાંભળો નરનાર
ગોરનર અલી કહે તે વારેવાર
વેદ સાસત્ર ગેનાન એનજ બોલે
ગુરનું સમરણ રાખો તો રહીઆબોલે.
બાહિર તીત્ર એક સાહેબ સહી
સાંઈથીનાં ખાલી ઠામ નહી.
સબઘટ સરવમાં એકજ સામ
અનંતા અનંત અંતસ કરણ નામ.
॥દુહો સામા સાંઈહો- પીલ ॥
અનંત નામ રૂપ અરૂપના.
અનંત અનંત્ર અપારરે.
અનંત લીલા હે વેસનરી
તો અનંત લોમેન નીરધારરે.॥૫॥

સબ ઘર નાહી રહે. સરવનાં દેવ

સરવનાં વીસ નવ જાણો અરુપ જોય

બાહેર લીચ મરામર વીસનુવ.

જે ષડી મેલ નરનલ વીસનવ.

દાતા ભોગતા અહંગ અલી સહી.

સહીદ ગુલાંમ અલી તો બોલા લેહી

રસો સવર કાંના રાખો ગંઠ

નહી નહી અલીવીનાં કોઈ અંત.

એક અનેક અનેક જલી એક.

સાચ્યો સાંહી આ દેહે વીવેક

॥ તુ હી સાચા સાંઈ હો પીર.॥

સોહંગ વીસનવ સાચા અલી

સોહંગ લીલા અનંતરે

સોહંગ ત્રણ અખ્સર રૂપ અરૂપના

તેનો પેલો સંનજો તેનરે ॥૫૫॥

लगलीअेकने लेहत बहु
आदअंत नाद जुगली केहु
बाहेर लीव लेत सरेवे ध्रेन
संगजी संगजी बोलेबो नरेत
सोवण अेकनो आलु संगअेपारे
सरेवे सोवण लागो नीरधार
देव मानुस अती कारन बहु
केवल वीसनव परंत लागेसु
अे परबुध अंतर गात धरीले
सरेवे सेसट सुहेत आचरीले
||तुंही सा म्या सांईहो पीछाणु||
अनंत अछेद अपनारगल
पावर नंगत केपरे
आद बरता. स्त गुर नबी. ||५२||
वीसनव अली सव केपरे || ५३||

४४

वीसनव ऐकने हैडे धरीऐ
सत गुरु प्रभुघने मंत्र करीऐ
सतगुर प्रभुघने सीखीऐ सुणीऐ
सतगुर प्रभुघने परेने लागीऐ
संतो गत हर गेनां नवी मारे नेह
संसार बंधनथी छुटे तेह
संसार समुंदरनो थाहा अपार
सत गुरु प्रभुघने नावन सार
इस घात अनुं लप से नेह
सुखे परेनापर पांमसे तेह
||इती सत्या साखीतो: पीरजी||
मुगत मारग अली प्रेमपर
मुनीवर संताओ डोलेरे
अंतर दील आदर करो ||५३||
मनीरखल तनतांनहोलेरे

વીસનુવે આપે બોલાવીઊ જેહ.
સહીદ ગુલાંમ અલી તે લાગું તેહ.
તીનીસ નામ સતગુરૂનો દાસ
કરતા હરતા તે શ્રી અવીનાસ.
ધરંમ ગેનાંમરે કહી સંભળાવું
મંત્ર તાહેમારે નીરમલ થાવું
નીરમલ થઈને ધરવું ધેઆંન
એક મને જોણવું નીરાકાર ગેનાંન
સાધ સંતને નીત વીચાર કરવું
તેને ગુરૂ વચંનને ચીતે ધરવું
॥તુંહી સાચ્યાસાહેબ।।પીરજી।।
સત સાધંન કરજોધવું
વળી સુંણીએ સતગરૂ બોધરે
સતરંગ એક ચીતે ધરો ॥૫૪॥
અનેક અંતરમાં સોધરે॥

ગરેપ સપુરણ ગાહા નીરાસ.

વેરાટ નગરનાં ડેરો પરકાસ.

અનંત ઓલખ્યા કારણ નાટ.

રહીલે પાસ નગર વેરાટ.

અખર પાવેન ને સુન પાવેન.

નરો સંનઝો દીલ મંત્ર જંત.

માગસરે સત ગુરથી જાણ.

દેવાદસ બાંધો નીપી પરમાણ.

સુકલ પખસને મંગલ જાણ.

સરધાર માંહેથી લીધો પરમાણ

।।તુંહી સામા સાંઈહો પીરીજા।।

લીધો ગ્રંથ સરધારથી

અનંત આવાં ને વેરાટરે

કોઈક સુરા સનાજસે

સનાજસે સિરને સાટરે ।।૫૫।।

realpatidar.com

૨૫ શ્રી. જંજાહરઃ ગેનાંન સંપુરણછો નુંની
પરન પરનાંગે ઊનારો કરોછે. લખીલંગ.
લલુ લાઈ દેવજી લાધી: લુલસુક સુંધારી
વાંચશો. જે વાંચે તે ગત નુંનાં કુસલાંજાછે.

શ્રી દોવા. અલીની અરજી લખીછી॥
બીસમીલા. હરરેહેનાંન. નર રહીંમ.
ઈઆ સાહ અલી॥૧॥ સેહેરે અલી॥૨॥
સાહ અલી॥૩॥ નરદાંન અલી.॥૪॥ પં
જાઆ અલી॥૫॥ આખર અલી॥૬॥ અવ
લ અલી.॥૭॥ આગે અલી॥૮॥ આધારે
અલી॥૯॥ ઓધારે અલી॥૧૦॥ અના સે
હેલાંહાં આવે અલી.॥૧૧॥ આ આરે અલી.

॥१२॥ ओछी नन्दे लागे अली ॥१३॥
अरने अली ॥१४॥ आलार अली ॥१५॥
अजेन्त अली ॥१६॥ अजरदपे लाहो आवे
अली ॥१७॥ अगारे अली डाध्यास ॥१८॥ अ
टोरे वरंगनो चापडे अली ॥१९॥ डोईनाले
णे अली डीगली ॥२०॥ आंगचल लोहा आ
वे अली ॥२१॥ आतंन अली ॥२२॥ अरपे अली
॥२३॥ आपे अली ॥२४॥ सापीलले अली ॥२५॥
आखेटे अली ॥२६॥ अन्तर अली ॥२७॥ आ
हारे अली ॥२८॥ आहाले अली ॥२९॥ आवे
अली ॥३०॥ आसाहाने आवे अली ॥३१॥
हेआमे अली ॥३२॥ असीवे अली ॥३३॥
वसीलेपी नाटे अली ॥३४॥ ठीनोदे अली
॥३५॥ ठीन्नो अली ॥३६॥ डुपगे यांबा ॥३७॥

रुपे सो अली ॥३७॥ अेवर अली ॥३८॥ अप
४७ डदार अली ॥३९॥ अलागोडीने तारे अली
॥४०॥ अेने आडेरे नोहो आवे अली ॥४१॥
अडाई पी नासे अली ॥४२॥ अेक नुरे
अली ॥४३॥ परवसे अली ॥४४॥ डरीआ अेज
ली ॥४५॥ केसारीटे अली ॥४६॥ हसाणीटेवी
असे अली ॥४७॥ अेनीं ताके पास आवे अ
ली ॥४८॥ अरथ लोनाकु धावे अली ॥४९॥
नांहों नहीं आवना अली ॥५०॥ आडारे अली
॥५१॥ अलीका गेयां नबीयारो ॥५२॥ अेथि
र अली ॥५३॥ अलीडा लेहलनावे ॥५४॥
आगे अली ॥५५॥ अलीकी अरज नांहे रे
हवे ॥५६॥ अेघर अली ॥५७॥ अलीडा आस
न बुजे तो सबकुछ सुजे ॥५८॥ बुजपडे नो

સબ દુઃખ પાવે ॥૫૯॥ દુખ હાથી દર લાગ કર
જાવે ॥૬૦॥ અંતર જુઠ નીકાલ કર દેવે
॥૬૧॥ સાચ કર બંદગી કીજે ॥૬૨॥ તો અંત
ર સુખ બડા પ્રેમે લીજે ॥૬૩॥ સુખ બડા હોવે ॥
સબ દુખ જાવે ॥૬૪॥ જે સુને આ સંતકી
રાહા ॥ તો પાવે અંતર અલી સાહા ॥૬૫॥
પેલી કીલી હીરૂ તનનીકીજે ॥૬૬॥ એ અલી
હૈ અંતર ઘરમાં રહીજે ॥૬૭॥ દુજી કીલી
દાદા દુર ॥૬૮॥ અંતર અલી કાયરસે જુર ॥
॥૬૯॥ ત્રીજી કીલી તનપાકી સાકી ॥૭૦॥
જો અલી પાસે રહેતન લાગી ॥૭૧॥ ચોથી
કીલી એક મંતે ॥૭૨॥ પાંચતી કીલી પાંચ
વાની ॥૭૩॥ આસ રાખીને કીજે જાનેલા ॥
॥૭૪॥ છઠો નાકોલ કરારને પાયો ॥૭૫॥

2010 Before -Satpanth Manuscript 26 (176)

सातवीं डीली हरसंनदेश्मांन ॥७४॥ नो अनार
अलीडा चीचारो गे यांन ॥७७॥ नोईदे आसेन
दे ३ ईनांन ॥७८॥ आसेन अंनरडीनो वस.
॥७९॥ नो आसराम नो पासेछु ॥८०॥ दुम
नवे. दास्तीदर नवे ॥८१॥ तुनडा लीलर नांनु
॥८२॥ सेनांनडा सीर ठीगठीं ॥८३॥ चीरडु
नेहन डडू ॥८४॥ नोलीडु नाम नुत्रनांगलुं
॥८५॥ योडीडी चोडीनो नांगु ॥८६॥ तुगाडरे
ठीसे ठीला जाण्युं ॥८७॥ पाणना रहेवे ॥८८॥
अंतर पाशना ॥८९॥ अंतरनलना ॥९०॥
अंतर होनड ॥९१॥ अंतर लोना. ॥९२॥
नरवडे आगो नीन ठीठाठी ॥९३॥ सीडोन
दु सांड लपीनाठी ॥९४॥ दुलपलानलता
सत होवे ॥ ॥ अपडी अरण ॥९५॥ अली
डी आग. ॥९६॥ संतारी अरण सप

દુખ લાન્યું ॥૯૭॥ સંતારો અલીનાહોવે

નોહોન ॥૯૮॥ અરજી ઊપર લાવો ધ્યાન ॥

॥૯૯॥ જીવતાં અવતરીયા દિયાંન ॥૧૦૦॥ સં

તારો અરજ અલીએ કે ઈમાંન ॥૧૦૧॥ ઈમાંનસે

આવે ॥૧૦૨॥ અલીકા લેદ પાવે ॥૧૦૩॥ એક વાર

જાંચોતો ઈમાંન રાખો ॥૧૦૪॥ દો બેર જાંચો

તો કુલ દુખ લાને ॥૧૦૫॥ તીંન બેર જાંચો તો કુલ

બલા ટલે ॥૧૦૬॥ નીરભે રુદો કરો તો અંતાર

પાવે ॥૧૦૭॥ અરજ અન્તારી ॥૧૦૮॥ કુસટીલ

તો આવે અલી જો ચારી ॥૨૨૨૪

તારી ॥૧૦૯॥ રાખો નારી ॥૧૧૦॥ તો જીનો અન્તરા

પરી સારી ॥૧૧૧॥ ઊઘડી બારી દવા દુરકરારી.

॥૧૧૨॥ ઈકોતેરસો પરીઆં તારીયાં ॥૧૧૩॥

નાસીન્તો હોને તારીયાં ॥૧૧૪॥ પાંચલુતનેપારી.

॥૧૧૫॥ કરનો અલીની ઈ પારી ॥૧૧૬॥ કરનો

અલી નીં ઊવારી ॥૧૧૭॥ અલી નલી અલાસાચ્યા

॥१२०॥ हे खुदा तुहुं ॥१२॥ हक लाइलाह ई
लल्लाहो मोहंमद रसुलुल्लाह ॥ अली
नी अरज संपुरण छी. लुबहु कसुधारी चोपसीर

अथ. गेनान. ॥ नेगवांणी ना लखां छी ॥ श्री ॥ स
तगोर ईमांमसाहावाचा ॥ आदे पढी अेक सुन छि
पाया ॥ तारे सुनमां सबद सभायया ॥ गुदरापेहेरी
नेमेन वसनहीं ॥ तो नरके जासो नीरवांण ॥ रे नेगेस
री ॥ तो नेगनाअमरंम ना जांणो हांजी ॥ १ ॥ अनाप
ऐनानाप अने अंदरो ईमांमसाहा ॥ अने अलेमनी
रंजनना चेला हांजी ॥ तमुत चोषीने पांणीपणवे ॥
पणसीद्द ना सबद नाजांणोरे ॥ नेगेसर ॥ तो नेगना अ
रंमना जांणो हांजी ॥ २ ॥ सींगी वगाडोने डानने फाडो ॥
पणपरंम अेमर नाजांण्यो ॥ जटाव धारेने नेग

न नासाधे पण जुगलना नरंजना जोगी ॥रे जोगेस
रा पण जुगलना नरंजन नाजोगी जी ॥३॥ जंबुद्वीप मां
साहा तारे लख्खत रमावा ॥ तो सेसटीना सुरीजन हारा
जी ॥ तेरे गोर जोगी तेतनो आधार ॥ जेणे त्रण त्रीलोक
तडी धारे ॥ जोगेसर ॥ तो जोगना नरंजन नाजोगी जी ॥४॥
अडसठ तीरथे परबतने नीर ॥ तांहां नहीं नीजोग
पाले हां जी ॥ अेन जाणे अेहडे छत्रां नसाहा तने
सुणो तारा जोगी ॥ अंतने जलोता सांसा रला ॥ रे
जोगेसर ॥ तो जोग नानरंजन नाजोगाहां जी ॥ ५ ॥
॥ ः ॥ श्री गेनान बीजो जोगवाणी ॥ २ ॥ श्री
सतगोर बरम्ह्यावाच्या ॥ लील वरण धुंधुकार जोहुता
तारे तेज सते अतेहुता हां जी ॥ अेहेद रूपे अतो अंद
रे छत्रां नसाहा ॥ अेवधे नरंजन नासाथी ॥ रे जोगे
सर ॥ तमे जोगनी जुगत ना जाणी हां जी ॥ १ ॥ अेच
ण कुरम आगे चतप जाणो ॥ चोथी आद सकत अप

२ तारी हांजी ॥ जंबुदीपमां तजो दरसंग हेजो ॥ जे
पी पावंन पाटे ॥ रे जोगेसर ॥ ता जेगनी जुगतना
जाणी हांजी ॥ २ ॥ आवागोर नरे नराने सतपंथ आ
पा ॥ पणसांभल ले जेजीवनी साथे हांजी ॥ तीलर
पोने ते अतोने बुजे ॥ आवागवंनना फेरा टले रे
जोगेश्वर ॥ तो जेगनी जुगल ना जांणीजी ॥ ३ ॥
धरती पातालने सेन सरगपोरे ॥ अने ऊंताधरी
ने ऊपनां आवाजी ॥ जांहांलगी नाथ ने अनाथनी
वासा ॥ तांहांलगी तने पासो फेरा रे ॥ जोगेश्वर ॥ पण
जेगनी जुगल नां जांणीजी ॥ ४ ॥ ईजांनपुरी नगरी
नां अलेख धणीरहेछे ॥ तेने छत्रीसपंथ सहु जाणेजी ॥
गुजेरे पाजी ॥ तने जंबडेरा कीजो ॥ पण ओणे करतब
ना नींजोड ॥ रे जोगेसर ॥ जेगनी जुगतना जांणीजी ॥
॥ ५ ॥ अजाणे कुरसने आदे जेगनाया ॥ तेने देके
ऊरीने जांणोजी ॥ अेमतणे अंदरे ईजांनसाह.

तेने सुणो जाराजोगी ।। अंगने सेवे ते सरग
पांमे ।। रे जोगेसर ।। जोगनी जुगत ना जोगी होज ।।
।।४।। ❁ ।। श्री सतगोर बरमावाचा ।। गेनांन ।।
।।ॐ।। अधोत सरूप नीरंजन जागीए ।। मेत्राणे जु
रतलकु डीरनारो ज ।। गगंन मंडल मां आसंग लागीए
अजा अलर धरीए धेआंन ।। रे जोगेसर ।। पण जोग जो
गेसर जनाओ होज ।।१।। धेआंन धरो धरी नाहेसर
जोगी ।। जेणे पंडने ब्रह्मांड एहु कीधा होज ।। जु
डजुगआने जुगतना पाआ ।। तेनरके पडसे नरने
नारी ।। रे जोगेसर ।। तो जोग जोगेसर जनाजो होज ।।
।।२।। सतपंथना सुजोने तरंजनापुजो आसा
तसना नाजुईहोज । अेईडनां अधारे आलंग
सरज ।। ईडवाल कोई नाहुतारे ।। जोगेसर ।। तो
जोग जोगेसर जनाओ होज ।।३।। तरे दहाडे अ
ना आपजेहु ता ।। अजे अलख पुर सघरु ना हांज ।।

3 તેરે દહાડા નીં તજો ખબર ના પાઓ ।। પણ પડસો
તે આરે આંગ ।। રે જોગેસર ।। એવા જોગ જોગેસ્વર
કરાઓ હો જી ।।૪।। આવાગવેન આવોને અરથ ના
પાઓ ।। પણ ફેરાણ પડતાં નહીં લાગે વાર હો જી ।।
પ્રાણી નો અરથ ઉજનાસી જે ।। તજો સતપંથ
ગુલ નાલાંણો ।। રે જોગેસર ।। એવા જોગ જોગેસ
ર કરાઓ હો જી ।।૫।। ગુલના લાંણો ને પરલગ પ
રજાણો ।। ઉપંપનતજો કયાંથી પાંજો હો જી ।। જેણે
તંતને જોગ દખાડો ।। પણ તે છે અતારા મેલા ।। રે
જોગેસર ।। એવા જોગ જોગેસર કરાઓ હો જી ।।૬।।
તે ચરણ પખાલેને આગળ ચાલે ।। પણ તેહોને
ઘરેના અને આપા હો જી ।। એ પીરના પીછાંણો ને
આપ તત જાણો ।। તેને પડસો અંધકાર ।। રે જોગે
સર ।। તો જોગ જોગેસર કરાઓ હો જી ।।૭।। દુધ
જીવસન આપો ઉપદેસ ।। આસા ત્રસના ના

કુઈ હાંજી ॥ તેજલ નાજુકોને જોગદે આંન સુકો ॥ પે
ગંબેઈ તાંની પડસો બાદા ॥ રે જોગેસર ॥ એવા જોગ
જોગેસર કરાઓ હાંજી ॥ ૮ ॥ એજે નવ નાથને ચો
રાસી સીધ સંતાવા ॥ પણ સાહેર સતપંથનાં સરવું ॥
હાંજી ॥ એ પીરને પેગાંબર તજો પરતગ પુજો ॥ જેથી
રહે જીવની જંજાળ ॥ રે જોગેસરો ॥ એવા જોગ જોગે
સર કરાઓ હાંજી ॥ ૯ ॥ એ કરતવ ખોટાંને પાછેઈ
તોટાં ॥ પણ તોટાઈ ઉ જરંગ નાપાઓ હાંજી ॥ તા
ગીઆવુને વઈકુઠે જાવું ॥ એ દોદો આનાં નાહેરો ॥
જોગેસરા ॥ એવા જોગ જોગેસર કરાઓ હાંજી ॥ ૧૦ ॥
આડામી છેડાઆને ખોટીઈ તાઆ ॥ તેને તરનાં
નહીં લાગે વાર હાંજી ॥ સબદ સાઆને પંડછે કાયા ॥
પણ કોણ કરતવ પીજવ છુટેરે જોગેસર ॥ એવા જો
ગ જોગેસર કરાઓ હાંજી ॥ ૧૧ ॥ સતપંથનાં ધાવુ
ને પાપ નીવારણ પાવુ ॥ પણ નીસદીન જપેવું સાસ

ઠીસાસે જી ।। ટેઈનાંને લગલીને જીવોનીં જુગતી
પણ જરંણ નરંણ નાલે લાગા ।। રેજોગેસર ।। એવા
જોગ જોગેસર કનાઓ હોંજી ।। ૨ ।। એત્રણે ગુરનઆ
ઈ જોગનાઆ ।। તેનેએક કરીજાંણોહોંજી ।। એનલણે
ગોરઈ નાંનસાહા ।। લનેલારપે ગુલા. પણ જપ
તપ જોગ તને જગો ।। રેજોગેસર ।। એવા જોગ જો
ગેસર કનાઓહોંજી ।। ૧૩ ।। ॐ ।। શ્રી સતગોર
બ્રહ્મા વાચા ।। ગેનાંન ।। જા જોગવાંણી ।। ટેબં
બહોતા ।। નારે બ્રંન નાહોતા ।। તારે બંબનાં બંબ સ
નાઆહોંજી ।। આદે પી ઊપનાને અંતે સનાઆ ।। તે
વણે બાંધી જુરાંણીં કઆ ।। રેજોગેસર ।। જોગી જુગત
વીનાં જુગત નાહોએ હોંજી ।। ૧ ।। જુગત નાજાંણે તે
જોગસુ પરનાંણે ।। પણતે તેન નાંહે પી જોગનીપાઆ
હોંજી ।। આસંણ વરતીને જોગસુ ધરની ।। તેસરજાનો
ગી જુગતને ધાઆ ।। રેજોગેસર ।। જોગી જુગત વીનાં

જુગત નાહોલે હાંજી ॥૨॥ જોગી જુગત અનેરીને
ઝાલેરે ઘેરી ॥ પણ કરોધે કે તનાસુઝે હાંજી ॥ પણ
બંબ વીસનારીને બરહ્મનો કીધા ॥ તે બંબસુ બ્રેતકી
પાઆ ॥ રે જોગે સર ॥ જોગી જુગતવીનાં જુગતનાહો
એ હાંજી ॥૩॥ બંબજાહે એક નેન સતાયા ॥ જુ
ગતવીનાં જુગત નાહોલે હાંજી ॥ ઈશ્વરને આરા
ધોને જોગ નાસી ॥ પણ સીંગી ફુંકે સુન હોલેરો ॥ જોગે
સર જોગી જુગત વીનાં જુગત નાહોલે હાંજી ॥૪॥ એ
કરણીં નાઝ્યા ને વીદ્યાવાયા ॥ તે પડસે સુંનકારહાં
જી ॥ એ બરંતના લેહને પુજે ઊપવેદ ॥ આગે અરપ
જ્વોનાપાલે ॥ રે જોગે સર ॥ જોગી જુગતવીનાં જુગત
નાહોલે હાંજી ॥૫॥ સુંનકાર જાહો ધ્યાન ધરીને ॥
એ ધરંત કરેત બહુ નીપાઆ હાંજી ॥ કરેતની પાલોક
લજુગને કહીએ ॥ જેણે આધરે કપતાંને બાપ ॥ રે જો
ગેસર ॥ જોગી જુગત વીનાં જુગત નાહોલે હાંજી ॥૬॥

ऋ सत पंथना सेवा ते पारधीने वा ।। तेने पडसे से
५ सत्र पमासनो मारग ।। ए माणो खावु ने नीरपेना
हावु ।। पण जछली रहे पाणी माही ।। रे जोगेसर ।। ते
जोगी जुगत वीनां जुगतना होए जी ।। ७ ।। जेत
वीनां जोगी नजे ते ग्यो आ ।। पण तरंग जीवंग
जुपनी सापेण ।। आज उपावाराना पुरुसने ते
सेवोरे जोगी ।। पण सुदबुद नाहानार ।। रे जोगेस्वर ।।
जोगी जुगत वीनां जुगत नाहोए जी ।। ८ ।। पण जुग
त जाणे ते पार ने पीछाणे ।। अने उपाधरीने
उपजां आवा जी ।। जाणे अंदरे ईदरे ईजां तसाहा.
तेने सुणो वारा जोगी ।। तेने हाल रजीन लस ना
ने पा ।। रे जोगेस्वर ।। जोगी जुगत वीनां जुगतना हो
ए जी ।। ९ ।। ०ः०ः ।। श्री गेनान ।। ५ ।। जोगवां
णी ।। श्री सतगोर पत्रना वाच्या ।। करे ते करी करी के पा
जे पेहेरी ।। पण फोगट जसो जुगने फेरा जी ।। अंगस

जीगं जनीं जुगतो जाणंगे ॥ पण जरेण तरेण
पउसे बेरा ॥ रे जोगेसर ॥ पण जेत जणे सोहीनर
जोगी. हंजी ॥ १ ॥ जे दहाडे रुंन नाहोता ॥ ने सबद
नाहोता ॥ तारे नाहोता पंडने ब्रह्मंडजी ॥
जलनाहोताने कमल नाहोता ॥ तारे नाहोता जो
हौने नाथा ॥ रे जोगेसर ॥ पण जेत जाणे सोहीनर
जोगीजी ॥ २ ॥ जमीं नाहोती ने आसमान नाहोता
तारे नाहोता जोहेर ने कपला सोहंजी ॥ पण तेणी
वस अने आपो आप हुता ॥ अने जुगत जुगत बे
ऊ कीधी हो जोगेसर ॥ पण जेत जाणे सोही नर जो
गी जी ॥ ३ ॥ ते वारे प्राण तांहे हेत धरीने ॥ अने ऊ
तपत पींड पेदा कीधु जी ॥ ए पींड तांहे वी छा धरीने ॥
अने नर ने नारायण बेऊ कीधा ॥ रे जोगेसर ॥ पण
जेत जाणे सोही नर जोगी ॥ ४ ॥ अने सत धरी
ने संसार कीधो ॥ अने आपा अनंपा जपो ॥

2010 Before -Satpanth Manuscript 26 (176)

५ जेणे तमोने सतपंथ मां सरना ।। तमे ना ओळख्या
नरनारायेण ।। रे जोगेसर ।। पण जोत परकासे सोही
जोगी हांजी ।। ५ ।। पण जुगत जुगत जेहु वचे तेन
छा दरीने ।। अने दरेसन ने करेन जेकुकीधां जी ।। पण
करेनादरेन वचे करेना करीने ।। अने चारे जोगपे
दाकीधी रे ।। जोगेसर ।। पण जोत जोगे सोही नरजो
गी जी ।। ६ ।। जां हां सुधी नापेने अनापे नपी जला
तां हां सुधी परांणीनो जरप नहीं पाए हांजी ।। जो
गी तेने जवने आधारो ।। पण करेना धरेमकांईना
सांगे रे जोगेसर ।। पण जोत परकासे ते जोगी ।। ७ ।। अ
मे छत्रीस पंथने जांगाटो ।। अने अंधा अपेगया
जी ।। मे कलप करेण आगे जेकीता ।। तेनां गाहेस
रे कुकीडी नागा ।। रे जोगेसर ।। पण जोत परकासे ते ना
र जोगी जी ।। ८ ।। मे नरेनननाते नेन नंदनांहेवी ।।

ए त्रण गुरने ईछा धरी हांजी ।। ए नरने परसा
द नरेनंन लागीए ।। ए त्रेण गुरनने ऐक डीरता
शो ।। रे जोगेसर ।। पण जोत परकासे ते जोगी ।। ए
तेवा गोर जालालो पालग तजा. त्रीलोक नतारेण
आवा हांजी ।। तेरे गोर जोगी तनाने नवी जसीआ ।।
पण जाओ ना वांधा जार व्यासो रे ।। जोगेसर ।।
पण जोतपरकासे ते जोगी ।। २० ।। ए गुरत सरजने
संसार नीपाओ ।। सुध बुध नाधा तार जी ।। अने तल
ण अंदरे ईतां नसाहा ।। तने अने आदपुरसपी
आवा ।। पण अंजने सेवो तो सुध पाओ ।। रे जोगेस
र ।। पण जोतपरकासे ते जोगी हांजी ।। २१ ।। ०००

गीनांन. अथर वेदी. के जरे लाईनां: ।। के जरे
लाई सतगोर लेटा तेनाने मादरगा हुवा ।। ने

ગોરે આપણે ઘરેન દેખાડ॥૧॥ કે જરે લા
ઈ॥ગોર ઈશ્વર આગે ગોરીખ સીધા॥ પણ ગોર
વીનાં કોઈ નાતરીઆ.॥૨॥ કે જરે લાઈ. પાંચ રલેન
સીર બેલી રહીએ॥ તો ગોરજીનાં જુગતી નાલઈએ॥
॥૩॥ કે જરે લાઈ-આલપીર સંજાસનો તેણ સાચી
કરી જાંણો॥ તો એણી આલે ગોર બરતાજુ આ
વા॥૪॥ કે જરે લાઈ આલપેડીને જુકર પડીઆ॥
તેણે ગે આફલે બનેતા હરાવા.॥૫॥ કે જરે લાઈ. પે
લા કરતા જુગમાં પેહ્ર કરોડી॥ તેથી નરસાઈ નાં તને
ધાઆ॥૬॥ કે જરે લાઈ પાંચ કરોડીને સરગ દોવા
રા॥ને રઘુવેદને વાલકે માલા॥૭॥ કે જરે લાઈ પાં
ચ કરોડીના પેરલાન રાજા॥ તેણે હોળીનાં આપ
સોંપાવા.॥૮॥ કે જરે લાઈ બીજા ત્રેતા જુગ માં છે

ઉવીસ કરોડી ॥ શ્રીશોભ નોંત્તને ધાત્મા ॥૯॥
કેજરે લાઈ ॥ ચઊદ કરોડી નાઆપ જુરાદા ॥ જેણે
ગોર વલે સરપેનાવાલેક નાત્તાંના ॥૧૦॥ કેજરેલાઈ
સાતકરોડીના રાજાહરીચંદ ॥ જેણે કાસીખંડ જાંઆ
પેવેમાઆ ॥૧૧॥ કેજરેલાઈ. ત્રીજા દોવાપરજુ
ગત્તાં ॥ સત્તાવીસ કરોડી. શ્રીકાંન નોંત્તને ધાત્મા ॥
॥૧૨॥ કેજરેલાઈ. અઢાર કરોડી તેત્તાં આપત્તો
રાદા ॥ જેણે ગોર વીદર વેઆસના વાલેકનાત્તાં
ના ॥૧૩॥ કેજરેલાઈ: નવકરોડીના સરગદોવારા ॥
સોત્તવેદને વાલેકે ચાલા ॥૧૪॥ કેજરેલાઈ. નવકરો
ડીના જુજેસટપરાજા ॥ જેણે હીંત્તાપે હાડ ગલાવા ॥ ૧૫॥
નવકરોડીના સરગદોવારા ॥ જે સાંત વેદનેવાલેકે ચાલા. ॥૧૫॥
॥૧૬॥ કેજરેલાઈ. આજ કળજુગત્તાં ॥ આજ છત્રીસ
કરોડી ॥ તે નર ઈસલાંમ સાહેને ધાત્મા ॥૧૭॥ કેજરે

૮ લાઈ. ચોવીસ કરોડી તેનાં આપનોરાદા ॥ જેણે
ગોર સોહરદીનના ચાએક નામાંના ॥૧૮॥ કે જીરે લા
ઈ ॥૧૯॥ કે જીરે લાઈ. બારકરોડીના સરગ દેવારા ॥
તે અપર વેદને વચંને ચાલા ॥૨૦॥ કે જીરે લાઈ.
બાર કરોડીના ગોર સોહરદીન ॥ જેણે દેરો યા પાર
ઉતારા ॥૨૧॥ કે જીરે લાઈ. પ્રહેલાદ ચેલા નાંહે અ
નેક કરોડી ॥ ધણી નાહંજાદ સાહા તારણ લાવે
આવ્યા ॥૨૨॥ કે જીરે લાઈ. ગેનાંન અનીરસ લણે
એહરેઈ નાંનસાહા ॥ કહે ડીસવારડીએ ચડસો ॥
॥૨૩॥ ॥ ॥ શ્રી સતગોરદીનાંનસાહા વાચ્યા ॥
કે જીરે લાઈ. તોતોને રૂપે સરોને પાયા કીને ॥ નો
ડીને ડીને જીવની સાર ॥૧॥ કે જીરે લાઈ. પછે
પડીદેપા ચાલો હો ભાવે ॥ નો કે પસે વરણ અઢાર.
॥૨॥ કે જીરે લાઈ. સેસ નાગ દરની નો લારે નાથીયા ॥

2010 Before -Satpanth Manuscript 26 (176)

તારે હોઈ રહેસે હલહલ કાર ॥૩॥ કેજીરે લાઈ.
નગરકોસી ડુંગર ખરીયાં તોરે જાસે ॥ તો તીર્થો સેન
ગર પજાર ॥૪॥ કેજીરે લાઈ નગરપતી છત્રપતીના
ઠાહો ફરસે ॥ તારે નહી કોઈ રાજાનું રાજ ॥૫॥ કેજીરે
લાઈ. દાટેલી લખ્મી પરગટ હોસે ॥ તે જઈ ચડસે
દાણવો ને હાથ ॥૬॥ કેજીરે લાઈ. સીંમણહારાને
સાંસાહો પડસે ॥ તારે નહી ઘરે જાદ સોંદ ને દેદાર ॥
॥૭॥ કેજીરે લાઈ. જંબુદીપ જાંગડગડે દદાંજા ॥
સરવે વરાંગ હોસે એકાકાર ॥૮॥ કેજીરે લાઈ.
જંબુદીપે સેવા હો જાગી ॥ કુંની વર પાઓ હું સીઆર.
॥૯॥ કેજીરે લાઈ. ત્રેતાજુગ નાં તાંજેલાં પ્રગટ હો
સે ॥ તો આન કુપા દસ તો અબલાર. ॥૧૦॥ કેજીરે
લાઈ. ગીનાંન અતીં રસ બોલા ગોરઈ જાંજાસાહા. ॥

ना रान रुषीघेर डरसे ॥१९॥ ॰॰॰ ॥ गेनांन
॥३॥ केजरे लाई · पुसनरु पगी पगी पंगीनपाङा ॥ प
ण ईलला लेहना पाञा ॥१॥ केजरे लाई · नहं
नह ईलल्ला आपे धणी छी ॥ तजेहीलजांङरोनेवी
चारजी ॥२॥ केजरे लाई · नहंनह ईलला दील
पीवीसारा ॥ सो सब दुनीआं धंधे लुली ॥३॥ केज
रे लाई धरती नाहोती ॥ आसमांन नाहोना ॥ ना
रे नाहोता परथवी नाआ ॥४॥ केजरे लाई मेघ
नाहोता · सुरज नाहोता ॥ तारे नहंनह नोंनअर
से लेआञा ॥५॥ केजरे लाई · अ सप आपणाही
ल नांपीङाछे ॥ तजे धणी नहंनह साहाने आरा
धो ॥६॥ केजरे लाई · डरागी आपणी सापेआ
वे ॥ तोहां बीलु डोई अंत ना आवे ॥७॥ केजरे

તાહે. સતપંથ આપણો સાચો કરી જાંણો ॥ તો
સતગોર પરમાણ એમ કહાવે ॥૮॥ કે જીરે ભાઈ.
એોલખ ગેનાંન રુપીરુપી પાકા ॥ તેહે તત દીલ લાવી
સારા ॥૯॥ કે જીરે ભાઈ । જુગજુગનના ગંગાજો
ભુલા ॥ તિસુ આવા સંસાર ॥૧૦॥ કે જીરે ભાઈ. પાપ
ડી પેખા તાંહે સંતાપી નેઆલો ॥ આપણા સાહે
બ સાહેબ નાંમ આરાધો ॥૧૧॥ કે જીરે ભાઈ. પ
રતગ ભેસો વીરા તજો ॥ તો જુગજુગ તજવાન હોસે ॥
॥૧૨॥ કે જીરે ભાઈ. ગેનાંન અમી રસ બોલા ગોર
ઈમાંમસાહા ॥ તેતો સાચુ કરી જાંણો મુંનીવર ભાઈ
જી ॥૧૩॥ ગેનાંન સંપુરણ છે ॥ ૦ ॥ ગેનાંન
હરીચંદ પરીનુ લખું છે ॥ શ્રી સતગોર સહેદેવ
વાચા ॥ હરીચંદ પરીવર આવાલોજીએ ॥ અનેરી
જુગ વરસેવા ॥ પરંત સો અપર લખીયો ॥ તારો
સતગોર કહે તે દેવ ॥૧॥ સતગોર નુર નુરી આ ॥

४

अने तेकेन पेरे जेनपे॥ तेनापेडपेडरे ईस
दरतीआ॥ तेना जीव अनतरापेर नाटे ॥२॥
अेवी अंतर गोर अंतरापरी॥ अने तने सतगो
र छोगे कोले॥ जे सहीन पडे पसतावको॥ नाई नी
सहीन नाहाईन नाही॥३॥ तने कोरे जीओ वं
ण सांतपे॥ अने ओपा करणी करजो॥ करणी
नांसो नो छोडजी॥ नहीं तो रेहेसो दुपज नोटे॥
॥४॥ भाई कोई अती जगजीवसो॥ जेने ठो
रो अडआवे॥ हहाडे फरेनी छोडेजी॥ भाईने ले
तुडी ऊपरपाटे॥५॥ सुधवीनो नजरो फरे ना
ओपणे आवा स्वांमीजीनो अवतार॥ कोले आ
ओले वाला ओपणे साहेबा॥ जे पडल रहो सो
ओधार॥६॥ अणे सतीले सत ना छोडीआ॥
तेने सांई आ सापेनहे॥ सतगोर बेली आगपे

હોસે ॥ અને તારો સાંઈ આના દે વે છેહ ॥૭॥
હું બલીહારી ગોરનર આપણા ॥ અને દીનરાત
અનંત નવાર ॥ ગોર નાંગસ ફરીદેવ કરે ॥ ગુર
ને કરનાં નાલાગે વાર ॥૮॥ અદલાખ વરસનો
એક દહાડલો ॥ અને આખીરીતનનાં નાનીંશાત ॥
તારો સચાંનીજ લેખું પુછસે ॥ અને તાંહાંડાગ
લેઈસે હાપ ॥૯॥ ગડ આલે તોપી સાંઈઓના
રોસને બેઠા ॥ અને સચાંનીનો નાંબુદીપનાંયા
સ ॥ તારો સચાંનીજ ઢોયોને ગતપીએ ॥ સત
ગોર સહેદેવ સીંચણહાર ॥૧૦॥ ૐ ॥ શ્રી
સતગોર બરના વા ચા ॥ નીડાં નીડાં બોલો
વીરાભાઈ નની નનીંયાલા ॥ તો લોને ગેનાંન
સનેહાજી ॥૧॥ મંદરનાપોલા વીરાભાઈ કાઢીરે

नांखो । तो नारगे आलो वीरालाई देहाणे ॥२॥
१२ जुजनले वीरालाई आपे जेन नारे ॥ तेणिने नर
गा वीरा लाई डेपाणे ॥३॥ जुनीवरनेने वीरा
लाई दुरां दील सोधे ॥ तो लुलडा जवोने नारगे ला
वेणे ॥४॥ जुनीवरनेने डोई पंड नांहे जोयो ॥ तेनो स
ही अंतरापेर जावेणे ॥५॥ डायीडायी डाआडे रागरला
नाडीने ॥ तो ढथी ढथी जासे तोरी देहाणे ॥६॥
ढथी ढथी पडसे वीरालाई गपीडरी जासे ॥ तो
डोडग वरणीं तोरी देहाणे ॥७॥ नीटी नांहे नीटी
नारी लपी डरी जासे ॥ तो डलर आसे तोरी देहाणे
॥८॥ हाडडडा ऊपेर वीरा पवंन जुरंगो ॥ ऊपेर
जींगा जींगा वरसेना नेहाणे ॥९॥ पुत्रपीआ
रा नारे डहलाछे डारजुं ॥ तो ए घर दोवार छोडावाणे ॥
॥१०॥ ए घर पीरालाई ने नहीं छोडेगा हारा ॥

તેનો નીસરે હોજડ જાવેજી ॥૧૧॥ કોનના બે
રા એની સુરત ના સાંભળે ॥ તે ઊને સોસોધણે
રાસુ કહીએ જી ॥૧૨॥ એધાને જેમ ચોદરણા ॥
કાંઈ નજરે ના દેખે ॥ તેને કહીએ તો એ નાપતી
જેજી ॥૧૩॥ આછો આછી કરણી કરતા આશ
એ સરખીરા ॥ તો સે સત્ર ઘણાં ફળ તળેલેસો
જી ॥૧૪॥ ગેનાંન અંતીરસ લાગે એહરે ઈજાંન
સાહા ॥ તારા સવાંજીજી સુ હેત હરી આપીજી ॥
॥૧૫॥ ગેનાં નસેપુરણ છી ॥ લુલ ચુક સુધા
રીયાંરસો ॥ ॥ દા॰ લલુ દેવજી લાઈ ::

૧૩૩	૧૪૨	૧૫૩	પ્રાતાપીતને લાનૂ છે લખાને
૧૬૨	૧૭૨	૨૧૩	તેના પાદી શ્રી તા. શ્રીસ
૧૪૨	૪૦૩	૪૧૨	ના ડ રે ના ને લાનાંશ્રી

પ્રાનત્ર પાપાનૂ છે

૬	૬	૬	૬					
૬	૬	૬	૬	૮	૬	૩	૨	તા. લખાને
૬	૬	૬	૬	૮	૫	૩	૨૧	મરદના પાદીશ્રી
૬	૬	૬	૬	૨	૭	૨	૧૨	તા. શ્રીસ્ત્રી પુત્ર પ્રા
પ્રાનત્ર પાપાનૂ છે				૨૨	૭	૯	૧૭	શ્રી

૭	૧૫	૨	૧૦	તા. પ ૮ લખાને શ્રીસ
૬	૩	૮	૩	ત્રી ને પાદી શ્રી તા. મ
૧૬	૧૨	૧૪	૩૧	રપાર પે સ્રપાશ્રી
૨	૫	૧૨	૪	

संवत १९२८ फुटनी महिना
वतछे

जोन्ता पाला डाना रूपयामां

११८३ रूपया

वेप मां पइसा ना

४४८० को रूपया मा

नाना कुपा पंजोडना

४८०४ कु रूपया

२५४५१

१२

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]

[illegible]

[illegible]



[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]) 2

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] 2) 3) [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]



[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

अरनवाधात्मु [illegible] त नेहप्रागापीईवा
गतद्रुजाम्प घ्रेरा र मर
मृत्युधृ धृ घो रात्प्रध मर
प्यार सदुप्रर नीउ धीप (१७) २
यनजु दुनी गरद्रु [illegible]
नी हैतेलतेलर्न १० तां। १२
ना तेःप्रागापी इरवा

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com


realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com